

શ્રી કચ્છી સમાજ - અમદાવાદ દ્વારા પ્રકાશિત પ્રત્યેક કચ્છી પરિવારનું મુખ્યપત્ર



કચ્છ્યુતિ

❖ પાણા નં. : ૧ ❖ કુલપેજ : ૪૦

❖ વર્ષ : ૨૮ ❖ અંક : ૫ ❖ ૧૫ નવેમ્બર, ૨૦૧૪ ❖ પ્રસિદ્ધ કર્યા તા. : ૧૦-૧૧-૨૦૧૪ ❖ કિંમત : રૂ. ૩/- ❖ ટ્રંગી : ભરત ઓળા સાહિત્ય : દિલેશ માંકડ

પક્ષી અભ્યારણ્ય - થોળ



*All things will be destroyed with  
time but time never just like...*

*Let's Move towards Nature...*



## ⌚ ACTUAL SITE PHOTOGRAPHS ⌚



**CLUB HOUSE**



**CHILDREN PLAY AREA**



**RESTROOM IN CLUBHOUSE**




**INDOOR GAMES**



**SWIMMING POOL**



**JOGGING TRACK**



- ➡ Located in just 10 minutes away from TATA NANO, FORD, P. & G., PEUGEOT, HITACHI.
- ➡ 20 Minutes Drive From Ahmedabad.



**Developer:**

**Shashwat Realtors**

Hasmukh Patel: 9879608051,  
Vinod Patel: 9879608054,  
Anupam Patel: 9879608057.



**Site Address:-**

**Shashwat Green**

Village : Makhiyav, Nr. Mankol Cross Road,  
Sanand - Nalsarovar Road, Dist.: Ahmedabad.

<b>વર્ષ-૨૮ ★ અંક-૫</b> <b>૧૫ નવેમ્બર, ૨૦૧૪</b>
<b>માનદ સલાહકાર</b>
<b>શ્રી હંસરાજ કંસારા</b>
<b>તંત્રી મંડળ</b>
<b>શ્રી ભરત ઓગા - મુખ્ય તંત્રી</b> મો. ૮૮૨૪૭૧૪૮૩૩ Email : ozabvo@gmail.com
<b>શ્રી દિનેશ મંકડ - સહ તંત્રી</b> મો. ૮૮૨૭૫૬૦૮૭૮ Email : mankaddinesh1952@gmail.com
<b>વ્યવસ્થાપક સમિતિ</b>
<b>શ્રી મનુભાઈ કોટડીયા - કંનીનર</b> મો. ૮૬૦૧૨૭૫૦૭૮ <b>ડૉ. મુકેશ ચૌહાણ - સહ કંનીનર</b> મો. ૮૮૨૪૪૭૮૭૮૮૮
<b>★ વિભાગીય સંપાદન ★</b>
<b>મહિલા વિશ્વ - રેખાબેન શુક્લ</b> <b>ગાંધીનગર ગાથા - વર્ષાબેન મહેતા</b> <b>શાદે શોધ - પ્રદીપ જોધી-આદિપુર</b>
<b>પત્ર વ્યવહારનું સરનામું</b>
<b>શ્રી કચ્છી સમાજ - અમદાવાદ</b> ૮૦૫, સ્પાન ટ્રેડ સેન્ટર, કોચરલ્ય આશ્રમની સામે, એલીસભીજ, અમદાવાદ-૬. ફોન : (કચ્છી સમાજ) ૦૭૯-૨૬૪૭૬૧૮૪ Email : kutchshruti@yahoo.com
<b>◆</b> <b>Kutchshruti Available on</b> <b>www.asanjokutch.com</b>
<b>કચ્છશ્રુતિ લવાજમ</b>
<b>૨ વર્ષ : રૂ. ૫૦૦/-</b> <b>૫ વર્ષ : રૂ. ૧૦૦૦/-</b> <b>આજીવન : રૂ. ૧૫૦૦/-</b> <b>ચેક/ડ્રાફ્ટ : શ્રી કચ્છી સમાજ - અમદાવાદ'ના</b> <b>નામનો મોકલવો.</b>
<i>'કચ્છશ્રુતિ'માં પ્રકાશિત રચના-લેખ આદિમાં અભિવ્યક્ત વિચારો, માહિતી ઈત્યાદિ સાથે 'કચ્છશ્રુતિ' સંપાદન મંડળનું સહમત હોતું આવશ્યક નથી.</i> <i>- મુખ્ય તંત્રી</i>

## આ અંકમાં...

- ❖ તંત્રીની કલમે ..... ૪
- ❖ ખખર પત્રિકા (ધનશ્યામ ટક્કર) ..... ૫
- ❖ કચ્છશ્રુતિના 'કચ્છી કંપા વિશેષાંક'ના વિમોચનનો અહેવાલ (ભરત ઓઝા) ..... ૬
- ❖ શ્રી કચ્છી સમાજ - અમદાવાદના ફંડ રેઝિઝિંગ કાર્યક્રમ નિમિતે હિનોટીઝમ શો - અહેવાલ (ભરત ઓઝા) ..... ૭
- ❖ કચ્છ માટે નર્મદા યોજના જીણ વ્યવસ્થાપનના પ્રશ્નો (અશોક મહેતા) ..... ૮
- ❖ સ્વચ્છ પર્યાવરણ અને પ્રદૂષણ નાખૂંદી અભિયાન (પ્રા. સૂર્યકાંત ભક્ક) ૧૧
- ❖ મોહમ્મદ રફી - સદાબહાર ગાયક (ઇન્દ્રવદન અંતાણી - ગાંધીનગર) ... ૧૩
- ❖ ડાયાબિટીસ વિશે આટલું જરૂર જાણીએ (ડૉ. મંકડ કિશોરચંદ્ર છાયા) .. ૧૭
- ❖ નાળિયેરી - ૨ (દિલીપ વેન્શવ) ..... ૨૩
- ❖ કચ્છમાં રાજશાહી સમયની નાગરી પરંપરા મંગળા આરતી આજપર્યત કાયમ છે (ડૉ. મિહિર એમ. વોરા) ..... ૨૫
- ❖ મૌલિક વાર્તા : અનુભેન ગરણીયાળા (બલવીરસિંહ જાડેજા) ..... ૨૬
- ❖ શાબ્દની કમ્પ્યુટરાફી - (૮) (તુલસીદાસ કંસારા) ..... ૨૮
- ❖ કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ (શશીકાંત ટક્કર) ..... ૩૦
- ❖ શ્રી કચ્છી સમાજ - અમદાવાદનો ટૈનિક અહેવાલ ..... ૩૧
- ❖ ગાંધીનગર ગાથા (શ્રીમતી વર્ષા જે. મહેતા - ગાંધીનગર) ..... ૩૩
- ❖ મહિલા વિશ્વ (રેખાબેન શુક્લ - અમદાવાદ) ..... ૩૪
- ❖ કલરવ (દિનેશ મંકડ - અમદાવાદ) ..... ૩૬
- ❖ શાબ્દ શોધ : ૩૧ (પ્રદીપ જોધી - આદિપુર) ..... ૩૮

## તંગીની કલમે....

— ભરત અલોઝ

**આવો, આપણે શ્રી કચ્છી સમાજ - અમદાવાદના તથા  
તેના માસિક મુખ્યપત્ર “કચ્છશ્રુતિ”ના સભ્ય ના બન્યા હોઈએ તો વહેલી તકે બની જઈએ**

હાલની પરિસ્થિતિમાં કાયદાકીય રીતે કચ્છ એ ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. પરંતુ વાસ્તવિક રીતે એ એક પ્રદે કહેવાય. રાજી હી વખતની ગુજરાતની જૂની ઓળખ તાજ કરીએ તો તે ત્ર ભાગમાં વહેંચાયેલું હતું - ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. કચ્છ એ ગુજરાતનો સૌથી વધુ અધિતત્ત્રસ્ત પ્રદે. મોટાભાગના વર્ષો દુષ્કાળના જતા હોવાથી અને રાજી હીના જમાનાની સંકુચિત દર્દિના કાર્ય તેનો વિકાસ થઈ કેલ નહીં. અનેક લાગાઓ ભર્યા બાદ જ ખેતરમાં પકવેલું ધાન ખેડૂત ઘરે લઈ જઈ કરા. પરિ મે પ્રજા ગ્રાહિમામ પોકારી જતી. રોજરોટી માટે પ્રજાને કચ્છ બહાર નજર દોડાવવી પડતી. જાંજીબાર, ૮૮૨, મસ્કત, આફ્રિકા જેવા દૂરના પ્રદે માં અથવા તો મુંબઈ, ચેનાઈ જેવા નજીદીકના પ્રદે માં જઈ પ્રજા પોતાનું નસીબ અજમાવવા લાગી. સ્વભાવે ખડતલ પ્રજા જ્યાં વસી, ત્યાં બે પાંદડે સુખી થઈ રહેવા લાગી.

બે પાંદડે સુખી થયા પછી પોતાનું નામ જ્ઞાતિમાં ગવાતું રહે એ લાલચ દરેકની ખરી. પરિ મે નાના સમુદ્દરને અનુરૂપ કામો હોંએ હોંએ થવા લાગ્યા. સમગ્ર પ્રદે નું જીવન બદલી નાખે તેવી ઈચ્છા ક્રિત કોઈમાંયે પેદા થતી નહીં. પરિ મે રાજકીય તોતે સેવા કરવાની ભાવના જાગૃત ના થઈ કી. મુંબઈના વિવિધ ઘટક સમાજોની કામગીરી, અમદાવાદના વિવિધ ઘટક સમાજની કામગીરી, સાબરકાંઠાના કચ્છી કંપાઓની કામગીરી કે યુરોપ - અમેરિકાના જેન સમુદ્દર કે સ્વામિનારાય સંપ્રદાયની કામગીરી તેના જવલંત ઉદાહર છે. એકાદ મંદિર, હોસ્પિટલ કે જીના ઊભી કરી દીધી! તેના અસ્તિત્વ માત્રથી જ સંતોષની પૂર્તાએ પહોંચી ગયા! વિકાસની પરાકા થી મન તૂમ બની ચૂક્યું. સારાયે સમુદ્દરને અસર પાડી કે તેવી કામગીરી પર નજર જ ના પડતી. પરિ મે સંગઠિત તોતે કે જે સેવા કરવાનું એક અંગેડ ક્ર છે, તેનાથી કચ્છી પ્રજા દૂર જ રહી!

રાજકીય તોતે એ સેવાનું મોટામાં મોટું સંગઠિત તોતે છે. આ તોતે દ્વારા કરવામાં આવેલ સેવા સારાયે સમુદ્દરની જિંદગી બદલી કે છે. વિકાસના કાર્યો, ઈન્ફારસ્ટ્રક્ચર સર્વિસ વગેરે સેવાના કાર્યો આ તોતે દ્વારા જ હાંસલ થઈ કે. પરંતુ તે માટે સંગઠિત ક્રિત જોઈએ. નાના સમૂહમાં વિભાજાયેલ અસ્તિત્વનું બળ ખૂબ જ નાનું પડે.

ઘટક સમાજને સર્વસ્વ માનવાને બદલે અગર આપું એક સમાજ તરીકે - કચ્છી સમાજ તરીકે ઉભરી ક્રિએ તો સંગઠિત ક્રિત ઘડુંયે હાંસલ કરી કે! પરંતુ તે માટે જરૂરિયાત રહે મજબૂત ઈચ્છા ક્રિતની! મજબૂત ઈચ્છા ક્રિતનો કોઈ જ વિકલ્પ નથી!

આવો, આપું કચ્છી સમાજને મજબૂત બનાવવા પ્રયાસ કરીએ. ■

**સુખ કદાચ બધાના નસીબમાં નથી હોતું અથવા જેને માણસ પોતે સુખ માનતો હોય  
એ અને મળે જ અનું નિશ્ચિત નથી. પરંતુ શાંતિ મેળવવી માણસના પોતાના હાથમાં છે.  
સુખ પાછળની દોટ જ્યાં અટકી જાય છે, ત્યાંથી જ શાંતિનો વિસ્તાર શરૂ થઈ જાય છે.**



## ખબર પત્રિકા



“ખબર પત્રિકા” એટલે એક નાની સમાચાર પત્રિકા કે જે કચ્છીઓના દરરોજના સમાચાર અમદાવાદ સ્થિત દરેક કચ્છીના ઘરે સવાર સવારમાં વર્તમાનપત્રની માફક પહોંચી જાય. ભર , પ્રાર્થના, શ્રદ્ધાંજલી સત્તા, નવું જન્મ, સગપ , લગ્ન, સરનામામાં ફેરફાર, ધંધાકીય નવું સાહસ, ઉદ્ઘાટન, ઉત્સવ, તહેવારની ઉજવ ૧ વગેરે પ્રકારના દરરોજના સમાચાર અમદાવાદ સ્થિત દરેક કચ્છીના ઘરે આ ખબર પત્રિકાના માધ્યમથી પહોંચાડી કાય. અગાર આ પ્રકારની પત્રિકા અમદાવાદમાં શારૂ કરવામાં આવે તો અમદાવાદ સ્થિત લગભગ ૫,૦૦૦ કચ્છી ઘરો એકબીજા સાથે એક તાંતણે બંધાઈ શકે.

મુંબઈમાં આ પ્રકારની પત્રિકા બહાર પડે છે. શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન ભાઈઓ સંગઠિત થઈ આવી ખબર પત્રિકા ૫૦થી ૫ વધુ વર્ષથી એકઘારી રીતે બહાર પડે છે. અત્યારે તેની લગભગ ૪૨,૦૦૦ કોપીઓ બહાર પડે છે. વર્તમાનપત્રની સાથે સાથે આવી ખબર પત્રિકા કચ્છી વીસા ઓસવાળ જૈન ભાઈઓને ત્યાં સવાર સવારમાં જ પહોંચી જાય છે. તેનાથી જ્ઞાતિના દૈનિક સમાચાર લોકોને મળે છે. તેના પરથી દૈનિક કાર્યવાહીનો પ્રારંભ ૫ થાય છે.

તેમાં પ્રસારિત કરવામાં આવતા કોઈ ૫ સમાચાર નજીવા દરે પ્રસારિત કરવામાં આવે છે. તેથી તે દરેકને પરવડે છે. તેથી દરેક કુટુંબ પોતાને ત્યાંના જન્મ, ભર , સગપ , લગ્ન વગેરે પ્રકારના દરેક સમાચાર આ ખબર પત્રિકાના માધ્યમ દ્વારા ઘરે ઘરે પહોંચાડી કે છે. સંસ્થાકીય સમાચાર ૫ તેમાં પ્રસારિત થઈ કે છે.

એક અંદાજ મુજબ લગભગ ૫,૦૦૦ કચ્છી પરિવારોનો અમદાવાદમાં વસવાટ છે. અગાર દરેક પરિવારને આ ખબર પત્રિકાના માધ્યમથી સાંકળી લેવામાં આવે તો દરરોજના કચ્છીઓના સમાચાર દરેક કચ્છીના ઘરે પહોંચાડી કાય અને તે ૫ ખૂબ જ નજીવી કિંમતે. દૈનિક રૂ. ૨/- જેટલો ખર્ચ કદાચ દરેક કચ્છી પરિવારને પરવડી કે.

અમદાવાદમાં દૈનિક કચ્છી ખબર પત્રિકા રૂ કરવી એ અધરું કાર્ય હે પરંતુ અ કય નથી.

તે માટે સંપૂર્ણ માળખાની રચના કરી કાય.

દરરોજના સમાચાર દરરોજ પ્રસારિત કરી કાય.

વર્તમાનપત્રની સાથે સાથે ખબર પત્રિકા ૫ ઘેર ઘેર પહોંચાડી કાય.

પત્રિકા મેળવનારને દૈનિક રૂ. ૨/-થી વધુ ખર્ચ ના થાય તેવું માળખું ગોઠવી કાય.

તે માટે આપ સહુનો સહકાર અનિવાર્ય બની રહે.

આ બાબતના, આપશીના મંતવ્યો આવકાર્ય રહે.

મંતવ્યો મળ્યેથી કાર્યવાહી આગળ ચલાવી કા.

**ધનશ્યામ ઠક્કર**

કન્વીનર - ખબર પત્રિકા સમિતિ

શ્રી કચ્છી સમાજ - અમદાવાદ

મા પોતાના સંતાન માટે ઉજાગરા કરે છે. પોતે ભૂખી રહીને અને ખવડાવે છે, અને લાડ કરે છે. એ જ માં એની ભૂલ થતાં થપ્પડ પણ મારે છે. જ મા પૂરેપૂરી લાગડીથી અને માટે એનાં ભાવતાં ભોજન બનાવે છે, એ જ મા બાળકની બીમારીમાં અને કડવી દવા ફૂર થઈને પીવડાવે છે.

## કચ્છશ્રુતિના “કચ્છી કંપા વિશેષાંક”ના વિમોચનનો અહેવાલ

શ્રી કચ્છી સમાજ - અમદાવાદના માસિક મુખ્યપત્ર “કચ્છશ્રુતિ”નો દીપોત્સવી વિશેષાંક “કચ્છી કંપા વિશેષાંક” તરીકે બહાર પાડવામાં આવેલ કે જેનું વિમોચન રવિવાર, તા. ૧૮-૧૯-૨૦૧૪ના રોજ ટાઉન હોલ - અમદાવાદ ખાતે ફેડ રેઇઝિંગ કાર્યક્રમ નિભિતે ડૉ. પ્રાણ ભીમા જેના હિખોટીએ ના સમયે રાખવામાં આવેલ.

વિમોચન સમયે મંચ પર ખેડુભ્રાન્થી પધારેલ શ્રી જેઠાભાઈ ખેતાભાઈ પટેલ, શ્રી રાજભાઈ ખેતાભાઈ પટેલ, શ્રી ખીમજીભાઈ રામદાસભાઈ પટેલ, શ્રી વિહૃલદાસ કાનજીભાઈ પટેલ તથા શ્રી સુરે ભાઈ એન. પટેલની સાથે શ્રી કચ્છી સમાજ - અમદાવાદના પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી મનસુખભાઈ પટેલ તથા શ્રી કેલાસદાન ગઢવી ઉપસ્થિત રહેલ હતા. સાથે સાથે સમાજના હાલના પ્રમુખ શ્રી અ કેભાઈ મહેતા, માનદુ મંત્રી શ્રી ભરતભાઈ ઓજા તથા ખજાનચી શ્રી મનુભાઈ કોટડિયા પ ઉપસ્થિત રહેલ હતા. મંચનું સંચાલન શ્રી હિમાંબાઈ ઠકરે કરેલ હતું. આ પ્રસંગે સમાજના આમંત્ર ને માન આપી, મોડાસાથી પધારેલ મહેમાનશ્રીઓ શ્રી જેઠાભાઈ ચ વરાજભાઈ પટેલ, શ્રી અમૃતભાઈ ભીમજીભાઈ પટેલ, શ્રી અંબાલાલભાઈ રામજીભાઈ પટેલ તથા શ્રી મગનભાઈ ગોપાલભાઈ પટેલ પ સભાગૃહમાં ઉપસ્થિત રહેલ હતા.

કાર્યક્રમની રૂઆતમાં સમારંભ પ્રમુખ શ્રી અ કે મહેતાએ જ વેલ કે આજથી ૧૦૦ વર્ષ અગાઉના સમય પહેલાં કચ્છમાં રાજ હીના સમયે દુષ્કાળની પરિસ્થિતિ તો વારંવાર રહેવા પામેલ હતી પરંતુ જે વર્ષ અનાજ પાકે ત્યારે ખેડુતોને પકવેલ અનાજ પરના અનેક લાગા ચૂકવી, બાકી બચી કેલ અનાજ જ ઘરે લઈ જવા મળતું. આ પરિસ્થિતિ ગ્રાસજનક અને અસહ્ય હતી. તેથી કેટલાક પરિવારો કચ્છમાંથી નીકળી કપડવંજ પહોંચ્યા અને સૌ પહેલાં ત્યાં કચ્છી કંપાની સ્થાપના કરી કે જે આજે “હરીપુરા કંપા” તરીકે જા રૈતું છે. આ રીતે કચ્છી પટેલોએ ધીરે ધીરે ખેડુભ્રાન્થી, ઈડર, વડાલી, વિજયનગર, હિમતનગર, ધનસુરા, મોડાસા, બાયડ, કપડવંજ, બાલાસીનોર, ડાકોર વગેરે વિસ્તારોમાં અનેક કંપાઓ વસાવી પોતાનો વસવાટ ચાલુ કરી દીધેલ છે. આ ક બી ભાઈઓ માત્ર દોરી-લોટો લઈને કચ્છથી આ વિસ્તારમાં આવેલ. ત્યારબાદ ધીમે ધીમે જમીન ખરીદતા ગયા અને જેતી કરતા ગયા. જેઠે દહાડે વર્ષમાં બે કે ત્ર પાક પ લેવા લાગ્યા. થોડા સ્થિર થયા બાદ પોતાના સંતાનોને ભ એવી આગળ વધાર્યા. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યું તો કોઈ વકીલ, ડોક્ટર કે એન્જિનિયર બન્યા. આ ભ બેલ વર્ગ ધીરે ધીરે હેરમાં વસવાટ કરવા લાગ્યો અને ભારતભરમાં છાવાઈ ગયા. તહુપરાંત આ પરિવારોએ પોતાની કર્મભૂમિમાં લાયાઓ, કોલેજો, મેડિકલ સેન્ટર, હોસ્પિટલ વગેરે સ્થાપી, સામાજિક સેવાથી પ સમાજનું નામ રો ન કરવા લાગ્યા અને સ્થાનિક સમાજોમાં પ ભળી ગયા. કચ્છ કડવા પાટીદાર પરિવારોની આ ય ગાથા જેટલી કચ્છી પટેલ સમાજને જ્ઞાત હે તેટલી કચ્છી જૈન, કચ્છી લોહા ૧, કચ્છી ભાનુ ૩૩ કે અન્ય કચ્છી સમાજોને નહીં હોય. તેથી કચ્છશ્રુતિ પરિવારે ‘કચ્છી કંપા વિશેષાંક’ બહાર પાડવાનું નક્કી કર્યું. જરૂરી માહિતી એકત્રિત કરવા માટે ખેડુભ્રાન્થાના શ્રી રાજભાઈ ખેતાભાઈ પટેલ, હિમતનગરના શ્રી બચુભાઈ ગોવિંદભાઈ પટેલ તથા કપડવંજના શ્રી જુભાઈ કે. પટેલનો ખૂબ જ સુંદર સાથ અને સહકાર સાંપડ્યો અને તેના પરિ એ આજે આપે અંદાજિત ૫૦૦ કંપામાંથી ૧૬૫ કંપાની માહિતી સાથેનો આ અંક બહાર પાડી કીએ છીએ. એકત્રિત માહિતીમાં કેટલીક અધૂરા કે અને પતિઓ રહી હોવાની સંભાવના નકારી કાય નહીં. જે બદલ માયાચના સાથે વાચકોને અનુરોધ છે કે તેઓશ્રીને જો કોઈ માહિતી દોષ / પતિ જ ય તો અમને જ વિવા વિનંતી.

ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા આ વિશેષાંકનું વિમોચન કરવામાં આવેલ હતું કે જેને ઉપસ્થિત સમુદ્દરે તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ હતું.

ખેડુભ્રાના ઉપસ્થિત મહાનુભાવો વતી શ્રી સુરે ભાઈ આચાર્ય પોતાની રસમીઠી જબાનથી અને ‘રો ધરી દ્વારા શ્રી કચ્છી સમાજ - અમદાવાદની આ પ્રવૃત્તિને હર્ષભેર વધાવી લીધેલ હતી અને ‘કચ્છી કંપા વિશેષાંક’ બહાર પાડવા બદલ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.

અંકની રૂઆતમાં વિવિધ લેખો દ્વારા આ પાટીદાર પરિવારો કઈ રીતે સાબરકાંઠા પહોંચ્યા અને કઈ રીતે તેઓ પગભર થયા તેના વિવિધ લેખો દ્વારા માહિતી આપવામાં આવેલ છે.

ત્યારબાદના વિભાગમાં ૧૬૫ કંપાના વિવિધ પરિવારોની વિગત, તેમની પાસે કેટલા એકર કે વીધા જમીન છે તેની વિગત, તેઓની પછીની પેટીના ચિનિત વર્ગની વિગત વગેરે પ્રકારની માહિતી આપવામાં આવેલ છે.

આ અંકના અંતભાગમાં નિયમિત પ્રસાર કરવામાં આવતી માહિતીનો સમાવે કરવામાં આવેલ છે.

ક બી પરિવારની ય ગાથા નિહાળવા કોઈ પ કચ્છીએ આ ‘કચ્છી કંપા વિશેષાંક’ પર નજર ફેરવી લેવી અત્યંત આવશ્યક છે.

**ભરત ઓળા**

માનદુ મંત્રી, શ્રી કચ્છી સમાજ - અમદાવાદ

## શ્રી કચ્છી સમાજ - અમદાવાદના ફંડ રેઝિંગ કાર્યક્રમ નિમિતે હિન્દોટીઝમ શો

● અહેવાલ ●

માનવ મનની ત્ર અવસ્થા - કોન્સિયસ, સબ કોન્સિયસ અને અનકોન્સિયસ. જાગ્રત, અર્ધ જાગ્રત અને સુષુપ્ત. માનવ મનને પારખવું અને તે પ વૈજ્ઞાનિક પદ્ધતિથી - તે કોઈ પ સામાન્ય મા સ માટે વિસ્મયજનક હકીકત બની રહે છે. મગજ અને મન બે અલગ અલગ બાબત છે. મગજની યાદ કિંતુ માનવના મનમાં ધરબાધેલ હોય છે. વર્ષો પહેલાના બનાવો તેના મનમાં સંગ્રહાધેલ રહેલ છે. એ બનાવો જાગ્રત અવસ્થા અથવા અર્ધજાગ્રત અવસ્થા દ્વારા બહાર આવી કે છે. હિન્દોસીસ એ માનવ મનની પ્રકૃતિને અર્ધજાગ્રત અવસ્થા દ્વારા બહાર લાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એ પદ્ધતિના દન વિ જી માનવ સમુદ્ધાયની વચ્ચે ડૉ. પ્ર હંત ભીમા જીના હિન્દોટીઝમ દ્વારા થાય છે.

એક મંચ પર ડૉ. પ્ર હંત ભીમા જી માઈક લઈને વચ્ચે ઊભા છે. તેમની ચારે તરફ પ્રેક વર્ગમાંથી સ્વેચ્છાએ આવેલ ૩૦-૪૦ વ્યક્તિઓ ખુર એ પર કુંડળામાં બેઠેલ છે. ડૉ. પ્ર હંત ભીમા જી તેમને ધ્યાનમાં લઈ જવા પ્રયાસ કરે છે. મનમાંથી બધા જ વિચારો કાઢી નાખવા અપીલ કરે છે અને તેઓ પ કે ૧૦ મિનિટમાં અર્ધજાગ્રત અવસ્થામાં પહોંચી જાય છે. જેઓ ખુર એ પર બેઠા છે, એ બેઠા બેઠા અને જેઓ ઊભા ઊભા છે તેઓ ઊભા ઊભા નિં. અવસ્થામાં પહોંચી જાય છે. તેમની ચારેબાજુ થતી ગતિવિધિથી તેઓ અજ્ઞાત બની જાય છે. તેમનું મન તં વસ્થામાં ચાલ્યું જાય છે. ડૉ. પ્ર હંત ભીમા જી બોલે તેટલું જ તેમને સમજાય છે. બાકીની દુનિયાથી તેઓ અલિમ થઈ જાય છે.

ડૉ. પ્ર હંત ભીમા જી સમજાવે છે કે આ એક વૈજ્ઞાનિક પ્રયોગ છે અને તે મનોવિજ્ઞાનના અભ્યાસને અંતે માનવમનને અર્ધજાગ્રત અવસ્થામાં લઈ જઈ તેના ધાર્યા પરિ જ્મો મેળવી કાય છે. ધ્યાનમાં જવું એ આ પ્રક્રિયાનો જ એક ભાગ છે. વિજ્ઞાન આધારિત હિન્દોટીઝમના પ્રયોગો બહુ જ ઓછા લોકોએ ભૂતકાળમાં નિહાળેલ હોય છે અને તેથી જ ટાઉનહોલમાં ઉપસ્થિત માનવ સમુદ્ધાયને જ્યારે આ જો બતાવવામાં આવ્યો ત્યારે દરેક વ્યક્તિ આ કાર્યક્રમ પ્રત્યે આશ્રયચક્રિત અને અભિભૂત બની ગયેલ હતી.

ટાઉનહોલના મંચ પર ડૉ. પ્ર હંત ભીમા જી કોઈને કિકેટના બેટ્ટસમેન બનાવે છે અને તે બેટ્ટસમેનની અદાથી અર્ધજાગ્રત અવસ્થામાં રહીને પ બોલને જોરદાર ફટકો મારતો હોય તેવી એક ન કરે છે. કોઈને બોલર બનવાનું કહે છે અને તે બોલીંગ કરે છે. કોઈને ટેબલ ટેનિસના ખેલાડી બનવાનું કહે છે અને તે પોતાના બેટથી રીતસરનો ટેબલ ટેનિસ રમતો હોય એ રીતે વર્તન કરે છે. કેટલાક લોકોને પાંચ વર્ષના બાળક, ત્યારબાદ ૧૦ મહિનાના બાળક અને ત્યારબાદ ૬ મહિનાના બાળક બની જવાનું કહે છે. એ વ્યક્તિઓને માત્ર પ્ર હંત ભીમા જીનો જ અવાજ સંભળાય છે અને ભૂતકાળમાં તેઓ પ વર્ષના, ૧૦ મહિનાના કે ૬ મહિનાના બાળક હતા, તેવું વર્તન કરે છે.

બે કલાકના વિવિધ પ્રયોગોના અંતે જ્યારે મંચ પરના આ યુવા, યુવતી કે પ્રૌઢને અર્ધજાગ્રત અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવી જવાનું કહેવામાં આવે છે ત્યારે તે જાગ્રત અવસ્થામાં તો આવી જાય છે પરંતુ બે કલાક દરમ્યાન અર્ધજાગ્રત અવસ્થામાં તેમે જે પ વર્તન કર્યું, તેની કોઈ પ પ્રકારની યાદગીરી તેમની પાસે રહેવા પામેલ નહોતી. એ વર્તનથી તેઓ સંપૂર્ણ અજ્ઞ હતા.

આ બધું જ અદ્ભુત છે. ખૂબ જ અદ્ભુત! આપે ક્યારેય પ આપ જી જીંગરીમાં આ વિસ્મયજનક બીના બનતી નિહાળેલ નથી કેમકે સાયન્સ - વિજ્ઞાનની આ જ્ખાનો જોઈએ તે માત્રામાં પ્રચાર જ થયેલ નથી. જાદુ કે મેસેરીઝમ જેવો આ કાર્યક્રમ નથી પરંતુ જુધ વૈજ્ઞાનિક પ્રયોગો આધારિત આ કાર્યક્રમ છે કે જે હોધને મહત્ત્વ આપી ભવિષ્યમાં તેના ખૂબ જ સારા પરિ જ્મો મેળવી કાય. વિજ્ઞાનના પ્રયોગો આ તોતે આગળ વધારી કાય.

શ્રી કચ્છી સમાજ - અમદાવાદ હંમેં કંઈક અવનવું પીરસવા તૈયાર હોય છે. તેની દર્દી વિ જી હોવાથી તે હંમેં સમાજને કોઈ ને કોઈ નવી વાનગી પીરસતો આવે છે. અને એ દર્દી એ અમદાવાદ સ્થિત સમગ્ર સમાજને જોડી રાખવા પ્રયાસ કરે છે.

શ્રી કચ્છી સમાજ - અમદાવાદ વિવિધ પ્રકારના સામાજિક કાર્યો આદરવા માટે તાજેતરમાં જ ૧૦-૧૨ સમિતિઓનું ગઠન કરેલ છે. આ સમિતિઓ પોતાના ત્રૈમાં રહીને વિવિધ કાર્યક્રમો આપે તેથી જરૂરી ખર્ચ થવો સ્વાભાવિક છે. અને તેથી રવિવાર, તા. ૧૮-૧૦-૨૦૧૪ના રોજ ટાઉન હોલ - અમદાવાદ ખાતે શ્રી કચ્છી સમાજ - અમદાવાદ દ્વારા એક ફંડ રેઝિઝિંગ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમ એટલે ડૉ. પ્રિંત ભીમા જીનો હિન્દોટીજમ મે. અમદાવાદ સ્થિત દરેક ઘટક સમાજની વ્યક્તિઓએ ઉમળકાબેર આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. લગભગ ૧૦૦૦ના સમુદાયે પોતાના તરફથી આ કાર્યક્રમના અનુસંધાને રૂ. ૨૫૦૦/-, રૂ. ૧૫૦૦/-, રૂ. ૧૦૦૦/-, રૂ. ૫૦૦/- કે રૂ. ૨૫૦/-ના અનુદાનની જાહેરાત કરેલ હતી કે જેના પરિ મે કાર્યક્રમના અંતે થોડું ફંડ એકત્રિત થઈ કેલ છે.

કાર્યક્રમની રૂઆતમાં સ્ટેજ ફંક ન યોજવામાં આવેલ કે જેનું સંચાલન સમાજના મંત્રી શ્રી ભરત ઓઝા તથા ટ્રસ્ટી શ્રી હિમાંજુ ઠક્કરે કરેલ હતું. મંચ પર સમાજના પ્રમુખશ્રી સાથે ખેડુબ્રહ્માથી પદ્ધારેલ મહાનુભાવો તથા કચ્છી સમાજ - અમદાવાદના પૂર્વ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. પ્રમુખ શ્રી એ કોક મહેતાએ રૂમાં ઉપસ્થિત સહૃદાનું સ્વાગત કરતા જ વેલ કે શ્રી કચ્છી સમાજ - અમદાવાદ આ કાર્યક્રમ તેના ફંડ રેઝિઝિંગ કાર્યક્રમ નિમિત્ત યોજેલ છે. ત્યારબાદ તેમ વિવિધ હકીકતો આપતા જ વેલ કે આજે અમદાવાદમાં કચ્છીઓના અંદાજિત ૫,૦૦૦ ધર (અંદાજિત ૨૦,૦૦૦ની વસ્તુ) હોવા છતાં આપ નાના - મોટા વિવિધ ઉપ જેટલા ઘટક સમાજોમાં વિભરાયેલા છીએ. એક ઘટક સમાજ એટલે સરેરા ૬૦૦ વ્યક્તિનું જૂથ, કે જે ન તો મોટા સામાજિક કાર્યો કરી કે, કે ન તો કોઈ રાજકીય પ્રભાવ પાડી કે. તેથી જ અમદાવાદ સ્થિત કોઈ ૫ કચ્છી ખુનિ. કોર્પોરિટર, એમ.એલ.એ. કે એમ.પી.ની પરિસ્થિતિએ પહોંચ્યા નથી. દરેક કચ્છીમાં નૂર હોવાના કાર તેઓ સ્વભાવથી અમદાવાદમાં પોતાના સંસ્થાન દ્વારા નામાંકિત કઢી કાય તે લેવલ સુધી પહોંચ્યી ગયેલ છે પરંતુ સામાજિક કે રાજકીય મોટો - એક સંગઠિત સ્વરૂપે રહી કેલ ન હોવાથી - મેળવી કેલ નથી. આ ઉ ૫ શ્રી કચ્છી સમાજ - અમદાવાદ પૂરી પાડી કે તેમ છે. અને તેથી જ દરેકને શ્રી કચ્છી સમાજ - અમદાવાદ તથા તેના મુખ્યપત્ર 'કચ્છશ્રુતિ'ના સભ્ય બની જવા અપીલ કરવામાં આવેલ હતી.

ત્યારબાદ 'કચ્છી કંપા વિખાંક' વિષેની માહિતી આખ્યા બાદ આ વિખાંકનું વિમોચન મંચસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ હતું. ખેડુબ્રહ્માના ઉપસ્થિત મહાનુભાવોમાંના શ્રી સુરે ભાઈ પટેલ આ સમગ્ર પ્રક્રિયાનો ખૂબ જ લાગ સેસભર અને રો યારીથી ભરપૂર પ્રતિસાદ આપેલ હતો. આભારવિવિ શ્રી ભરતભાઈ ઓઝાએ કરેલ હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરે ચં મહેતા, હાઈકોર્ટ જજ શ્રી સતીષભાઈ વોરા, સીમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી ધીરેન ઐ, નવનીત પ્રકા નના શ્રી અંતિલાલભાઈ ગાલા, હર્ષ એન્જિનિયર્સના શ્રી હરી ભાઈ રંગવાલા, દીપ ઈન્ડસ્ટ્રીઝના શ્રી અંતિલાલભાઈ સાવલા, પ્રેણા શ્રી અરુ ભાઈ પટેલ, રવિ ઈન્ડસ્ટ્રીઝના શ્રી અમિતભાઈ સુરા ઐ, જા તોતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી બી.કે. પટેલ, શ્રી કે.ડી. પટેલ, શ્રી એમ.જી. રંગા ઐ, શ્રી એસ.જી. પટેલ, અમદાવાદ સ્થિત વિવિધ કચ્છી ઘટક સમાજના પ્રમુખશ્રીઓ તથા અગ્ર શ્રીઓ વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમ માટે ડૉ. પ્રિંત ભીમા ઐ તરફથી શ્રી કચ્છી સમાજ - અમદાવાદને રૂ. ૨૫,૦૦૦/-નું અનુદાન જાહેર કરવામાં આવેલ હતું. તદુપરાંત શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ - ખેડુબ્રહ્મા હા. શ્રી રાજાભાઈ ખેતાભાઈ પટેલ તરફથી રૂ. ૧૧,૦૦૦/- તથા શ્રી ખીમજીભાઈ રાવદાસભાઈ પટેલ તરફથી રૂ. ૧૧,૦૦૦/-ના અનુદાનની જાહેરાત કરવામાં આવેલ હતી. શ્રી હરી ભાઈ રંગવાલા તથા શ્રી નવનીત પરિવાર તરફથી ૫ યોગ્ય સહકાર આ કાર્યક્રમ માટે સાંપડેલ હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ, માનદુ મંત્રીશ્રી, ખજાનયીશ્રી, ટ્રસ્ટી મિશ્નો તથા સંજ્યભાઈ રાહોડ, દીપકભાઈ ચૌહા, મુકે ભાઈ ચૌહા જહેમત ઉઠાવી હતી. સ્વયંસેવકો તરીકે શ્રી કચ્છી જેન સેવા સમાજની યુવા પાંખના શ્રી પારસ વીરાની ટામે ઉત્તમ સેવા આપી હતી.

ભરત ઓઝા  
માનદુ મંત્રી, શ્રી કચ્છી સમાજ - અમદાવાદ

## કચ્છ માટે નર્મદા યોજના જળ વ્યવસ્થાપનના પ્રેરણો

● અશોક મહેતા ●

કચ્છ બ્રાંચ કેનાલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના હમીરપર ગામ પાસેથી સાંકળ ઉટપ કિ.મી.થી રૂ થાય છે. તેની ઉપટ કિ.મી.ની લંબાઈમાં તે ૮૨ કિ.મી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટ જિલ્લામાંથી પસાર થાય છે. જ્યારે બાડીના ૨૭૫ કિ.મી. તે કચ્છમાંથી પસાર થાય છે અને માંડવી તાલુકાના મોડકુવા ગામ સુધી તેને લંબાવવામાં આવેલ છે.

આ કેનાલની રૂઆતની ડેપેસિટી ૨૨૦ કયુમેક્સની અને સાંકળ ૧૧૨ કિ.મી. એટલે કે પ્રથમ પમ્પિંગ સ્ટે નથી તેની ડેપેસિટી ૧૭૦ કયુમેક્સની રાખવામાં આવેલ છે.

કચ્છ માટે નિયમિત પા. ૧૦.૫ એમ.એ.એફ. અને વધારાના પા. ૧૧૦ એમ.એ.એફ. આ કેનાલમાંથી વહાવવામાં આવે.

નિયમિત પા. ૧૩૨૨૮,૦૦૦ એકરમાં સિંચાઈ થઈ કે અને વધારાના પા. ૧૩૨૮ હ્યાત જળા યોની યોજના દ્વારા અંદાજિત ૧૦ લાખ એકરમાં સિંચાઈ કરવાના આયોજનો વિચારવામાં આવેલ છે.

આ કેનાલના કાર્યો નર્મદા નિગમ દ્વારા માર્ય-૨૦૦૫થી રૂ કરવામાં આવેલ છે કે જે સામે આજ દિવસ સુધી ઉત્તર ગુજરાતના ૮૨ કિ.મી. સુધીના કામો કમ્પલીટ થયા છે અને ત્યાં સુધી પા. ૧૧૫ પંચ લાવવામાં આવ્યા છે. પરંતુ જ્યાં સુધી કચ્છ જિલ્લાનો સવાલ છે ત્યાં લગી તેના કામો અનેક સ્થળે ચાલુ છે પરંતુ તેના એક પંચ કિ.મી.માં પા. ૧૧૫ વહેવડાવી કાયેલ નથી. વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૪ એટલે કે ૮ વર્ષ પછી આ પરિસ્થિતિ છે. છેલ્લા ૪ વર્ષથી નર્મદા નિગમમાં કચ્છના પ્રતિનિધિ શ્રી મૂકે ભાઈ જવેરી ડાયરેક્ટર તરીકે બિરાજમાન હોવા છતાં, કચ્છ બ્રાંચ કેનાલની કચ્છમાં પ્રગતિની આ પરિસ્થિતિ રહેવા પામેલ છે.

કચ્છ બ્રાંચ કેનાલના કાર્યો પૂર્ણ કરવા આ અગાઉ અનેક જયુઅલ નક્કી કરવામાં આવેલ હોવા છતાં, એક પંચ જયુઅલ પ્રમાણે કામ થઈ કેલ નથી. કોઈ પંચ

પ્રોજેક્ટમાં અડચ હો તો આવે પરંતુ એ અડચ હોમાંથી બહાર નીકળવા સામાન્ય અધિકારી વર્ગ કોઈ પંચ સ્થળે દી ગોચર થયેલ નથી. છેલ્લા ૮ જ્યુઅલ પ્રમાણે માર્ય-૨૦૧૫ સુધી ચેનલ ૧૧૨ કિ.મી. પરનું પમ્પિંગ સ્ટે ન કાર્યરત કરવાના આયોજનો છે પરંતુ ત્યાં પ્રથમ તબક્કામાં જે પંપો બેસાડવામાં આવેલ છે, તેનાથી માત્ર ૦.૫ એમ.એ.એફ. નિયમિત પા. ૧૧૫ કચ્છમાં પહોંચાડવાના આયોજનો છે. જ્યારે વધારાના ૧.૦૦ એમ.એ.એફ. પા. ૧૧૫ પહોંચાડવા માટે આ પમ્પિંગ સ્ટે નમાં ન તો કોઈ પંપ બેસાડવામાં આવેલ છે કે ન તો તેના કોઈ આયોજનો વિચારવામાં આવેલ છે. જવાબદાર અધિકારીઓને આ અંગે પૂછવામાં આવે ત્યારે એવો જવાબ પ્રાપ્ત થાય છે કે આ અંગે અમારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.

સિંચાઈ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાની ગુજરાત રાજ્યના ૨૦૧૪-૨૦૧૫ ના બજેટ અગાઉ મુલાકાત લેવામાં આવી. તેમનો જવાબ હતો કે કચ્છને ફાળવાયેલ વધારાના પા. ૧૧૫ અંગેના કોઈ આયોજનો વિચારવામાં આવેલ નથી અને તેના માટે આ બજેટમાં કોઈ પંચ જોગવાઈ પંચ કરવામાં આવેલ નથી. જ્યાં લગી સૌરાષ્ટ્રના આ પ્રકારના ૩. ૧૦,૦૦૦ કરોડના કામો પૂરા થાય નહીં ત્યાં લગી કચ્છના કામો હાથ પર લઈ કા. ૧૧૫ નહીં. તેઓશ્રીને રૂબરૂમાં પૂછવામાં આવ્યું કે સૌરાષ્ટ્રના કાર્યો પૂરા કરવાના કું આયોજનો છે? તેમનો જવાબ હતો કે આ તબક્કે એ બાબત કું કહી કાય તેવું નથી. ગુજરાતના કોઈ પંચ નાગરિકને વિચાર કરતા કરી દે તેવો આ જવાબ છે! ગુજરાતના વધુમાં વધુ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર - કચ્છમાં કય ત્વરાએ પા. ૧૧૫ પહોંચાડવાના સ્થાને ગુજરાત સરકારની માનસિકતાના આ જવાબોમાંથી દાન થઈ કે તેમ છે. આ સવાલ-જવાબના કાર્યો કચ્છની પ્રજાની નર્મદાના પા. ૧૧૫ પરિસ્થિતીને નર્મદાના નિગમ તરફથી જ વિવામાં આવેલ નથી.

નિયમિત પા. ૧૧૫ માટે બનાવવામાં આવેલ કચ્છ બ્રાંચ કેનાલના દિયોદર તાલુકાના હમીરપરથી માંડવી તાલુકાના મોડકુવા સુધીના કાર્યો ક્યારે પૂર્ણ કરવામાં આવે તેના ચોક્કસ આયોજનો પંચ નર્મદાના નિગમ તરફથી જ વિવામાં આવેલ નથી.

ત્યારબાદની વાત કરીએ તો બ્રાંચ કેનાલ, સબ બ્રાંચ કેનાલ, માઈનોર કેનાલ કે સબસીડિયરી કેનાલના આયોજનો વિચારવામાં આવેલ નથી અને તેના કાર્યોનો આરંભ પ કરવામાં આવેલ નથી. પા રી મંડળીની રચના નિરથી ગયેલ હોતાં, કઈ રીતે ખેતર સુધી પા રી પહોંચાડવામાં આવે તે વિગતથી પ પ્રજાને અવગત કરવામાં આવતી નથી. માઈક્રો ખાનિગમાં નર્મદા નિગમ પાસેથી જે અપે રાખવામાં આવે છે તેમાં તે ઉ રી ઉત્તરી કેલ નથી. પ્રજાની દર્દી એ હાલે તો આ સંપૂર્ણ યોજના નિરથી સાબિત થતી દેખાય છે, અને તે પ રૂ. ૫૦ હજાર કરોડના આંધ પછી!

વર્ષ ૧૯૭૮થી વર્ષ ૨૦૧૪ એટલે કે છેલ્લા તુફાન વર્ષની કામગીરી બાદ ગુજરાતના કચ્છ પ્રદેશ માં તો નર્મદા નદીના નિયમિત પા રી કે વધારાના પા રીની આ પરિસ્થિતિ રહેવા પામેલ છે.

આપે કચ્છમાં પીવાના તથા ઉદ્યોગોને ફાળવવામાં આવેલ પા રીની વાત પર આવીએ.

કચ્છને ૦.૦૪૮ એમ.એ.એફ. પા રી પીવા માટે

અને ૦.૦૩૭ એમ.એ.એફ. પા રી ઉદ્યોગો માટે ફાળવવામાં આવેલ છે. તે માટે માળિયા બ્રાંચમાંથી ૧૫૦ એમ.એલ.ડી. પા રી પીવા માટે અને ૫૦ એમ.એલ.ડી. પા રી ઉદ્યોગો માટે, એમ દરરોજ ૨૦૦ એમ.એલ.ડી. પા રી પાઈપલાઈન દ્વારા વહાવવામાં આવે છે. પીવાના આ પા રી કચ્છના ૮૪૮ ગામ તથા ૧૦ નગર માટે ફાળવાયેલ છે. તે સામે આ પીવાના પા રી કચ્છના ૬૦૦ ગામમાં પ પહોંચાડવામાં આવતા નથી. ત્યાંના કામો પ બાકી છે. જ્યાં પીવાના પા રી પહોંચાડવામાં આવે છે તે પા રી આયોજન કરતાં ખૂબજ ઓછા અને તે પ અનિયમિતપ પહોંચાડવામાં આવે છે.

૦.૦૩૭ એમ.એ.એફ. અથવા ૫૦ એમ.એલ.ડી. પા રીના આયોજનો વર્ષ ૨૦૦૧ના કચ્છના ધરતીકુપ અગાઉના ઉદ્યોગો માટેના પા રીના આયોજનો છે. ધરતીકુપ બાદ કચ્છમાં અનેક ઉદ્યોગો વિકસેલ છે. આજે આ ઉદ્યોગોના પા રીની જરૂરિયાત ૩૦૦ એમ.એલ.ડી. ની છે. તેની સામે ૫૦ એમ.એલ.ડી. પા રીનો કોઈ જ ડિસાબ નથી. આ પરિસ્થિતિ બ ચાર ઉત્પન્ન કરવાની જ પરિસ્થિતિ છે. આપે તેમાંથી કઈ રીતે બહાર આવી કીનું?



## "MATRU VANDANA"

### Senior Citizen Home

Trust Reg. : E/24321/Kutch - 80G/GR-28/2010-11



### માતૃવંદના - બીંડા

#### વિવિધ પ્રકારના રહેણાંકના દરો

(૧) કાયમી ધોરણે રહેનારને (રહેવા જમવાની સગવડ સાથે) :	માસિક રૂ. ૨૧૦૦/-
(૨) પ્રથમ માણ પર યોડા સમય રહેવા માટે	
૭ દિવસ સુધીના રહેવા-જમવાનો ખર્ચ	: રૂ. ૨,૩૦૦/-
૧૫ દિવસ સુધીના રહેવા-જમવાનો ખર્ચ	: રૂ. ૪,૦૦૦/-
૩૦ દિવસ સુધીના રહેવા-જમવાનો ખર્ચ	: રૂ. ૬,૦૦૦/-
(૩) દૈનિક ધોરણે પ્રથમ માણ પર :	
નોન ઓ.સી. રૂમ (ડબલ બેડ)	: રૂ. ૪૦૦/- પ્રતિ દિવસ
ઓ.સી. રૂમ (ડબલ બેડ)	: રૂ. ૬૦૦/- પ્રતિ દિવસ

કોઈ પણ શાકાહારી વ્યક્તિ ઉપરોક્ત સુવિધાનો લાભ લઈ શકે છે.

સંપર્ક : (૦૨૮૫૪) ૨૪૪૪૨૪, ૨૮૪૭૭૭ • મોબાઇલ : ૯૪૨૮૮ ૫૦૨૪૨

E-મેઈલ : matruvandana@hotmail.com • વેબસાઈટ : [www.matruvandana.in](http://www.matruvandana.in)

## સ્વરચ્છ પર્યાવરણ અને પ્રદૂષણ નાબૂદી અભિયાન

● પ્રા. સૂર્યકાંત ભડ્ક - ભુજ ●

આપ એ આ મહામૂલી પૃથ્વી પર ૭૧ ટકા ભાગમાં પા એ છે, જ્યારે ૨૮ ટકા ભાગમાં જમીન છે. આ જમીનમાંથી માત્ર ૨.૨ ટકા જમીન ભારતને પ્રાપ્ત થયેલી છે કે જે ભૂમિ વિસ્તાર પર જગતની ૧૭ ટકા વસતિ વસવાટ કરે છે. પ્રો. રોબિન્સ તેથી જ કહે છે કે, ‘માનવીની જરૂરિયાતો અનંત છે. જરૂરિયાતો સંતોષવાના સાધનો સીમિત છે કિંતુ તે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ થઈ કે છે.’

જૈવિક સૂર્યને ટકાવવા માટે નિસર્જન અ મોલ બેટ ધરી છે. આમ પર્યાવર એટલે એક અર્થમાં કુદરતની અ મોલ અનોખી બેટ. ‘પરિ’ એટલે આસપાસનું અને ‘આવર’ એટલે ઢાંક. તેથી જ પર્યાવર પૃથ્વીના ઢાંક તરીકે ઓળખાય છે. જેમાં જમીન, વ્ય, જંગલો, પહાડો, નદીઓ, સમુદ્રો, વન્યજીવો, પુષ્પ પરીકો, સૂર્ય જીવો તેમજ માનવીઓનો સમાવે થાય છે. આ તમામ ઘટકો જે પોતાના મુળભૂત સ્વરૂપમાં જળવાઈ રહે તો જ તે તેના નૈસર્જિક સ્વરૂપમાં રહેવા પામે. ૧૮મી સદી બાદ વિશ્વમાં સવિષ્ટ વસતિ વિસ્ફોટ થતો ગયો. આજે વિશ્વની વસતિ સાત અબજને આંખી ગઈ છે. આને પરિ મે માનવીની જરૂરિયાતોમાં વિસ્ફોટ થયો અને માનવીએ ઉધ્ઘત પર્યાવર માં વિંપો ઊભા કર્યા. પરિ મે અનેક પ્રદૂષ એ અર્થત્ત હવા, જળ, ઉદ્ધા, અવાજ અને ભૂમિ પ્રદૂષ એ સર્જયા. સજીવોના જીવન માટે જરૂરી વિવિધ ઘટકોના દૂષિતીકર ને પ્રદૂષ કહેવાય છે. સરળ બ્ધોમાં આપ અને આપ એ આજુબાજુનું બધું જ જેને પર્યાવર તરીકે પરીચિત કરાય છે.

### ● પર્યાવરણના પ્રકાર અને સમસ્યાઓ :

ખાસ ત્ર પ્રકારો પર્યાવર ના જોવા મળે છે : (૧) ભૌતિક પર્યાવર , (૨) સાંસ્કૃતિક પર્યાવર અને (૩) જૈવિક પર્યાવર . ભૌતિક પર્યાવર માં મૂદાવર , વાતાવર તથા જલાવર સમાવિ છે. સાંસ્કૃતિકમાં સામાજિક, આર્થિક, રાજકીય અને જૈવિક પર્યાવર માં સૂર્ય જીવો, વનસ્પતિઓ અને માંદોનો સમાવે કરાયો છે.

એક તરફ વસતિ વૃદ્ધિ, ઔદ્યોગિક વિકાસ,

મોજ બેખુનું જીવન આદિને કાર્ય નિસર્જિત વન્ય સંપત્તિ, ખનીજ સંપત્તિ, ફળુપ ભૂમિ અને ખાસ તો ઉધ્ઘત જળ અને સ્વરચ્છ વાયુ પ્રાસિની અનેક સમસ્યાઓ સર્જવા પામી છે, જ્યારે બીજી તરફ વન્યજીવોના રહેઠા માં ઘટાડો, જંગલોનો ના , ૨ વિસ્તારોની વૃદ્ધિ, જળ સમસ્યા, ઉર્જા સમસ્યા અને દિન પ્રતિદિન અનેક નવા ભયંકર રોગોની સમસ્યાઓ સર્જાઈ છે.

### ● ભારતનું પર્યાવરણ :

ભારત હાલે વિશ્વના ચીન અને અમેરિકા પદ્ધીનો ગ્રીજા નંબરનો સૌથી મોટો કાર્બન ડાયોક્સાઇડ પ્રસાર કરતો હૈ છે. સ્ટોકહોમ અને રીયો-ડી-જાનેરા ખાતેના વૈશ્વિક પ્લેટફોર્મ સમ । ભારત જૈવિક સમસ્યાની જે બાબત લાવી કર્યું તે આપ । હેઠાની આયોજન પંચ, રાષ્ટ્રીય રોકા એજન્સી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વ્યુહાત્મક અને આયોજન સંગઠનોના બંધાર માં લાવવામાં નિષ્ણળ રહ્યું. રાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં આ પડકારોને પહોંચી વળવા નેટવર્ક, વ્યુહાત્મક જવાબદારી આદિની જોગવાઈ અતિ આવશ્યક છે.

### ● ગુજરાતમાં શહેરીકરણ અને પર્યાવરણીય પડકારો :

પારંપરિક ગ્રામી ખેતપ્રધાન અર્થતંત્રથી આધુનિક ઔદ્યોગિક અર્થતંત્રમાં રૂપાંતરીત થવું એટલે હેરીકર . બીજા બંદોમાં ખેત પ્રકારની રોજગારલ રીતે પદ્ધતિથી ઉદ્યોગ પ્રધાન રોજગારલ રીતે પદ્ધતિ તરફની ગતિ લેલતાને

હેરીકર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિવર્ષ અનુધા ટકાના દરે હેરીકર વધું જ જાય છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર – આ આઠ મહાનગરોમાં ગુજરાતની ૨૫ ટકા વસતિ વસે છે. ઈ.સ. ૨૦૧૧માં ગુજરાતમાં ૩૭.૪ ટકા જેટલું હેરીકર હતું તે હાલે ઈ.સ. ૨૦૧૩-૧૪માં વધીને ૪૨.૬ ટકા થયું છે.

હેરીકર રોતે પર્યાવર રીય પડકારો અનેક છે. ભૂસ્તરના જળ નીચા જઈ રહ્યા છે. જંગલો કપાઈ રહ્યા છે, પુષ્પ પીનો વસવાટ ઘટતો જ રહ્યો છે. અવાજ -

ઘોંઘાટ અને વાયુના પ્રદૂષ થેથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રહેઠા નેની આસપાસની ગંડકીઓ નવા રોગોને આમંત્રે છે. ઉર્જાની અધત સર્જયેલી છે. ઝુંપડપણી વિસ્તારો પર્યાવર દૂષિત કરે છે.

### ● વન્યજીવન સુરક્ષા :

વન્યજીવનની સુર ॥ અર્થે સરકારશ્રીએ પ્રોજેક્ટ એલીફન્ટ, પ્રોજેક્ટ ટાઈગર જેવી વિવિધ યોજનાઓ રૂક્રી છે. દરેક રાજ્યમાં “વન્યજીવન સલાહકાર બોર્ડ”ની રચના ફરજીયાત કરાઈ છે. ભારતમાં ૪૮૦ રાષ્ટ્રીય ઉદ્યાનો, ૭૮ અભ્યારણ્યો, ૧૩ જૈવ આરાટિત ટ્રો આવેલ છે. વન્ય પ્રા ઐઓની જાળવ ૧, ૨૧ માટે ૨૧ માર્ય - વિશ્વ વન દિન, ૫ જૂન - વિશ્વ પર્યાવર દિન, જુલાઈમાં વન મહોત્સવો, ૨થી ૮ ઓક્ટોબર - વન્ય પ્રા ૧ દિવસ, ૨૮ ડિસેમ્બર - જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવાય છે. સમયાંતરે વન્ય પ્રા ઐઓની વસતિ ગ તરી કરવામાં આવે છે. વન મહોત્સવ દરમાન વૃ ૨ રોપ ના કાર્યક્રમો હાથ ધરાય છે. ભારત સરકારે ઈ.સ. ૧૯૭૨માં ભારતીય વન્ય પ્રા ૧ (સંર ૧) અધિનિયમન ઘર્યું. જેમાં ઈ.સ. ૨૦૦૨ સુધીમાં છ વખત સુધારા હાથ ધરાયેલ છે. આજે કેન અને રાજ્ય સરકારો દ્વારા એગ્રોવનીકર, સામાજિક વનીકર તથા હેરી વનીકર ના કાર્યક્રમો યોજાય છે.

### ● પર્યાવરણ પ્રદૂષણ :

આજે તો પર્યાવર સુર ॥ ધારો ઈ.સ. ૧૯૮૮થી અમલમાં છે. તદનુસાર પર્યાવર માં પા ૧, હવા, જમીન તથા માનવી અન્ય જીવંત સૂ ૧, વનસ્પતિ, સૂ મ સજ્જવો સમાવિ છે. પર્યાવર ને હાનિકારક હોય અથવા હાનિકારક હોવાની સંભાવના હોય એટલી જલદ માત્રામાં કોઈ ધન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થની હાજરી હોય તેને પ્રદૂષક કહે છે. આવા કોઈપ પ્રદૂષકની પર્યાવર માં હાજરી એટલે પર્યાવર પ્રદૂષક. ભારતીય બંધાર ના આર્ટિકલ-૪૮ દ્વારા માત્ર ભારત સરકાર ૪ નહિ પરંતુ અદાલતોના ૮ રે પર્યાવર સુર ૨ાની જવાબદારી મુકાઈ છે. ભારતના દરેક નાગરિકની બંધાર ના આર્ટિકલ-૫૧એ(જી) મુજબ પર્યાવર ની સુર ॥ જાળવવાની ફરજ થાય છે. આપ ૧ પવિત્ર નદી ગંગા નદીની સ્વચ્છતા જાળવવા “ગંગા પ્રદૂષ ” કેસ સીમાચિહ્ન રૂપ છે. આજે તો હવા પ્રદૂષ નિવાર અધિનિયમન ઈ.સ. ૧૯૮૧,

પા ૧ પ્રદૂષ અધિનિયમન ઈ.સ. ૧૯૭૪, રાષ્ટ્રીય પર્યાવર ન્યાયપંચ ઈ.સ. ૧૯૪૫ આદિ વિદ્યમાન છે.

### ● પૃથ્વી શિખર સંમેતન - એજન્ડા-૨૧ :

વિશ્વ આરોગ્ય સંસ્થાએ બોલાવેલી કોન્ફરન્સમાં જે નિ ‘યો લેવાયા છે તેને એજન્ડા-૨૧ કહે છે. આ એજન્ડા દ્વારા આજના બગડતા જતા પર્યાવર અને વિકાસ માટે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. એજન્ડા-૨૧ના મુખ્યત્વે નિ ‘યો અનુસાર ગેસ પ્રદૂષ ઓછું કરવું, દરેક રાષ્ટ્ર પોતાની જંગલ સંપત્તિનું સંવર્ધન કરવું, વસતિ વિસ્ફોટ કાબૂમાં લેવો. પર્યાવર આયોજનમાં સ્વીઓને સામેલ કરવી. પર્યાવર ના કાયદાઓનું ચુસ્ત પાલન કરાવવું. પરસ્પર રાષ્ટ્રોએ પર્યાવર અંગે સમજૂતી કરવી.

### ● પર્યાવરણ સુરક્ષા અંગે ગાંધીજીના વિચારોનું ચોગાદાન :

સાંદું જીવન અને ઉચ્ચ વિચારો પૂજ્ય બાપુએ ચરિતાર્થ કરી બતાવ્યા. તેમ તો કુદરત સાથે સંવાદી જીવન જીવવા ઉપબોધ આપ્યો છે. ખાસ તો યાંત્રીકર ને સ્થાને જત મહેનતની વાત આગળ ધરી છે અને વાસ્તવમાં ઔદ્યોગિક કારખાનાઓ રાસાયનિક ધૂમાડાઓ પુષ્કળ પ્રમા માં ફેંકે છે. અન્ય ઔદ્યોગિક મલીન રાસાયનિક કચરો નદી, તળાવ કે નાળામાં વહાવે છે. ગાંધીજીએ અપનાવેલા “અપરિગ્રહ વ્રત”થી કુદરતી સંપત્તિઓનો બેફામ ભોગ અને ના અટકે. સમાન વહેંચી ક્ય બને. ગાંધીજીને “અસ્તેય વ્રત” ચીજવસ્તુઓ, સાધનોને જતન કરીને ઉપયોગ કરવાનું સૂચવે છે. આપે જગતની તમામ વસ્તુઓ પરમેશ્વરની માલિકીની સમજીએ અને સહુ કોઈ પ્રા માત્રાત્રને તેના કર્તાહીતપણે । નીચે રહેલા વિ જી કુટુંબરૂપે સમજીએ, તો જગતમાંથી સાવ આવશ્યક વસ્તુઓનો માત્ર ઉપયોગ કરવાનો જ આપે અધિકાર છે. એથી વધારે અધિકાર સમજવો એ તો ચોરી છે. આ સમસ્યા ખંત, સમજ, ભાઈચારાથી દૂર જડૂર થઈ કે છે.

આપણે સમજી નથી શકતા કે સામેના માણસનો ઈરાદો શું છે. ફક્ત એ શું કરે છે એટલું જ જોઈ શકીએ છીએ અને વર્તન પરથી વિચારનો અંદાજ લેવો અધરો છે.

## મોહમ્મદ રફી - સદાબહાર ગાયક

● ઈંડ્રાવદન અંતાણી - ગાંધીનગર ●

એક ફીરી ગીત ગાતા પસાર થયા : “ખેલન દે દિન ચાર.” (રમત અને તોફાનના ચાર દિવસ)

એક સાત વર્ષના બાળકને ગીત ખૂબ ગમ્યું અને ગાતો ગાતો ફીરી પાછળ ગયો. સાંભળ્યા પછી તે બાળક પ ગાવા લાગ્યો. બાળકની લાગ ઐ જોઈ ફીરી આ વીર્વાદ આપતા હતા. આ બાળક તે બીજું કોઈ નહીં, પ સદાબહાર ગાયક હતા “મોહમ્મદ રફી.”

મોહમ્મદ રફી એક ભારતીય પાર્શ્વગાયક હતા. તેમનો જન્મ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ કોટલા સુલતાન સિંઘ ગામમાં થયો હતો. તેમની ગાયક તરીકેની કારકિર્દી ચાર દાયકાની હતી. તેઓ હ રાષ્ટ્રીય પુરસ્કાર અને હ ફિલ્મફિર પુરસ્કાર જીત્યા હતા. ૧૯૬૭માં ભારત સરકારશ્રી દ્વારા તેમને ‘પદ્મશ્રી’ તરીકે નવાજવામાં આવ્યા હતા. **મોહમ્મદ રફીએ ૨૬,૦૦૦થી વધુ ફિલ્મી ગીતો ગાયા.** તેમના ગીતોમાં સ્થીય ગીતોથી માંડીને ભક્તિ ગીતો, કરુ ગીતો, દે ભક્તિના ગીતો, હૃગાર રસવાળા ગીતો, કવ્યાલીઓથી માંડીને ગજલો અને મસ્તીભર્યા ગીતોનો સમાવે થયો હતો. હિંદી અને ઉર્દૂ ભાષા પર તેમની મજબૂત પક્કડ હતી. તેમ હિંદી, કોંક ૧, ઉર્દૂ, ભોજપુરી, ઉଡિયા, પંજાਬી, બંગાળી, મરાಠી, સિંધી, કમ્બડ, ગુજરાતી, તેલુગુ, મૈથિલી અને આસામી જેવી ભાષાઓમાં ગીતો ગાયા હતા.

૨૪ જુલાઈ, ૨૦૧૦નાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રકાર્ટ ત એક લેખમાં તેમના અવાજ વિ કહેવાયું કે – જો એક ગીતમાં ‘હું તને ચાહું છું’ એમ કહેવા માટે ૧૦૧ રસ્તાઓ હોય તો રફી સાહેબ તે તમામથી વાકેફ હતા. પ્રેમ, વિરાષ, સૌંદર્ય વ ‘ન – આવા વૈભવ્યને સમાવવાની રફીમાં મિતા હતી. તેમનો અવાજ જીવનના નવ રસને જીલી કર્તો.

### ● પૂર્વ ભૂમિકા :

બ્રિટી સમયના ભારતમાં પંજાબનાં અમૃતસર નજીક આવેલા ગામમાં હાજી અલી મોહમ્મદના છ પુત્રોમાં રફી સૌથી નાના હતા. ૧૯૩૫-૩૬માં રફીના પિતા લાહોર

ગાયા અને બાદમાં કુટુંબના સભ્યો પ લાહોરમાં સ્થાયી થયા.

મોહમ્મદ રફીના સાળાએ તેના કો લ્યને પારખ્યું અને તેમને પ્રોત્સાહિત કર્યા. રફી સ્થીય સંગીત પીચા તેમ હ ૧૩ વર્ષની વધે જાહેરમાં ગાયું. શ્રી કુંદનલાલ સાઈગલ માટેના એક સંગીત જલસામાં તેમને ગાવાની તક મળી. ૧૯૪૧માં પંજાબી ફિલ્મ ‘ગુલ બલોચ’માં “સોનિયે ની હીરીયે ની” ગીત રફીએ પાર્શ્વગાયક તરીકે પોતાનું પ્રથમ ગીત જીવત બેગમ સાથે ગાયું. તે જ વર્ષ લાહોર આકા વા મીમાં ગાવાનું આમંત્ર મળ્યું. પછીના વર્ષોમાં ‘ધી બોખે’ તેમજ ‘ગાંબડી ગોરી’ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા. મોહમ્મદ રફીએ ‘લૈલા મજનુ’ (૧૯૪૫), ‘જુગનુ’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પ ભજવી.

### ● મુંબઈમાં આગમન :

૧૯૪૪માં રફી સાહેબ મુંબઈ આવ્યા. ભાઈઓએ ભેગા મળી ભીંડી બજારમાં, ગીય વસતિવાળા વિસ્તારમાં નાની રૂમ લીધી. ચોપાટીના દરિયા કિનારે સવારે કલાકો સુધી રફી રિયાઝ કરતાં. ‘ગાંબડી ગોરી’નું ચુગલ ગીત ગાયું જે તેમણે હિંદી ભાષાનું પોતાનું પ્રથમ ગીત ગણાવ્યું. સમૂહગાન તરીકે તેમ શ્રી નૌ દં માટે અનેક ગીતો ગાયા. ૧૯૪૭માં ‘જુગનુ’ ફિલ્મમાં ‘ચહાં બદલા વફા કા’ ગીત નૂરજહાં સાથે ગાયું. ભારતના ભાગલા બાદ રફીએ ભારતમાં જ રોકાઈ જવાનો નિ ‘ય કર્યો, જ્યારે નૂરજહાં પાકિસ્તાન ચાલ્યા ગાયા. રફીને તે સમયના ગાયકો જેવા કે કે.એ.લ. સાઈગલ, તલત મહેમુદ અને ખાસ જી તીતા જી.એન. દુર્દાનીએ પ્રભાવિત કર્યા.

પોતાના સમયમાં રફી ઘ. સંગીતકારો સાથે જોડાયેલા હતા. જે પૈકી નૌ દં ખાસ હતા. ઓ.પી. નૈથર, કર જયકિ ન, એસ.ડી. બર્મન જેવા અન્ય સંગીતકારો સાથે ૧૯૫૦ના અંતમાં અને ૧૯૬૦માં રફીએ કામ કર્યું.

મોહમ્મદ રફીએ નૌ દં સાથે ઘ. ગીતો ગાયા. રફી પહેલાં નૌ દંના પ્રિય ગાયક તલત મહેમુદ હતા.

એકવાર નૌ ૧૬, તલતને રેકોર્ડિંગ દરમ્યાન ધૂમ્રપાન કરતા જોઈ ગયા હતા. આ વાતથી તેમને ભારે ગુસ્સો આવ્યો અને “બૈજુ બાવરા”ના તમામ ગીતો ગાવા માટે રફીને આપ્યા. ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગીત ૧૯૪૮માં ૫ રફીએ નૌ ૧૬ના સંગીતમાં ગાયું, જે આજે ૫ લોકપ્રિય છે. ‘બૈજુ બાવરા’ (૧૯૫૨)ના ‘ઓ દુનિયા કે રખવાલે’ અને ‘મન તડપત હરિ દર નકો આજ’ ગીતોએ રફીને ઓળખ આપી પરિ મે હિંદી સિનેમાના પાર્શ્વગાયક તરીકેની જ્યાતિ મળી. રફીએ નૌ ૧૬ માટે ૧૪૮ ગીતો ગાયા.

એસ.ડી. બર્મને રફીને દેવ આનંદ અને ગુરુદત્તના અવાજ તરીકે સજ્યા. શ્રી બર્મન સાથે ‘ઘાસા’, ‘કાગળ કે ફૂલ’, ‘તેરે ધરકે સામને’, ‘ગાઈડ’, ‘આરાધના’ અને ‘અભિમાન’ જેવી ફિલ્મોમાં સ્વર આપ્યા.

‘કર જ્યકિ નના સંગીત હેઠળ રફીએ મી કપૂર, રાજેન કુમાર જેવા કલાકારો માટે કેટલાક ગીતો પ તૈયાર કર્યા હતા. આ કલાકારો રફી સિવાય તેમના માટે કોઈ ગાય તેમ માનતા જ નહિ. રફીને મળેલા છ ફિલ્મફર પુરસ્કારો પૈકી ત્ર ગીતો ‘કર જ્યકિ નના હતા. જેમાં ‘તેરી ઘારી ઘારી સૂરત કો’, ‘બહારોં ફૂલ બરસાઓ’ તથા ‘દિલ કે ઝરોખોમે’ સામેલ હતા. અત્યંત ઝડપી ઓરકેસ્ટ્રા સાથે તૈયાર થયેલું ‘ચાહે મુજે કોઈ જગળી કહે...’ એકમાત્ર ઝડપી ગવાયેલું ગીત હતું. રફીએ ‘કર જ્યકિ નના’ ૩૪૧ ગીતો ગાયા. જેમાં ૨૧૬ વ્યક્તિગત હતા.

રવિ અને રફીએ સાથે મળીને ઘ ૧ ફિલ્મો માટે ગીતો તૈયાર કર્યા હતા. રફીને પ્રથમ ફિલ્મફર પુરસ્કાર ‘ચોદવી કા ચાંદ હો’ ગીત માટે મળ્યો હતો. ફિલ્મ ‘નીલ કમલ’ (૧૯૬૮)નું ‘બાબુલ કી દુઆઓ લેતી જા’ ગીત પ રવિ દ્વારા સર્જયું હતું, જે માટે રફીને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. રફી આ ગીતના રેકોર્ડિંગમાં રી પડ્યા હતા. ૧૯૭૭માં બી.બી.સી. સાથેની એક મુલાકાત દરમ્યાન તેમે ખુદ આ વાત કબૂલી હતી.

મદન મોહનના પ રફી પ્રિય ગાયક હતા. પ્રથમ વ્યક્તિગત ગીત ‘આંખે’ ફિલ્મમાં ‘હમ ઈશ્કમે બરબાદ હૈ’ હતું. તેમે સાથે મળી અનેક ગીતો તૈયાર કર્યા.

મોહમ્મદ રફી અને ઓ.પી. નૈયરે ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં કેટલાક ગીતોનું સંગીત મળીને તૈયાર કર્યું. શ્રી નૈયરે એક વાર કહ્યું હતું - ‘જો રફી ન હોત તો ઓ.પી. નૈયર પ ન હોત.’ ફિલ્મ ‘રાગી ઐ’માં

ગાયક અભિનેતા કિ રેકુમાર માટેના ગીત ‘મન મોરા બાવરા’ માટે ખુદ કિ રેકુમારે રફી સાહેબને વિનંતી કરી કે આ ગીત તેઓ ગાય કાર કે ગીત અર્ધ સ્થીય હતું અને કહ્યું કે ‘રફી સાહેબ મારા કરતાં વધારે સાંદું ગા.’ રફીએ તે ગીત ગાયું. શ્રી નૈયરે તેમના મોટાભાગના ગીતો રફી અને આ ૧ ભોંસલે પાસે ગવડાવ્યા. રફીએ કુલ ૧૯૭ જેટલા ગીતો (પદ વ્યક્તિગત) માત્ર ઓ.પી. નૈયર માટે ગાયા હતા.

લ મીકાંત - ઘારેલાલે પ તેમની પહેલી જ ફિલ્મ ‘પારસમી’ (૧૯૬૩)થી જ રફીને ગાયક તરીકે પસંદ કર્યા હતા. રફીને ‘દોસ્તી’ના ગીત ‘ચાહુંગા મેં તુઝે’ માટે ફિલ્મફર પુરસ્કાર પ મળ્યો હતો. રફીએ લ મીકાંત - ઘારેલાલ માટે કુલ ૩૬૮ જેટલાં ગીતો (૧૮૬ વ્યક્તિગત) ગાયા હતા.

‘તેરે ઘારને મુજે ગમ દિયા’ - આ ગજલ ૧૯૬૧માં રફીએ ફિલ્મ ‘છૈલાભાબુ’ માટે ગાઈ હતી. આ ફિલ્મ લ મીકાંત - ઘારેલાલની હતી. તેઓએ રફીને આ ગજલ ગાવા જ છું. ફિલ્મ નિર્માતાની ઈચ્છા હતી કે આ ગજલ જો રફી ગા’ તો ફિલ્મ વધારે લોકપ્રિય બને. જો કે ગીત માટે આપવાના થતાં ના જ ચૂકવવા નિર્માતા લાચાર હતા. રફીનું દિલ પીગળી ગાયું અને ગીત ગાવા સંમતિ આપી દીધી. રફીએ આ ગજલ એટલા દિલથી ગાઈ કે સાંભળનાર પ ગીતમાં ડૂબી જતા હતા. રેકોર્ડિંગ બાદ ફિલ્મ નિર્માતાએ ખૂબ જ સંકોચથી, ગીત ગાવાના માત્ર એક હજાર રૂપિયા આપ્યા. રફીએ પેસા અંતથી લઈ લીધા અને તરત લ મીકાંત - ઘારેલાલને આપી દીધા અને તેમાંથી મીઠાઈ મંગાવવા જ છું. આ રીતે રફીએ ઘ ૧ નવા નિર્માતા તથા સંગીતકારોને સહાય કરી છે.

કલ્યા જી - આ ‘દજ માટે રફીએ ઘ ૧ ગીતો ગાયા. ‘ગોવિદા આલા રે’ (બલફ માસ્ટર - ૧૯૬૩), ‘હિમાલયકી બુલંદી સે’ (કૂલ બને અંગારે - ૧૯૬૩), ‘હમને દેખા હૈ તુમે’ (જી ચાહતા હૈ - ૧૯૬૪), ‘ઓ મેરે દિલ કે ચૈન’ (આમને સામને - ૧૯૬૭), ‘ચલે થે સાથ મિલકર’ (હસીના માન જાયેગી - ૧૯૬૮) - આ ગીતો ખાસ યાદગાર રખ્યા.

કલ્યા જીબાઈ રફી સાહેબને ‘હરફન મૌલા’ કહેતા. હરફન મૌલાનો અર્થ દરેક કલામાં માહેર એવો છે.

૧૯૫૦થી ૧૯૭૦ના સમયગાળામાં બોલીવુડમાં સૌથી વધારે માંગ ધરાવતા ગાયક રફી હતા. ૧૯૭૭માં

ભારત સરકાર દ્વારા તેમને ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. રફીએ બે અંગ્રેજ આલબમ પ આપ્યા હતા.

૧૯૭૦ના દાયકાની રૂઆતમાં રફી બીમાર પડ્યા અને ઓછા ગીતો રેકૉર્ડ કર્યા. આ જ સમયમાં ૧૯૮૮માં હજ્યાત્રા દરમ્યાન મોહમ્મદ રફીની ગેરહાજરીમાં ફિલ્મ ‘આરાધના’ માટે કિ રેકુમારે ગાયેલ ગીતોને કાર્ય કિ રે કુમારની લોકપ્રિયતા વધી. સંગીત એસ.ડી. બર્મનનું હતું. આ ફિલ્મના રેકૉર્ડ કરેલા પ્રથમ બે ગીતો ‘બાળોમેં બહાર હૈ’ અને ‘ગુનગુના રહે હૈં ભંવરે’માં પુરુષ પાર્શ્વગાયક માટે રફીનો અવાજ લેવાયો હતો. આ બે ગીતો બાદ શ્રી એસ.ડી. બર્મન બીમાર પડ્યા અને તેમના પુત્ર અને સહાયક શ્રી આર. ડી. બર્મને રેકોર્ડિંગનું બાકીનું કામ સંભાળ્યું. ‘રૂપ તેરા મસ્તાના’ અને ‘મેરે સપનોં કી રાની’ ગાવા માટે કિ રે કુમારને પસંદ કર્યો. ૧૯૭૧-૭૩ દરમ્યાન રફીના ગીતોમાં ઘટાડો નોંધાયો. જો કે તેમ ઘ જી ગીતો ગાયા. આ ગીતોમાં પગલા કહીં કા, હીર રંજા, ધી ટ્રેન, મહેબૂબ કી મહેંદી, ગેમ્બલર, પાકીજા, યાદો કી બારાત, હંસતે જખમ, અભિમાન અને લોફર ફિલ્મોના ગીતોનો સમાવે થાય છે.

૧૯૭૦ની મધ્યમાં રફીએ મુખ્ય ગાયક તરીકે પુનરાગમન કર્યું. ૧૯૭૪માં ઉષા ખના દ્વારા રચાયેલ ગીત ‘તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ’ (ફિલ્મ હવસ) માટે રફીને ફિલ્મ વર્લ્ડ મેગેઝીનનો બેસ્ટ સીંગરનો પુરસ્કાર મળ્યો.

મોહમ્મદ રફીને છેલ્લા રૂપ વર્ષથી ડાયાબિટીસ અને હાઈ ક્રોલેસ્ટેરોલની ફરીયાદ હતી, જેની તેઓ દવા લેતા હતા. સામાન્ય રુદ્ધ અને તાવ સિવાય કોઈએ તેમને માંદગીમાં જોયા જ નહોતા. તેઓ હુંમે જી સક્રિય રહેતા. પ્રમા માં વજન વધારે હતું. તેઓ જમવાના પોખીન હતા. ૩૧ જુલાઈ, ૧૯૮૦ ગુરુવારના રોજ રાત્રે ૧૦.૫૦ કલાકે હંદ્રાયરોગના હુમલાના કાર્ય તેમનું અવસાન થયું. તેમનું છેલ્લું ગીત હતું ‘શામ ફિર કર્યું ઉદાસ હે દોસ્ત’ (આસપાસ) જે તેમ મૃત્યુના થોડા જ કલાકો પહેલાલ મીકાંત - ખારેલાલ સાથે રેકૉર્ડ કર્યું હતું. શ્રી રફીને જુહુ મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. મુંબઈએ જોયેલી આ સૌથી મોટી અંતિમ યાત્રાઓ પૈકીની એક હતી. જેમાં લગભગ ૧૦,૦૦૦ કરતાં વધારે લોકોએ ભાગ લીધો. રફી કદી પ મધ્યપાન ન કરનારા, અત્યંત ધાર્મિક અને ખૂબ જ નમ્ર હતા. તેઓ એક ચુસ્ત મુસ્લિમ

હતા. તેઓ નિર્મિતાને જરૂરી ના ક્રીય સહાય પ કરતા હતા. એક સમયે લ મીકાંત - ખારેલાલે કહ્યું હતું કે ‘તેઓ હુંમે પાછું મેળવવાનું વિચાર્યા વિના સહાય કરતા હતા.’ તેમના મકાન ‘રફી વિલા’થી સ્મ જન યાત્રાના માર્ગો પર ‘ખુલ્લો રહો અહલે ચમન’, ‘જાનેવાલે કભી નહિ આતે’, ‘યે જુંદગી કે મેલે’, ‘તુમ મુજે યું ભૂલા ન પાઓગે’ ગીતો વાગતા હતા. આમ સંગીતના ‘હેન ઈ-તરનુમ’ પોતાના ગાયેલા ગીતોને મૂકી વિદ્યાય થયા.

ભારતીય સંગીતમાં એક છાપ ઉભી કરી હોય એવા કોઈ ગાયક અને સંગીતકાર હોય તો તે રફી છે. રફી માત્ર નામ જ પર્યામ છે. આ ત્રૈમાં તેમનો કોઈ હરીક જ નહોતો. ૧૯૮૦થી ૧૯૮૮ સુધી તેમની ગીત ગાવાની ‘લી, રજૂઆત એવી હતી કે પ્રે કોને વ ઐભૂત કરી લેતા.

મોહમ્મદ રફીના સંબંધી અને પ્રસિધ્ય લેખક સલીમખાન ‘મોહમ્મદ રફી – હમારે અખ્યા – કુછ યાદે’ પુસ્તકમાં લખે છે કે “રફી સાહેબ એક સૂક્ષી હતા, જે ખુદાએ આપેલ અવાજમાં ગીતો ગાતા હતા. ક્યારેય કોઈ બીજો રફી થ જ નહિ કાર કે ઉપરવાળો પોતાના ખાસ કામનું પુનરાવર્તન કરતો નથી.” ‘કુછ યાદે’ પુસ્તક રફી સાહેબની પુત્રવધૂ યાસ્મિન ખાલીદ રફીએ પ્રસિધ્ય કર્યું છે. તેમાં જ વિયું છે કે અખ્યુ સમર્પિત, નિર્બસની અને

રમાણ સ્વભાવના હતા. અમારા કુટુંબમાં રફી સાહેબ સિવાય કુટુંબના કોઈ સભ્યને સંગીત સાથે ખાસ સંબંધ નહોતો. ભારત સરકારે રફીના મૃત્યુ બાદ તેમના

**માનમાં બે દિવસનો શોક જાહેર કર્યો હતો.** વળી રફીના કેટલાક નહિ પ્રસારીત થેયેલા ગીતો આવનારી ફિલ્મ ‘સોરી મેડમ’માં ઉપયોગમાં લેવા. રફીના જીવન પર આધારિત એક ફિલ્મ નિર્મા કાર્ય ભારતીય ફિલ્મ વિભાગ દ્વારા હાથ ધરાયું છે. વાંદરામાં મુંબઈ અને પૂના બાદ વિસ્તારમાં એમ.જી. રોડને લંબાવીને ‘પદ્મશ્રી મોહમ્મદ રફી રોડ’ નામ અપાયું. આવા ગાયકને ભર તોતર ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માન થાય તેવું સંગીત પ્રેમીઓ ઈચ્છે છે. સ્વ. મ્હી કપૂરે કહ્યું હતું કે ‘હું મોહમ્મદ રફી વગર અધૂરો છું.’ તેમના અવસાન બાદ જ હિંદી ફિલ્મો મોહમ્મદ રફીને અર્પ કરી. અલ્લાહ રખા, મર્દ, કૂલી, દે પ્રેમી, આસપાસ, નસીબ અને હીરાલાલ પણાલાલ. કેરમ, બેડમિન્ટનની રમતો તથા પતંગ ઉડાડવાના તેમના પોખ હતા. રાયપુરમાં સંગીતના કાર્યક્રમમાં દ ‘કો વારંવાર વન્સ મોર કહેતા, સંગીતકારો

ખૂબ જ થાકી ગયા હતા, ત્યારે રફીએ પાંચ ગીતો હાર્મોનિયમની મદદથી ગાયા.

રફીની પુત્રવધૂ યાસ્મિન, જેના પુસ્તકનું શ્રી અમિતાભ બચ્ચને અનાવર કર્યું હતું, તેમના અનુભવમાં શ્રી બચ્ચને જ ટ્યુન કે ઘ િ વર્ષો પહેલાં અમે સીલીગુડી (પણ્ણમ બંગાળ) ગયા હતા. ત્યાં સંગીતનો બે દિવસનો કાર્યક્રમ હતો. શ્રી ૧ કપૂરે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પહેલા દિવસે રફી સાહેબનો કાર્યક્રમ હતો. બીજા દિવસે અન્ય કલાકારનો કાર્યક્રમ હતો. રફી પહેલા દિવસે કાર્યક્રમમાં આવ્યા અને બીજે દિવસે સવારે પરત જવા રવાના થયા. આ કાર્યક્રમમાં જે બીજા ગાયક આવવાના હતા, તે આવી ક્યા નહિ. શ્રી કેપૂર ત વર્માં હતા. તેમ શ્રી બચ્ચનને રફી સાહેબને પરત લાવવા જ ટ્યુન. તેઓ એરપોર્ટ પર ગયા. વિમાન ઉપડવાની તૈયારીમાં હતું. શ્રી બચ્ચનની વિનંતીથી વિમાન અટકાવાયું અને રફી સાહેબને પરત લાવ્યા. એક પ જ બોલ્યા વિના પરત આવ્યા. આટલા માનવીય ઈન્સાન હતા.

મહાત્મા ગાંધીના નિધન બાદ માત્ર એક જ માસમાં ‘સુનો સુનો યે દુનિયાવાલોં, બાપુકી યે અમર કહાની’ ગીત તૈયાર થયું. આ ગીત રફીએ ગાયું. ત્યારે શ્રી નહેરુની આંખોમાં પા િ આવ્યા. બધાના દિલને આ ગીત સ્પ િ ગયું.

જીવનની અંતિમ ૧૦માં ૫ સંગીતનો સાથ ન છોડ્યો. અંતિમ ઈચ્છા પૂછતાં તેમ ‘ઓ દુનિયા કે રહવાલે’ ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેમ ગુજરાતી ગીતો પ ગાયા હતા. ગુજરાતી જ્ઝોના ઉધું ઉચ્ચારો જોઈ આશ્ર્ય થાય તેમ છે. ઉચ્ચારો ખૂબ જ સ્પ હતા. ‘દિવસો જુદાઈના જાય છે’, ‘કહું છું જવાનીને’, ‘ભૂલેચૂકે મળે તો’, ‘મીઠી નજરું લાગી’, ‘આ તો રમત રમાડે રામ’, ‘કરમની ગતિ કો જ િ’ વગેરે જેવા ઘ । ફિલ્મી, ગેરફિલ્મી યાદગાર ગુજરાતી ગીતો ગાયા છે.

તા. ૩૧-૭-૧૯૮૦ના રોજ જ્યારે વિદાય લીધી ત્યારે જ એક બુલંદ સ્વરે વિદાય લીધી. આજે તેમના મૃત્યુના ઉચ્ચ વર્ષ બાદ પ રેઝિયો, ટી.વી. પર રફીનો જીવંત અવાજ સાંભળવા મળે છે. આજના પણ્ણમની નકલ સમા ગીતો માત્ર પાંચ-સાત દિવસમાં ભૂલાય છે, જ્યારે રફી જેવા જુના સદાબહાર ગાયકના ગીતો હજુ ૫ સાંભળવા મળે છે.

સલામ, રફી સાહેબ!

## મંગળા આરતી આજપર્યત કાયમ છે

(અનુસંધાન : પાના નં.-૨૫ ઉપરથી ચાતુ)

કોઈપ નાતજાતના ભેદભાવ વગર સર્વધર્મ સમભાવ સાથે હંમે । કોઈપ ટીકા ટીપ્પ ૧ વગર ભજી જતી નાગરી નાત આજે ૫ મંગળા આરતીનું પ્રયોજન કરે છે. એક સમયે રાજ મહારાવે ૫ આ મંગળા આરતીનો હાટકેશ્વર મંદિરમાં લાભ લીધો હતો. જે એક ઐતિહાસિક નોંધ છે. ઉપરાંત દિવાળીના દિવસોમાં જ હાટકેશ્વર મંદિરમાં જ સ્વામી વિવેકાનંદજીની ઉપસ્થિતિમાં ૫ મંગળા આરતી થઈ હતી તેવી લોકવાયક આજે ૫ છે. જે આ નાગરી પરંપરાનો ઉલ્લેખ વધારે છે.

આ પરંપરાનો ઉદ્ભબ વડનગરના નિજ મંદિરથી થયો છે તેવી વાયકા છે અને નરસિંહ મહેતાને કૃ મય બનાવવામાં ૫ આ જ મંગળા આરતી નિમિત બની હતી. જેનો ઉલ્લેખ કૃ ની રસલીલામાં ૫ થયો છે. આવી પરંપરાને આપ । માનનીય વડાપ્રધાન શ્રી નરેન મોદીએ જ્યારે વારા સીમાં ચૂટ ૧ વખતે વડનગરના ઈ દેવ હાટકેશ્વરને યાદ કર્યો હતા અને મહાદેવનું પૂજન તેઓએ કર્યું હતું અને નેપાળમાં ૫ પુ.પતિ નાથનું પૂજન કર્યું હતું જે આ નાગરી પરંપરાને બળ આપે છે. ઉપરાંત આ દિવસોમાં નાગરી લોકો પોતાના ઘરમાં “ધારી રોતડા” અર્થાત્ સૂકી સેવ, નાની મીઠી ખારી પૂરી, મીઠાઈઓ, લક્કડિયા, લાદુ, મોહનથાળ, કરપારા, ચેવડો, પૌંઅાનો વધાર, ગાંઢિયા જેવો નાસ્તો આજે ૫ ઘરે બનાવે છે અને ટેસથી આ આરતી બાદ ઘરે આવીને આરોગે છે, જે આ પરંપરાને આગળ વધારે છે. કચ્છના કાર્નિવલના સમયે આવા નાગરી પરંપરાનું પ્રતીક ઈ દેવ હાટકેશ્વર દાદાની મુલાકાતે આવો ત્યારે જ આપ સૌને આ પરંપરાનું મહત્વ સમજો.

## જ્યારે આપનો મોબાઈલ ફોન ગૂમ થઈ જાય ત્યારે....

તમારા મોબાઈલમાં \*#06# ટાઈપ કરો. આ રીતે પ્રેસ કરવાથી ૧૫ ઇચ્છટનો નંબર આપના મોબાઈલમાં સ્ક્રીન પર દેખાયો. જે તમારા મોબાઈલનો ઈ.એમ.આઈ. નંબર છે. આ ઈ.એમ.આઈ. નંબર તમારા હેન્ડસેટ માટે યુનિક છે. જે તમારા જ મોબાઈલ માટે છે. આ નંબરને નોંધી રાખો. હવે જ્યારે તમારો મોબાઈલ ગૂમ થઈ જાય ત્યારે તમારા સર્વિસ પ્રોવાઈડર (એરટેલ, હચ, રિલાયન્સ, ટાટા ઈન્ડિક્ષન, આઈડિયા વગેરે)ને ફોન કરીને આ ઈ.એમ.આઈ. નંબર આપી દેવાનો. આ નંબર તમારા હેન્ડસેટને બ્લોક કરવા માટે પૂરું છે. જ્યારે ઉઠાવગીર આ મોબાઈલમાં પોતાનું સીમ કાર્ડ બદલાવ્યું ત્યારે તમારું મોબાઈલ તેના માટે નકારું બની રહેયો.

આરોગ્ય

## ડાયાબિટીસ વિશે આટલું જરૂર જાણીએ

● ડૉ. મયંકકુમાર કિશોરચંદ્ર છાયા, ઓ.ડી. (આયુર્વેદ) ●

ડાયાબિટીસનું પ્રમા આજે સમાજમાં વધતું જ જાય છે. ગુજરાત તો ડાયાબિટીસનું ‘ધર’ હોય તેવું વધતી જતી રોગીઓની સંખ્યા ઉપરથી લાગે છે. ડાયાબિટીસ કેમ થાય છે? એ વિશે જોઈએ તો તેના મુખ્ય કાર્બોમાં વારસાગત કાર મુખ્ય ભાગ ભજવે છે. પરિવારમાં માતૃપુરો અથવા પિતૃપુરો ડાયાબિટીસ હોય તો બાળકને વારસામાં આ રોગ મળવાની ક્યતા વધુ હોય છે. એમ છતાં ૫ માતા કે પિતાને આ રોગ હોય તો તેમના સંતાનને ડાયાબિટીસ થાય જ એવું માનવું ભૂલ ભરેલું છે. જે લોકો ખોરાકમાં અનુગ્યાં લાંબા સમયથી ખાય છે, તેમનું રીર સ્થુળતા ધાર કરે છે. જેને કાર્બો રીરમાંના ચરબીના કોષો ઈન્સ્યુલીનની અસરકારકતામાં અવરોધ ઉત્પત્ત કરે છે. તેથી એવી વ્યક્તિને ડાયાબિટીસ થવાની ક્યતા વધુ હોય છે. ઈન્સ્યુલીન ઇપેન્ડન્ટ ટાઇપ-૧ પ્રકારનો ડાયાબિટીસ ઉપથી ૪૦ વર્ષ સુધીની ઉમરમાં થતો હોય છે, જ્યારે ૪૦ વર્ષ પછી નોન ઈન્સ્યુલીન ઇપેન્ડન્ટ ટાઇપ-૨ પ્રકારનો ડાયાબિટીસ થાય છે. બેઠાડું જીવન, માનસિક તા, કોઈપણ ઘટનાનો આધાત, રીરિક શ્રમનો સંદર્ભ અભાવ મધુપ્રમેહને જન્મ આપી કે છે. સગર્ભવસ્થા દરમ્યાન ૫ કેટલીક સ્વીઓને ટાઇપ-૨ પ્રકારનો ડાયાબિટીસ થતો જોવા મળે છે. આ ઉપરાંત પોલીસિસ્ટિક કિડની, સીકલ સેલ અનીમિયા, બાળકમાં વાઈરસનો ચેપ લાગી જવાથી, ના પામતાં બીટા કોષથી અને એન્ટી ડાઇયુરેટીક હોર્મોનની ૩ ૫ (હાઈપોથેલેમસ અને પિઅ્યુટરી ગ્રંથિની તકલીફ)ને લીધે ૫ ડાયાબિટીસ થઈ કે છે.

ડાયાબિટીસના લ । મોં અતિ ય તરસ લાગવી એ પહેલું લ । છે. દર્દીને વારંવાર પે બબ થાય છે (ખાસ તો રાત્રે). મૂત્રમાર્ગ જતી કરા તેની સાથે રીરમાં રહેલ પા ને ૫ બેંચી જાય છે. તેથી બહુમૂત્રતા લ । જોવા મળે છે. કિંતું ઉપાર્જન કોષોમાં ન થવાથી ભૂખ ભૂખ જ લાગે છે. વારંવાર ભોજન કરવા છતાં વજન તો વટતું જ જાય છે. રીરના સાયુઓમાંનું ગ્રોટીન વિધટીત થવાથી ખૂખ જ થાક અને નબળાઈ (અ કિલ)નો અનુભવ થાય છે. આ ઉપરાંત ઘા રૂઝાતો ન હોય, ગુમાંગની આજુબાજુ સતત બંજવાળ આવતી હોય, ગુમડાં થતાં હોય, દિ માં

જાંખપ લાગે, નાની વયે આંખમાં મોતીયો આવે, હાથ કે પગમાં ખાલી ચરી જાય, જાતીય નબળાઈ લાગે, ઊંઘ ન આવે, હાથ-પગના તળિયામાં બળતરા થાય તો ડાયાબિટીસ હોઈ કે છે.

આપ । રીરમાં સ્વાદુપિંડ (Pancreas) નામની એક પાચક ગ્રંથિ આવેલી છે. તેમાં ઈન્સ્યુલીન નામનો અંતઃસ્નાવ ઉત્પત્ત થાય છે. જો આ અંતઃસ્નાવનો અભાવ ઉત્પત્ત થાય અથવા રીરના કોષોમાં ઈન્સ્યુલીન રેઝિસ્ટન્સ થાય તો લોહીમાં ગલુકોગ (કરા)નું પ્રમા વધી જાય છે. જેથી ડાયાબિટીસ ઉત્પત્ત થાય છે એવું સામાન્ય ભાષામાં કહી કાય. આ ઈન્સ્યુલીનની ૩ ૫ પૂરી કરવા માટે ઈન્સ્યુલીનનાં ઈન્જેક ન લેવા પડે છે અથવા તો ઓરલ હાઈપો ગ્લાયસેમીક એજન્ટ્સ એટલે કે મોં વાટે ડાયાબિટીસને નિયંત્રિત કરે તેવી ગોળીઓ લેવી પડતી હોય છે. ઈન્સ્યુલીન ૫ અલગ અલગ પ્રકારના આવે છે. કયા રોગીને કયું ઈન્સ્યુલીન ઈન્જેક ન આપવું કે કઈ ગોળી આપવી તે નક્કી કરવાનું કામ નિઝ તાનું હોય છે.

### ● ડાયાબિટીસના દર્દીએ આહારમાં શું ન લેવું?

ડાયાબિટીસના દર્દીએ ખાંડ, સાકર, ગોળ, મધ, મીઠાઈ, ઠંડા પી ૧, કેળાં, કેરી, ચીકુ, સીતાફળ, ૧ ૧ વિ. ગળ્યા ફળો, ધી, માખ, મલાઈ, ચીજ, ચોકલેટ, જેલી, મીઠા બિસ્કીટ, આઈસ્ક્રીમ, ફરસા અને અથા । જેવી વસ્તુઓ આહારમાં ન લેવી જોઈએ.

### ● ડાયાબિટીસના દર્દીએ આહારમાં શું છૂટથી લેવું?

ડાયાબિટીસના દર્દીએ લીલા કભાજ, ફલાવર, ગુવાર, સલાડ, કાકડી, મૂળા, મોગરી, ગાજર, કોબીજ, મરચા, લીલી કુંગળી, દૂધી, કોળું, કાચા ટામેટા, મલાઈ વગરનું દૂધ, ધા, ફળોમાં - પપૈયું, મોસંબી, નારંગી, લીલા નારીયેળનું પા ૧, બાફેલા મગ, ખાખરા, મગનું પા ૧, દાળ, વેજટેબલ સુપ, લીંબુ પા ૧, સોયાબીનનું તેલ જેવી વસ્તુઓ આહારમાં છૂટથી લેવી જોઈએ.

### ● ડાયાબિટીસના દર્દીએ મર્યાદિત પ્રમાણમાં શું લેવું?

ડાયાબિટીસના દર્દીએ મીહું (નમક), ભાત, ખીચડી, સૂર, મોળા બિસ્કીટ, દરેક પ્રકારનું ધાન્ય જેવા કે ઘઉં, બાજરી તથા તેવમાં તલનું તેલ કે સીંગતેલ જેવી વસ્તુઓ આહારમાં મર્યાદિત પ્રમા માં લેવી જોઈએ.

તહુપરાંત દર્દીએ બીજી કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જેમકે નિયમિત ચાલવા જવું, કસરત કરવી, યોગ્ય સમયના અંતરે બ્લડ સુગરનો ટેસ્ટ કરાવવો (બ્લડ સુગર કાબૂમાં હોય તો ૫), અને ડોક્ટરને રીપોર્ટ બતાવીને સલાહ લેવી. ગોળી કે ઇન્સ્યુલીનનાં ડેઝમાં જાતે ફેરફાર ન જ કરવો. ગોળી કે ઇન્સ્યુલીન લીધા પછી ઉપવાસ ન જ કરવો. લોહીની તપાસ સમયે ગોળી કે ઇન્જેક ન સૂચના પ્રમા લેવું જ. નાચા પછી પગ અને પગની પાની, આંગળીઓ સંપૂર્ણ સાફ કરવા. ઉનાળામાં પાવડર છાંટવો. ચિયાળામાં કીમ લગાડવું. આગળના ભાગથી પહોળા બૂટ પહેરવા. ચુસ્ત બુટ-ચંપલ ન જ પહેરવા. આંખ, દાંત, પગ, બ્લડ પ્રે રની નિયમિત તપાસ કરાવવી. દાઢી કરતી વખતે કે નખ કાપતી વખતે ઈજા ન થાય તે ખાસ જોવું. ચિયાળામાં મોજા પહેરવા. અંડર ગારમેન્ટ્સ પ ઢીલા પહેરવા. ખુલ્લા પગે ચાલવું નહીં. ક્ય બને તો પગને દરરોજ માલી કરવી.

ખૂબ જ પરસેવો થાય, ખૂબ જ ભૂખ લાગે, ચક્કર આવે, ધબકારા વધી જાય, બોલવામાં તકલીફ પડે, ઉચ્ચાર રોષ્પ ન થાય, બેભાન થઈ જવાય — આવું કોઈ પ લ. દેખાય તો તરત જ ગ્લુકોમીટરથી બ્લડ સુગર ચેક કરવું. સુગર ઓછી હોય તો ખાંડ કે ગ્લુકોઝનું પા રી આપવું. ડોક્ટરને તુરંત બતાવવું. સુગર વધું હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. સુગર વધી જવાથી પ ડી.કે.એ. અર્થાત્ ડાયાબિટીક કીટો એસિડોસીસ થઈ કે છે. દર્દીને શાસ પ ચેડે છે. દર્દીના રીરમાંથી વિચિત્ર પ્રકારની હુર્ગિં આવે છે. દર્દીના મૂત્રનું પરી. કરવાથી તેમાં એસીટોનાનું પ્રમા વધી ગમેલું જ રીતે આ સમયે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને ટ્રીટમેન્ટ અપાવવી ખૂબ જ જરૂરી હોય છે અન્યથા જાનનું જોખમ પ ઊભું થઈ કે છે.

### ● નીચેના ચિહ્નો જણાય તો તરત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો :

પગ ઠંડા પડી જવા, હાથ-પગમાં ખાલી ચડવી, હાથ પગના તળિયામાં બળતરા થવી, નખ કે આંગળીઓનો કલર બદલાવા માંડવો, ગોટલા ચડી જવા, પોતાને ખબર

પડ્યા વગર જ ચંપલ પગમાંથી નીકળી જવા, ચક્કર આવવા, વારંવાર પરસેવો થવો.

એટલું યાદ રાખો કે ડાયાબિટીસ માટે તપાસ કરાવવા વધુ ભરોસાપત્ર પદ્ધતિ રક્ત લઈ ગ્લુકોઝ ઓક્સિડિઝ ટેસ્ટ દ્વારા લેબોરેટરીમાં કરવામાં આવતી ચકાસ રીજ છે. ગ્લુકોમીટરથી જાતે પરી. જરૂર કરો ૫ લેબોરેટરીમાં થયેલા વિશ્વસનીય પરી. સાથે ગ્લુકોમીટર દ્વારા કરાયેલા પરી. ની સરખામ રીજ કરી તમારા સાધનની ‘એક્યુરરી’ અથવા વિશ્વસનીયતા નક્કી કરવી ખૂબ જ જરૂરી છે.

ડાયાબિટીસના દર્દીના લોહીમાં ગ્લુકોઝનું પ્રમા ચોવીસ કલાકમાં ભોજન પહેલાના સમય દરખાન (FBS) ૧૦૦ થી ૧૨૦ mg/dl એટલું અને ભોજન કર્યાના બે કલાક પછી ૧૮૦ mg/dl થી ઓછું અને ગ્લાયકો સીલેટેડ ઇમોગ્લોબિનનું પ્રમા ૭%થી ઓછું હોય તો ડાયાબિટીસ નિયંત્ર માં છે એવું કંઈ કાય છે. આ ઉપરાંત ડાયાબિટીક દર્દીએ દર વર્ષે ઈ.સી.જી. (ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ), છાતીનો એક્સ-રે, પે બમાં પ્રોટીનનું પ્રમા, બ્લડ યુરીયા, કિએટીનીન અને કોલેસ્ટ્રોલનો રીપોર્ટ તથા આંખ અને કિડનીની તપાસ અને બી.પી. ચેક કરાવતા રહેવું જોઈએ. ■

### શ્રી કચ્છી સમાજ - અમદાવાદની મહિલા ઉત્કર્ષ સમિતિ

#### સમિતિ દ્વારા આયોજિત કૂતુર વર્ષ સ્નેછ મિલન

શાન્દિવાર, તા. ૨૩-૧૧-૨૦૧૪

સમય : બપોરે ૨.૪૫થી ૫.૦૦

સ્થળ : પરીમલ ગાર્ડન, આંબાવાડી.

સાથે સાથે શ્રીમતી લીલાબહેન વીસરિયા શ્રી સ જિતકર ની સમજ આપે.

લીલાબહેન વીસરિયા હાલમાં ઓન. પ્રોફેસર, ગુજરાત ઇન્સ્ટી. ઓફ ટેવલપમેન્ટ રીસર્ચ, અમદાવાદમાં સેવા આપે છે.

પ્રથમ ૧૫ મહિલાઓને સમયસર હાજરી માટે લક્કી ડ્રો માં સામેલ કરો.

આપની સાથે પેન અને પા રીજરૂરથી લાવવું.

તો ચાલો સખીઓ - બહેનો, થઈ જવ તૈયાર, એકમેકને મળવા....

શ્રીમતી શિલ્પિને શાહ  
કન્વીનર, મહિલા ઉત્કર્ષ સમિતિ  
શ્રી કચ્છી સમાજ - અમદાવાદ

## “કચ્છ શ્રુતિ”ના “કચ્છી કંપા વિશેષાંક”ના વિમોચન કાર્યક્રમને કચ્છકડામાં કંડારતા



શ્રી જેઠાભાઈ ખેતાભાઈ પટેલ (ડાને)નું સ્વાગત કરતા  
શ્રી અશોક મહેતા




શ્રી રાજાભાઈ ખેતાભાઈ પટેલ (ડાને)નું સ્વાગત કરતા  
શ્રી ભરત આગ્રા



મંચસ્થ મહાનુભાવો. ડાનેથી : શ્રી રાજાભાઈ ખેતાભાઈ પટેલ, શ્રી કેલાસદાન ગટવી, શ્રી મનસુખભાઈ પટેલ, શ્રી અશોક મહેતા,  
શ્રી જેઠાભાઈ ખેતાભાઈ પટેલ, શ્રી ખીમજુભાઈ રામદાસભાઈ પટેલ, શ્રી વિહુલદાસ કાનજુભાઈ પટેલ તથા શ્રી સુરેશભાઈ ડી. પટેલ



કચ્છશ્રુતિના “કચ્છી કંપા વિશેષાંક”ના વિમોચન સમયે



શ્રી કેલાસદાન ગટવી (ડાબે)નું સ્વાગત કરતા  
શ્રી અશોક મહેતા



શ્રી મનસુખભાઈ પટેલ (ડાબે)નું સ્વાગત કરતા  
શ્રી અશોક મહેતા

## ડૉ. પ્રશાંત ભીમાણીનો હિનોટીગ્રમ શો



ડોનેશનની રકમ સ્વીકારતા કાર્યકરો. ડાબેથી : શ્રી પરબતભાઈ પટેલ,  
શ્રી મનુભાઈ કોટડિયા તથા શ્રી દીપક નાનાલાલ ચૌહાણ.




હિનોટીગ્રમ શરૂ કરતા અગાઉ જરૂરી સુચના આપતા  
ડૉ. પ્રશાંત ભીમાણી.



કિકેટ રમતા કેટલાક હિનોટાઇગ્ર્રુડ ખેલાડીઓ - કોઈક બેટીંગ કરે છે  
જ્યારે કોઈક બોલીંગ કરે છે.



હિનોટીગ્રમની અસર હેઠળ પતંગ ચગાવતા...




હિનોટીગમની અસર હેઠળ લગ્નમાં ડાંસ કરતા.



હિનોટીગમની અસર હેઠળ કૃપા મનીષ છાડવાને પ્રેક્ષક ગણમાંથી આવેલ ડૉક્ટર ઈંજેક્શનની સોચ ભોકે છે છતાં તેને ડાબા હાયે કોઈ અસર નથી. ફોટામાં ડાંબી બાજુએ બિબેલ પારસ વીરાના હાથમાં ઈંજેક્શનની સોચ ભોકાયેલ છે.



પ્રેક્ષક ગણ પર માસ હિનોટીગમનો પ્રયોગ




પ્રેક્ષક ગણ પર માસ હિનોટીગમનો પ્રયોગ



હિનોટીગમની અસર હેઠળ  
૫ વર્ષના ભાળક બની લખોટી રમતા.



હિનોટીગમની અસર હેઠળ ૧૦ મહિનાના ભાળક બની  
ઘૂંટણિયે ચાલતા.



હિનોટીગમની અસર હેઠળ મહિનાના ભાગક બની દૂધની બાટલી પીતા.



હિનોટીગમની અસર હેઠળ કલાસ શિક્ષકની ગેરહાજરીમાં પાંચ વર્ષના ભાગક બની દીંગામસ્તી અને મારામારી કરતા.




હિનોટીગમની અસર હેઠળ પુષ્પાબેન કે. શાહ પટિના રોલમાં અને પારસ વીરા પટ્ટનાના રોલમાં એકલીજા સાથે ગંડા કરતા.



હિનોટીગમની અસર હેઠળ ગરબા લેતા ખેલેયાઓ.



હિનોટીગમની અસર હેઠળ કથ્યક ડાન્સ કરતી કુ. કૃપા મનીષ છાડવા.



ડૉ. પ્રશાંત ભિમાણી (વચ્ચે) નું સન્માન કરતા શ્રી મનુભાઈ કોટડિયા (ડાબે) અને શ્રી ભરત ઓગા (જમણે)

## નાળિયેરી - (૨)

● દિલીપ વૈશનવ ●

નાળિયેરીના કોપરા અને પા ઐની મીઠા ગત લેખના બ્ધો દ્વારા મા ઐ તેમજ તેના સ્વાસ્થ્યપ્રદ લાભ વિશે પ જાણ્યું. જમીની ખારા અને અસ્વસ્થ પા ઐ ગળાઈ ગળાઈને કેઠ ઉપર પહોંચી શ્રીફળમાં ભરાય છે - સ્વસ્થ, જંતુરહિત અને સ્વાદમાં મીઠું. છે ને આ કુદરતની કમાલ! યદા સાહેબને આ કુદરતી કરિશમામાં ઈશ્વરના દંન થતાં. તેઓ કહે છે કે : 'હાથમાં લઈને જરા શ્રીફળ, વિચાર કો ત્યાં જઈને ભરે છે જળ, વિચાર!'

આયુર્વેદ તો ૪૦૦૦ વર્ષ પહેલા સંસ્કૃતમાં નાળિયેરીના કોપરા અને પા ઐ લાભદાયી છે તેમ જ ઈયું છે. આ વાત વિજ્ઞાને પ કેટલાક અભ્યાસ બાદ કહી છે. નાળિયેરીનું તેલ પ તેટલું જ ફાયદાકારક છે. એટલું જ નહિ, પ નાળિયેરીના મૂળ, પાંડા, થડ વિ. પ મનુષ્યલોક માટે ઉપયોગી છે.

વનસ્પતિના બીજમાંથી ખાદ્યતેલ તૈયાર થાય છે. અપવાદ રૂપે રાઈસ બ્રાન તેલ ડાંગર - ચોખા ઉપરની કુશ્કી (ફોટરા, છોડા)માંથી તૈયાર થાય છે, જે ચોખાના કુશ્કી તરીકે ઓળખાય છે. થોડા વર્ષોથી આ રાઈસ બ્રાન તેલ વપરા માં છે. કોપરેલ સહિત અન્ય ૮-૧૦ પ્રકારના ખાદ્યતેલો વપરા માં છે. યાદ રાખો કે આપ ઇંદ્ર ખાદ્યતેલો વનસ્પતિજન્ય છે, જે તમામ તેલોમાં કોલેસ્ટ્રોલ હોતું નથી. તેલ ઉત્પાદકો પોતાના તેલની મોટીમસ જાહેરાત કરે છે કે અમારું તેલ કોલેસ્ટ્રોલ ફી છે, જીરો કોલેસ્ટ્રોલ છે, નો કોલેસ્ટ્રોલ વિ. આ જાહેરાતો હુંબગ છે. આપ ને છેતરવા માટેની તે લોકોની ચાલાકી છે!

આપ ઇંદ્ર બધા જ તેલોમાં ચરબી (ફેટી એસિડ) હોય છે. ફેટી એસિડનું પ્રમા દરેક તેલમાં એકસરખું હોતું નથી. ફેટના બે પ્રકાર - સેચ્યુરેટેડ (સંતૂષ્ટ) અને અનસેચ્યુરેટેડ (અસંતૂષ્ટ). વળી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ બે પ્રકારમાં વિભાજીત છે : (૧) મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ (મુફા) અને (૨) પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ (યુફા). ઉપર કહ્યું તે મુજબ કોઈક તેલમાં સેચ્યુરેટેડ ફેટ

ઓછું હોય, તો કેટલાકમાં મુફા, યુફા ચરબી વધારે હોય તો સેચ્યુરેટેડ ફેટ પ્રમા માં ઓછું હોય. સેચ્યુરેટેડનું પ્રમા જે તેલમાં વધારે હોય તે તેલ સ્વાસ્થ્યપ્રદ નથી એમ મનાય છે. મુફા અને યુફા પ્રકારના તેલ તંદુરસ્તી માટે સારા છે. ધી, બટર, ડાલડા ધી તેમજ પ્રા ૧૪ન્ય તેલ સેચ્યુરેટેડ ફેટનું ઉચ્ચ પ્રમા ધરાવે છે, જે હદ્યને નુકસાનકર્તા છે પરંતુ વનસ્પતિજન્ય તેલમાં સેચ્યુરેટેડ ચરબી વધારે પ્રમા માં હોય તો પ રીર માટે નુકસાનકારક નથી. આપ જે તેલ - કોપરેલની વાત કરવાના છીએ તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમા ૮૫% છે, જ્યારે મુફા અને યુફા પ્રકારની ચરબી બંને મળીને માત્ર ૫% છે. આમ ૮૫% જેટલી સેચ્યુરેટેડ પ્રકારની ચરબી હોવા છતાં રીર માટે લાભકર્તા છે. આપ ઇંદ્ર માન્યતા મુજબ કોપરેલ જામી જાય (૮ વાળામાં) એટલે રીરમાં પ જામી જાય તો નુકસાનકર્તા છે. પ આ વાતમાં તથ નથી. ભારતમાં ખાસ કરીને કેરાલા તેમજ લાદ્વીપ, આંદામાન ટાપુઓ, શ્રીલંકા, ઈન્ડોનેઝિયા, ફિલીપીન્સ અને પેસિફિક આઈલેન્ડના મોટાભાગની પ્રાજા નાળિયેરીનું તેલ ખાવામાં છુટ્ઠી વાપરે છે. ત્યાં નાળિયેરી પુષ્ણ થાય છે. પેસિફિક આઈલેન્ડના લોકો કુલ કેલેરીની ૩૦થી ૬૦% જેટલી કેલેરી કોપરેલ તેલ દ્વારા લે છે. તેમ છતાં આ વસ્તીમાં કાર્ડિયોવસ્ક્યુલર ડિસોર્ડર્સની બીમારી જોવા મળતી નથી. ભારતમાં થયેલ એક અભ્યાસ મુજબ કોપરેલ કે તેનું તેલ આરોગવાથી હદ્યરોગ સંબંધી કે અન્જાઈની પેઇનની તકલીફની એક પ હડીકત જોવા મળી નથી.

કોપરેલમાં વનસ્પતિજન્ય સેચ્યુરેટેડ ચરબી ધરાવે છે. તેમાં લોરીક એસિડ (Lauric Acid) અને કેપરીક એસિડ રહેલા છે. લોરીક એસિડ મિડીયમ ફેટી એસિડની ચેઈન ધરાવે છે, જે તંદુરસ્તી માટે સારું છે. કોપરેલ ખાદ્યપદાર્થ દ્વારા જઈરમાં પહોંચે બાદ તેના લોરીક એસિડ મોનોરિયમ (મોનોગ્લિસરાઈડ)માં ફેરવાય છે. જે એન્ટી વાઈરલ, એન્ટી ફિગસ, એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી પેરેસાઈટના ગું ધર્મો ધરાવે છે. જેની રોગપ્રતિકારક ક્રિત ઘ ઇંદ્ર રોગથી બચાવે છે. ખાસ કોપરેલમાં રહેલ આ તત્ત્વ ઈશ્વરી

બ હીસ છે. ઈશ્વરે માતાના ધાવ માં પ લોરીક એસિડ આખ્યું છે. તે બાળકની આરોગ્ય બાબતે ૨ ॥ કરે છે. બાળકના વજન (કિ.ગ્રામ)ના પ્રમા માં તેટલા ગ્રામ લોરીક એસિડ બાળકને દરરોજ માતાના દૂધમાંથી મળતું રહે છે. માતાના દૂધમાં રહેલા અન્ય પોષક તત્ત્વોની સાથે લોરીક એસિડ બાળકની ઈભ્યુનીટી જણવી રોગથી દૂર રાખે છે તેમજ બાળકની વૃદ્ધિ અને વિકાસ પ કરે છે.

લોરીક એસિડ અને કેપ્રીક એસિડ કોપરેલમાં છે. તેથી કોપરેલ રીર માટે ફાયદાકારક છે. લોરીક એસિડનો મેડિસીનલ ઉપયોગ પ છે. લોરીક એસિડની આટલી સમજ આપ્યા બાદ કોપરેલ તેલના ફાયદા જોઈએ. કોપરેલ રીરમાં ચચાપચયની કિયા સક્રિય કરે છે.

રીરની ચરબી ઓગાળવામાં પ મદદકર્તા છે. રીરને કિત્ત આપે છે, ત્વા તેમજ કે માટે સારું છે, વ્યક્તિની સુંદરતાને વધારે છે. અમેરિકન જનરલ ઓફ ક્લિનિકલ ન્યુઝ્ટ્રી ન (માર્ચ ૨૦૧૦)ના એક લેખમાં વિદ્ધિત કર્યા મુજબ સેચ્યુરેટેડ ફેટ ધરાવતું કોપરેલ તેલ અને કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ વચ્ચે કોઈ સંબંધ નથી. અર્થાત્ હદ્યરોગ ન થાય. કોપરેલ મગજ અને થાઈરોઇડની કામગીરીને સક્રિય કરે છે. ઉપર જ ત્વા મુજબ ઈભ્યુનીટી વધારી ચેપી રોગથી દૂર રાખે છે. કોપરેલ માણેના લોરીક એસિડ અને કેપ્રીક એસિડને આભારી આ ફાયદા છે. સમજદારી પૂર્વકનો નિયમિત ઉપયોગ રીર માટે ફાયદાકારક છે. ડૉ. મેરી જી. એનીગની ભલામ મુજબ બાળકથી માંડીને પુખ્ખવયના લોકોએ દરરોજ સરેરા એક દોઢ ચચાયાથી ત ચચાયા સુધી કોપરેલ તેલ ફાયદાકારક છે. (સરેરા રોજનું ૧૦ ગ્રામથી ૨૦ ગ્રામ જેટલું લોરીક એસિડ જરૂરી છે. ૧ ચચાયો = ૭ ગ્રામ.)

આયુર્વેદ પ વરસોથી આ વૃંને સંજીવની ગ ૧ તેના કોપરુ, પા ૧, તેલ વિ. ખૂબ ફાયદાકારક છે તેમ કહું છે. લીલા નાળિયેરમાં ભરપૂર ઈલેક્ટ્રોલાઈટ્સ તત્ત્વો છે. જેથી જાડા, ઉલટી, અતિ ય ગરમીને કાર્ય રીરનું પા ૧ અને જૈવિક તત્ત્વો નીકળી જાય તે નાળિયેરીનું પા ૧ આ તકલીફ દરમ્યાન વારંવાર પીવાથી રીરને ભેજ અને પોષક તત્ત્વો પુનઃ મળી જતાં રીરને તાજગી અને કિત્ત મળે છે. યાદ રાખો કે આયુર્વેદ પ્રમા નાળિયેરીનું પા ૧ અને દૂધ, મગ અને મગનું ઓસામ વિરુદ્ધ આહાર છે. આ વિરુદ્ધ આહાર લેવા વચ્ચે સમયનો ગાળો અવશ્ય રાખવો.

નાળિયેરનું તેલ સ્વીઓને મેનોપોઝ દરમ્યાન થતી તકલીફમાં રાહત આપે છે. આયુર્વેદ અનુસાર કોપરેલ ફૂસિના ક છે. વાળ અને ત્વા ર ક આ તેલ છે. સૂકી ચામડી તેલ માલી કરવાથી ફાયદો થાય છે. ખોડો દૂર કરે - ખોડો થવા ન હે - ચામડીની તકલીફ દૂર કરે, આમ બોડી અને હેર માટે કન્દિ નર તરીકે આ તેલ સેવા કરે છે. દાં ભારતીય સ્વીઓ અને પુરુષોની ચામડી ચમકતી, સુંવાળી અને ઘણું કાળી હોય છે. તેલ રીરનો મેદ ઘટાડે, થાઈરોઇડનું ફક ન સારું થાય, પેનક્લિયાસનો સ્ટ્રેસ ઘટાડે, પાચન સારું રાખે, કબજ્જ્યાત દૂર થાય, બી.પી. અને કોલેસ્ટેરોલને સપ્રમા રાખે, જેથી હદ્યરોગ ન થાય. કોપરેલ ગરમ કરવાથી સ્થિર (Heat stable) હોવાથી રસોઈમાં નુકસાનકારક નથી. કોપરેલની પ્રકૃતિ હંડી છે. પિત દોષને હંત કરે છે.

કોપરેલ તેલના બૌતિક ગું મેદાં તે રંગવિહીન છે. ગરમીમાં પ્રવાહી અને ઠંડીમાં જામી જાય ત્યારે સફેદ થાય છે. ૨૫૦ સેન્ટીગ્રેડ તેલ ઓગળેલું રહે, ૨૫૦ સેન્ટીગ્રેડથી નીચા ૩૭ તામાને જામવા લાગે. સ્મોકિંગ બિંદુ ૧૩૩૦ સેન્ટીગ્રેડ છે. તેલ રૂમ ટેમ્પરેચરમાં પા ૮૮માં વિનાય નથી.

રાસાયનિક ગું જોઈએ તો આગળ કહું તેમ ૮૫% સંતૃપ્ત ફેટી એસિડ (સેચ્યુરેટેડ) તત્વ ધરાવે છે. જેમાં મુખ્યત્વે લોરીક એસિડ અને તેની સાથે કેપ્રીક એસિડ અને અલ્ફ પ્રમા માં અન્ય પાંચ-૭ એસિડ છે. અસંતૃપ્ત (અન્સેચ્યુરેટેડ) એટલે મુફા અને યુફા ફેટી એસિડ - બંને મળીને ૫% પ્રમા છે. મુફા અને યુફામાં એસિડ તત્વ છે (લીનોલીક એસિડ અને લીનો લેનિક એસિડ). કોપરેલમાં મુખ્યત્વે લોરીક એસિડ લાભદાયી જૈવિક કિયા કરે છે. એટલે તેમાં ખનીજ તત્ત્વો અને વિટામિનો નથી. અપવાદરૂપે ખનીજ તત્ત્વોમાં આયર્ન, સેલેનિયમ અને વિટામિન-ઈ અને કે આપેલા છે. આયર્ન લોહીના પરિવહન કાર્યની સંભાળ લે છે. વિટામિન-ઈ ત્વા અને કે માટે જરૂરી છે, અન્ય જૈવિક કિયા પ કરે છે. વિટામિન-કે જરૂર પદ્ધે લોહી ગંધાવામાં મદદરૂપ બને છે.

નોન રીફાઈન્ડ તેલ માર્કટમાં ઓદ્ધું મળે. ખાવાના ઉપયોગ માટે ઓર્ગનિક કે વર્જન તેલ શ્રેષ્ઠ છે. તેલના જીવન જરૂરી પોષક તત્ત્વો તેમાં અને ફિલ્ટર તેલમાં સચ્ચવાય છે. પ્રોસેસ રીફાઈન્ડ તેલમાં પ પોષક તત્ત્વો પ્રમા માં ઓછા જળવાય છે.

(અનુસંધાન : જુઓ પાના નં.-૨૮ ઉપર)

કચ્છમાં રાજશાહી સમયની નાગરી પરંપરા

## મંગળા આરતી આજપર્યાત કાયમ છે

• ડૉ. મિહિર અમ. વોરા •

સૌપ્રથમ દે વિદે માં રહેતા તમામ સૌ ભારતીય ભાઈ-બહેનોને મારા સાલ મુખારક. ખાસ કરીને આપ એક કચ્છી ગુજરાતી ભાઈ-બહેનોને મારા દિવાળી નવા વર્ષના ખાસ જુબાનંદ સહ.

આ ઉપરોક્ત વિષયના સંદર્ભમાં મારે એક વાત કરવી છે કે આ નાગરી પરંપરા જે આખા ગુજરાતમાં બહુ જ જૂજ જૂજાએ જ જોવા મળે છે, પ તેનું કચ્છમાં ખાસ કરીને કચ્છના પાટનગર ભુજમાં તે પરંપરાનું બહોળું મહત્વ છે. જે રાજ હીઠથી આજ સુધી કાયમ છે. ખાસ દે -વિદે થી અનેક ભક્તજનો આ નાગરી મંગળા આરતી પરંપરાનો લાભ લેવા આવે છે. આવો, સૌ પ્રથમ રાજ હીઠની દિવાળીનો ઈતિહાસ જી જીએ.

રાજ હીઠના વખતમાં પ દિવાળીના પર્વની ધ્યામધૂમથી ઉજવ રે થતી હતી. દિવાળીના દિવસોના ખાસ કરીને રૂઆતના પાંચ દિવસો - ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ - પાંચેય દિવસો ભુજ હેરના ઐતિહાસિક પાંચ નાકા અને છદ્દી બારીને આસોપાલવના તોર રોથી ગારવામાં આવતા. મિ બતી, ફાનસના ઉજસમાં સમગ્ર પ્રકા આખા હેરમાં પાવન રીતે પ્રસરી જતો હતો. જેમાં કોમી એકતા, આનંદ, હાતની ભાવના પ્રગટ થતી હતી. દરબારગઢને વિશે રીતે રંગબેરંગી રો નીથી ગારવામાં આવતો હતો અને સવારથી નાકામાં ઢોલ - ૨ હીઠના માદક અવાજથી આખું વાતાવર પવિત્ર ખુ નુમા બની જતું. અને સાથે સાથે નોબતનો નાજુક તાલ જે આખા વાતાવર માં પવિત્રતાનો અહેસાસ કરાવતો હતો.

તે સમયે મોંઘવારીનું ગ્રહ ઓછું હોવાના કાર યથા કિંતુ મા સોની ખરીદ કિના આધારે બજારમાં ભીડ જોવા મળતી હતી. દિવાળીની રાતમાં પાળોશ્વરમાં ચોકમાં વિવિધ પ્રકારની આત બાજ છોડવામાં આવતી હતી. કચ્છની સમગ્ર પ્રજા હક્કેદઠ મેદનીમાં ઉપસ્થિત દ વિતી હતી. આઈના મહેલની રો ની સોનામાં સુગંધ ભેણવતી અને આજે પ અનેક કચ્છી વડીલો તે સમયની

દિવાળીને યાદ કરીને આંખમાં પા રે લઈ આવે છે તે રીતે પવિત્ર વાતાવર માં દિવાળી ઉજવાતી. ઉપરાંત પ્રત્યેક વ્યક્તિ સંપૂર્ણ ભારતીય પોણાક સાથે સાઝે અથવા ટોપી અને ઝીઓ નખ જીખ ભારતીય સાડીમાં જ દરેક વડીલોના ઘરે પ્ર જી પરંપરાને કાર કચ્છની દિવાળી મહેકી ઉઠતી હતી. રાજાને મળવા દરબારમાં ભીડ જામતી અને રાજ યથા કિંતુ પ્રજાને દાન અને બોજનની વ્યવસ્થા કરતા હતા. આ જ સમયે રાજ પ અચૂક જોવા આવતા એવી એક પરંપરા હતી અને આજે પ છે તે છે “નાગરી મંગળા આરતી”ની પરંપરા. ભુજ હેરના ઉપલી પાળ રોડ પર આવેલું હાટકેશ્વર મહાદેવનું મંદિર અને હમીરસરના કિનારેથી આગળ વધતી કલ્યાંશુર મહાદેવના મંદિરે સવારે પાંચથી સાતના ગાળા દરમ્યાન મહાદેવની આરતી સાથે પવિત્ર વાતાવર સર્જવામાં આવતું, જે આજે પ કાયમ છે. નાગરી પ્રજા દે વિદે માં જ્યાં હોય, ગમે તે ખૂબું ખાંચરે હોય પ દિવાળી તો ભુજની જ. કાર કે જે મંગળા આરતી વખતે હૃદયના તાર જ જ વી મૂકે તેવી ભીડ વચ્ચે નોબતના તાલે, ઢોલીના થાપે અને આરતીના સંગાથે જે ભુજ મંદિરના પૂજારી મહારાજ દ્વારા આરતી કરાય છે તેને કાર સમગ્ર ભુજમાં ભક્તિમય વાતાવર સર્જય છે. અને ત્યારબાદ કલ્યાંશુર મંદિરે પાછી બીજી આરતી સાથે મંગળા આરતીની પૂર્ણિમા થાય છે. ત્યારબાદ સમગ્ર કચ્છની પ્રજા અને ભુજના રહેવાસીઓ કોઈપ જાતના નાતજાતના ભેદભાવ વગર હમીરસરના કિનારે ભવ્ય આતિ બાળનો નજરો સહકુદુંબ સાથે હમીરસરના ઓટલે બેસીને મા છે. આ મંગળા આરતીનું મહત્વ આજે પ નાગરી નાતે જાળવી રાખ્યું છે. આજે પ દિવાળીના રૂઆતના ત્ર દિવસો ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના ત્ર દિવસો સુધી સવારે પાંચથી સાત વચ્ચે હાટકેશ્વર મંદિરમાં અને કલ્યાંશુર મંદિરમાં મંગળા આરતીનું પ્રસ્થાન ચાલુ છે. આ પવિત્ર ભક્તિમય વાતાવર માં ભુજના તમામ

(અનુસંધાન : જુઓ પાના નં.-૧૬ ઉપર)

મૌલિક વાર્તા

## અનુભેન ગરણીવાળા

● બલવીરસિંહ જાડેજા ●

‘કહું છું, સાંભળો છો?’

‘હજુ સુધી તો બરાબર સંભળાય છે કે આ તારો જ અવાજ છે.’

‘ભઈસાબ, તમે તો ખરા છો! દરેક વાત હળવા થી લેવાની! કોઈ વાત ગંભીર ગ વાની જ નહીં?’

‘હવે રીતાયર થઈ ગયા પછી ક્યાં કોઈની નોકરી કરવાની છે, તારા સિવાય.’

‘બસ હવે બહુ થયું. કહું છું, આ કામવાળા કાંતિએ ચા ગાળવાની ગર એ તોડી નાખી છે. બે સ્ટીલની ગર એ છે પ અભિન્થી ચા જલ્દી ગળાતી નથી. એ દૂધ ગાળવામાં જ કામ આવે તેવી છે. દરરોજ સાંજે બગીચામાં જાઓ છો તો રસ્તામાંથી પટેલની દુકાનેથી સારી જાતની પ્લાસ્ટિકની કે સ્ટીલના વાયરવાળી ચા ગળાય તેવી ગર એ લેતા આવજો. પાછા ભૂલી જતા નહિં.’ અનુભહેને પતિ ધીરજલાલને સવારે ચા પીધા પછી યાદ કરાયું.

‘સારું, ચાલો યાદ કરીને લેતો આવી.’

અનુભહેનને પતિ ધીરજલાલ ઉપર, યાદ રાખીને ગર એ લાવવાનો ભરોસો નહોતો. એટલે મોટા દીકરા રાજે ની પત્ની મેધાને કહું, ‘તું કહાનને સ્ક્રૂલે મુકવા જાય છે, તે રસ્તે પ્લાસ્ટિકવાળાની દુકાનેથી સારી ગર એ લેતી આવજે ને, ચાની ગર એ તૂટી ગઈ છે.’

‘હા મમ્મી, લેતી આવી.’ મેધાએ ખાત્રી આપી.

સાંજે દ ‘ન કરવા અનુભેન મંદિરે ગયા ત્યારે રસ્તાની દુકાનમાં ગર એઓ લટકતી જોઈ પ ઘરના બે વ્યક્તિને કહું છે એટલે એકાદ તો લાવ’ જ – વિચારી પોતે ગર એ ખરીદી નહીં.

સાંજે બધા જમવા બેઠા એટલે અનુભહેને પૂછ્યું, ‘તમે લાવ્યા ગર એ?’

‘અરેરે... પેલા મોહનભાઈએ રસ્તામાં વાતોમાં એવો તો રોકી રાખ્યો કે દુકાન પાસેથી પસાર થયા છતાં યાદ આવ્યું જ નહીં. કાલે ચોક્કસ લઈ આવી.’

‘અને મેધા, તું પ ગર એ લાવી કે નહીં?’

‘અરે મમ્મી જતી વખતે સ્કૂલનો સમય થઈ ગયો

હોવાથી ઉતાવળમાં હતી અને વળતી વખતે એ દુકાન રસ્તાની સામેની બાજુ હતી. એટલે છેક ચાર રસ્તાથી ફરીને જવું પડે અને ફરી ઘરે આવવા બીજા ચાર રસ્તાથી વળવા માટે મોટું ચક્કર કાપવું પડે. એટલે મને થયું કે કાલે સવારે વહેલી નીકળી, સ્કૂલ જતી વખતે લઈ લઈ.’

‘મને ખબર જ હતી કે તમે લોકો કોઈ વાત ગંભીરતાથી લેતા જ નથી. પછી સવારે ચા બનાવતી વખતે હેરાન તો મારે જ થવાનું ને! ચા ગાળવામાં સ્ટીલની નાના કા વાળી ગર ઐથી કેટલી તકલીફ પડે છે એ તમને લોકોને ક્યાંથી ખબર પડે! તમારે બધાને તો બસ મમ્મી, ચા લાવો એમ જ બોલવું છે ને!’ બધાને અનુભહેને ડાઇનિંગ ટેબલ ઉપર જ સંભળાયું.

બીજા દિવસે સવારે જેમ તેમ સ્ટીલની ગર ઐથી ચા ગાળી બધાને પીવડાવી તો ખરી, પ નક્કી કર્યું કે, ‘મારે જ ગર એ લાવવી પડે’. હેઠું બાળવા કરતાં હાથ બાળવા સારા. સાંજે દ ‘ન કરવા જઈ ત્યારે ભૂલ્યા વિના લેતી આવી.’

પ આજે ધીરજલાલે ચીવટ રાખીને બગીચાના રસ્તે આવતા પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી સારી જાતની ગર એ માંગી.

‘આવો આવો એઠ, ઘ એ સમયે ભૂલા પડ્યા? લ્યો, આ સારી જાતની અને ફેમસ કંપનીની ગર એ.’

ધીરજલાલે ગમી જાય એવા રંગની ગર એ પસંદ કરી રૂ. ૧૦૦/- આપ્યા.

‘અરે મારા સાહેબ, છૂટા આપોને!’

‘છૂટા તો નથી, ૧૦૦ની નોટ જ છે.’

‘અરે સાહેબ, પછી આપજો! પૈસા ક્યાં ભાગી જવાના છે? પ એમ કરો, આપને ગર એ ગમી હોય તો બીજા રંગમાં એક બીજી લઈ લો. બાજબી ભાવ કરી આપી.’

ધીરજલાલ સેલ્સમેનની વાતમાં આવી ગયા અને બે ગર એના પૈસા ચુકવી, બાકીના પૈસા પાછા લઈ, હરખાતા હરખાતા ઘર તરફ આવતાં વિચારતા હતા કે આજે તો અનુને કહી કે, ‘એક ગર એ તૂટી જાય તો પ ચિંતા નહીં. બે ગર એ લાવ્યો છું!’

કહાનને રસ્તે મૂકવા જતા મેઘાએ પ્લાસ્ટિક સ્ટોરમાં જાતજાતની ગર્વી જોઈ એટલે એકને બદલે બે અને બે ને બદલે ત્રીજે લેવી હોય તો? ઓછા પૈસા કરાવી, ‘કેટલી સસ્તામાં ગર્વી પડી!’ વિચારતી મમ્મીને રાજી કરી દઈ એમ ત્રીજે ગર્વી એવે પણ લીધી.

અનુભેનનો મોટો દીકરો મેઘાનો પતિ રાજે પણ જમવાના ટેબલ ઉપર ગઈકલે સાંજે હાજર હતો. મમ્મીની હાયવોય એવે પણ સાંભળી હતી. વળી પણ્ણાની ઊભર થઈ એટલે ભૂલી જાય છે અને મેઘા કહાનને મૂકવા - લેવાની સાથે, સ્કૂલમાં ટીચર તરીકે, ટાબરિયાઓને સાચવવાની જવાબદારીમાં ભૂલી જાય એમાં એનો હું વાંક? લાવ આજે તો હું જ મમ્મીએ કહ્યું એવી સરસ ગર્વી લઈ લઉં, એટલે મમ્મીને કહેવાનો મોકો ન મળે.’ એટલે એવે પણ પોતાની ઓફિસની નજીકના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી એકને બદલે બે ગર્વી, સરસ મજાની ગમી જાય તેવી લઈ લીધી.

અનુભેનની રાજે થી નાની દીકરી બ્રિંદા પોતાની સખી રોહિ હે, જે પેર્સિંગ ગેસ્ટ તરીકે યુનિવર્સિટીની નજીક રહેતી હતી, તેની રૂમ પર બ્રિંદા ગઈ અને રોહિ એવે બ્રિંદા માટે ચા બનાવી. રોહિ હેઠે સરસ મજાની ગાર રેથી ચા ગાળતા જોઈને, બ્રિંદાને તરત ગઈકાલની, ડાઈનિંગ ટેબલ પર કહેલી મમ્મી અનુભેનની વાત યાદ આવી. તે રોહિ હેઠે પૂછ્યું, ‘આવી સરસ ગર્વી કયાંથી લીધી?’

‘અરે અહીં બાજુમાં જ આ ટો ઝોડ સ્ટોર છે. તેમાં બધી જ વસ્તુ મળે છે. ત્યાં આવી જાતની સરસ ગર્વી મળે છે.’

‘ચાલને મારી સાથે. મારે પણ ઘર માટે એક સરસ ગર્વી હેઠળ લેવી છે. બિચારી મારી મમ્મી કાયમ કકળાટ કરે છે. મારા પણ અને મારી મેઘા ભાબી લાવવાનું ભૂલી જાય છે.’ બ્રિંદાએ પણ રોહિ હેઠળ સાથે જઈને સરસ ગર્વી લીધી. પણ રોહિ હેઠળ બ્રિંદાએ લીધી એ સિવાયના રંગની ગર્વી એવી ગમી ગઈ કે એવી બીજા રંગની બીજી ગર્વી હેઠળ લેવાનો બ્રિંદાને આગ્રહ કરીને એકને બદલે બે ગર્વી હેઠળ લેવડાવી.

બ્રિંદાથી નાનો ભાઈ દુષ્પણ્ટ બાજુના ગ્રાઉન્ડમાં મિત્રો સાથે કિકેટ રમતો હતો. ત્યારે એનો ટેનીસ બોલ, જે જૂનો થઈ ગયો હતો તે ફાટી ગયો. એટલે બધા મિત્રો, નજીકની દુકાનેથી આજની રમત માટે કામચલાઉ બોલ લેવા ગયા. બોલની સાથે દુકાનમાં દુષ્પણ્ટે, સાઢી પ્લાસ્ટિકની ગર્વી જોઈ અને એને ગઈકાલની રાતની,

મમ્મી અનુભેનની વાત યાદ આવી ગઈ. પણ પોતાના બિસ્સામાં પૈસા તો હતા નહીં. એટલે બે મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈ, રકમ ભેગી કરી એક સાઢી, સર્તી ગર્વી ખરીદી. જેથી મમ્મીને કહી કાય કે, ‘જો, હું તારું પણ ધ્યાન રાખું દુંગું.’

સાંજે દાન કરવા જતાં અનુભેનને વિચાર આવ્યો કે કામવાળાનું કાંઈ કહેવાય નહીં. ગમે ત્યારે વાસ પછાડે કે તોડકોડ કરે એમ ગર્વી પણ ઘસવામાં કા હેઠળ નાખે તો પાછી વારંવાર ક્યાં મંગાવવી. એટલે એમ પણ સારી જોઈને બે ગર્વી લઈ લીધી.

એ દિવસે મોરી સાંજે ધીરજલાલના નાના ભાઈ દીપક અને તેની પત્ની ઉષા, મોરા ભાઈ ભાબીને મળવા નજીકના હેરમાંથી કોઈ કામે આવ્યા હતા. એટલે ઘરે મળવા આવ્યા. અનુભેને બંનેને જમીને રાતની મોરી બસમાં જવાનો આગ્રહ કર્યો એટલે જમવા રોકાયા હતા.

રાત્રે બધા જમવા ભેગા થયા ત્યારે ધીરજલાલને યાદ આવ્યું. એટલે ઉભા થઈને પોતે રૂમમાં મૂકી રાખેલી બે ગર્વી હોયો લઈ આવીને પત્ની અનુભેનને કહ્યું, ‘લે જો, આજે તો ભૂલ્યા વિના, એકને બદલે બે ગર્વી હેઠળ આવ્યો હું. જેથી તું કહે નહીં કે કોઈ વાત ગંભીરતાથી લેતા નથી.’

‘હાય હાય, હું પણ બે ગર્વી હેઠળ લાવી દુંગું. મને એમ કે તમે પાછા ભૂલી જ હોયો.’ એમ કહી અનુભેને પોતે લાવેલી બે ગર્વી રજૂ કરી.

‘હું પણ મમ્મી માટે, મારા મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈ, બોલ લેવા ગયો હતો ત્યાંથી એક ગર્વી હેઠળ લાવેલી દુષ્પણ્ટે પણ બેટ સાથે મૂકેલી ગર્વી હેઠળ રજૂ કરી.

‘અરે તમારી બધાની ગર્વી હેઠળ મંદિરાં લીધેલી ગર્વી કેવી સરસ છે, જુઓ!’ એમ કહીને બ્રિંદા પણ સરસ મજાની બે ગર્વી હેઠળ અંદરથી લાવી બધાને બતાવી.

મેઘા, દીકરા કહાનને તેના બેડરૂમમાં હોમવર્ક કરાવતી હતી ને ગર્વી હેઠળ કરાને સાંભળી, એવે પણ પોતે લાવેલી ત્રીજી સરસ ગર્વી હોયો બધાને બતાવવા દોડી આવી.

ત્યાં તો રાજે ઓફિસેથી આવ્યો અને સ્કુટરની તેકીમાંથી સરસ મજાની બે ગર્વી હેઠળ મમ્મીને આપતા બોલ્યો, ‘લે મમ્મી! પણ કે મેઘા ભલે ભૂલી જાય, પણ હું યાદ કરીને, તારા માટે, જો, એકને બદલે બે ગર્વી હેઠળ આવ્યો દુંગું’ કહીને કાકા-કાકી દીપક અને ઉષાના પગે પડ્યો.

ડાઈનિંગ ટેબલ ઉપર, સૌથે પોતે લાવેલી ગર્વી હોયો મૂકી

ત્યારે બધા સભ્યોની થઈને ૧૨ ગર ઐઓ ભેગી થઈ ગઈ.

અનુભહેનને તો હસ્તવું કે રડવું, કાર્ટ સૂજતું નહોતું. એ તો આટલી બધી, જાતજાતની રંગબેરંગી ગર ઐઓ જોઈને અવાકુ થઈ ગયા હતા. ૫ મશકરા દીયર દીપક અને તેની એના જેવી જ નટખટ પત્ની ઉધાએ વાત ઉપાડી લીધી.

‘હવે આજીવન તો આપે ઘર માટે ગર ૈની જરૂર નહીં પડે. ૫ આટલી બધી ગર ઐઓ પડી પડી તેનો રંગ ખોઈ બેસે કે એની જાળી ખરાબ થઈ જાય એને બદલે આપે ગર ૈનો વેપાર કરીએ તો કેમ? ઉધા તારું કહેવું છે?’

‘હા, હવે અનુભહેન ગર ૈવાળા...’ ઉધાએ પૂરું કર્યું. ‘બંગલા નં.-૬, સર્વોદય સોસાયટી, નવજીવન સ્કુલ પાસે..... .... જાતજાતની દરેક કામ માટેની ગર ઐઓ, વ્યાજબી ભાવે મળે’ એવી જહેરાત આપીએ તો કેમ રહેં, મોટાભાઈ?’

‘તો પછી મારે બીજે ક્યાંકથી જથ્થાબંધ ગર ઐઓનો ઓર્ડર આપી સ્ટોક મંગાવવો પડે. કાર કે જેવી જહેરાત કરો એટલે આટલી ગર ઐઓ તો આપ ઐ સોસાયટીવાળા જ એક-બે કરીને લઈ જો. પછી બાજુની કોલોની કે નજીકના મલ્ટીસ્ટોરી બિલ્ડિંગવાળા, મારા બગીચાના મિત્રો, અનુના મંદિરના દ ‘નાર્થી મંડળના સભ્યો, બ્રિંદાની કોલેજના મિત્રો, રાજે ની ઓફિસના ઓળખીતાઓ, દુષ્ણંતના સ્કૂલના અને બીજા કિકેટના મિત્રો, મેધાની અને કહાનની ‘કિંડર ગાર્ડન’ના સાથીઓ વગેરે વગેરે ક્યાં જો અને એ સૌને બતાવવા માટે ૫ જહેરાત આપ્યા પછી ગર ઐઓ નહીં બચે. તારું કહેવું છે અનુ? બોલ ગર ઐઓનો બિજનેસ કરવો છે? હું પૈસા રોકવા અને ફંડ ભેગું કરી આપવા તૈયાર છું!’

‘તમે બધા જો આ રીતે, ગર ઐઓ વેચી દેવાની ખાત્રી આપતા હો તો મારે કહેયે? બેઠા કરતા બજાર ભલી! કરો કંકુના આજથી જ! દીપકભાઈ અને ઉધા આપ ૧ સ્ટોકિસ્ટ થઈ કમિ ન ઉપર ગર ઐઓ એમના

હેરમાં વેચી દે અને તમે સૌ મને અહીં આપ ૧ હેરમાં વેચાવી દેશો.’

સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા.

૫ વાત અહીં પૂરી થતી નથી.

૬ ૮ .....  
હસવામાંથી ઊભી થયેલી પરિસ્થિતિનો અનુભહેને પડકાર જીલી લઈ, ખાખરાવાળા, ચેવડાવાળા,

પા પૈપરીવાળાની જેમ એક દિવસ ‘અનુભહેન ગર ૈવાળા’ની જહેરાત થઈ અને આજે નાની કૂપળમાંથી ઘટાટોપ વડલો બનેલી પેઢી “અનુભહેન ગર ૈવાળા” દરેક જાતની નાની મોટી ચાથી માંડી કેમિકલ કે કોઈપ વસ્તુ ગાળવા માટે પ્લાસ્ટિકથી માંડી કોઈપ ધાતુ કે વસ્તુની ગર ૧ બનાવતી અને માર્કેટિંગ કરતી પેઢી જગજાહેર થઈ છે.

આપને ૫ કોઈપ જાતની ગર ૈની જરૂરિયાત ઊભી થાય તો મને કહેજો. મારી પાસે એમનું સરનામું અને વેબસાઈટ બધું જ છે કાર કે હું ‘અનુભહેન ગર ૈવાળા’ના કમિ ન એજન્ટની સેવા આપી રહ્યો છું.

### નાળિયેરી

(અનુસંધાન : પાના નં.-૨૪ ઉપરથી ચાલુ)

કોપરાની છી માંથી દૂધ બને, દાઢી તૈયાર થાય, કોકોનટ મિલ્કના ૫ ફાયદા છે - હાડકાં મજબૂત કરે, ખરતા વાળની સમસ્યા દૂર કરે, લોહીમાં કરાનું પ્રમા જાળવે, ધૂમ્રપાનથી થતી ખાંસીમાં રાહત આપે વિ. નાળિયેરની છી માંથી તૈયાર થતા દૂધમાંથી ધ । ઉદ્યોગો બાથસોપ, લો ન, મ્યુ, રબત વિ. તૈયાર કરે છે. નાળિયેરના બધા જ ભાગોમાંથી સેંકડો ઉપયોગી ખાદ્યચીજો, પી । અને વાપરવાલાયક ચીજવસ્તુઓ બની કે છે. થોડાક ઉદાહર કે જોઈએ :

- ★ પુસ્તક તેમજ આલ્બમના કવર.
- ★ ફર્નિચર, થડ અને ડાળખીઓના મકાન.
- ★ નાના પૂલ બનાવવા માટે લાકડાનો ઉપયોગ.
- ★ પ્રા ઐઓ માટેના ખોરાક.
- ★ હુસ્તકલા દ્વારા બનાવતી અને અન્ય કલાત્મક વસ્તુઓ.
- ★ દવાઓ, રબતો, દારુ વિ.
- ★ સુંપડા પરના છત ઉપર ડાળખીઓ પાંડડાથી થતી છત.
- ★ ડાઈ, માઉથવો , પેપર પલ્ય, જાહું, પગ લૂંછિ યા, સાદડી, સીંદરી, બાસ્કેટ, હેટ્સ, રમકડાં અને અન્ય અનેક વસ્તુઓ.

આ માટે ધ । ઉદ્યોગો સંકળાયેલા છે.

કોઈપ પરીરિક આપત્તિમાં દવા તરીકેનો ઉપયોગ કરતા પહેલા ડાયેટીટ યન, વૈદ્ય કે ડોક્ટરનું માર્ગદર્શિકા મેળવવું.

## શાંદોની કમ્પ્યુટરી - (૮)

• તુલસીદાસ કંસારા •

- હાઈવેર :** બિલાડીના કાનને જાપાનમાં નેકોમિમિ કહેવાય છે. આપણું મગજ સતત કાર્યરત રહેતું હોય છે અને ખાસ પ્રકારના વિદ્યુત તરંગો (લાગ ઐઓ) છોડતું રહેતું હોય છે. જેને કેચ કરીને આ કાન મારફતે તેને પ્રદાન કરતું ડિવાઈસ ન્યુરોસ્કાયે તૈયાર કર્યું છે. ન્યુરોસ્કાય ૨૦૦૪માં કેલિફોર્નિયામાં સ્થપાયેલ એક કંપની છે. જે મગજને કોમ્પ્યુટર સાથે જોડીને, તેનું ઇન્ટરફેસ કરીને, બ્રેઇન - કોમ્પ્યુટર ઇન્ટરફેસ (બી.સી.આઈ.) ટેકનોલોજી વડે રમકડાં અને રમત-ગમત, " ૧૮ ક, હેલ્પ ઇન્ટાઇને લગતી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવે છે. આ નેકોમિમિ હેડસેટમાં એક સેન્સર લગાવવામાં આવ્યું છે, જે મગજની પ્રતિક્રિયા નોંધે છે. રંગો નામના બેઝાબાજે તેને મોબાઇલ સાથે કનેક્ટ કરી એક એવી એપ્લિકેશન (સોફ્ટવેર) તૈયાર કરી કે જે પહેલીને તમે તમારા કામમાં મ ગુલ હો ત્યારે ઇનકમ્બિંગ કોલને બ્લોક કરે. આ નેકોમિમિ મગજના વર્તન પ્રમાણે પ્રતિક્રિયા આપે છે. જેમકે, તમે કોઈ વસ્તુ તરફ ધ્યાન કેન્દ્રિત કરો તો કાન ઊચા થઈ જાય. જ્યારે તમે રિલેક્સ ફીલ કરતા હો ત્યારે આ ઈઅર નીચા ઝુકેલા રહેશો. અને તમે જ્યારે કોઈ કામમાં મુંજાયેલ હો ત્યારે આ કાન અપ-ડાઉન થયા કરો!! આ નેકોમિમિ બ્રેઇનવેવ કેટ હેડસેટને ન્યુરો કોમ્પ્યુનિકે ન મીન તરીકે ૫ ઓળખવામાં આવે છે.

- સોફ્ટવેર :** કોમ્પ્યુનિકે નમાં સાઈલન્ટ મેસેજ્સનું મહત્વ ખૂબ જ કોઈને ૫ ડિસ્ટર્બ કર્યા વગર સંદેશ પછીંચી જાય. હવે જો તેમાં પિક્ચર પ સાથે હોય તો સ્વાભાવિક રીતે જ તે સંદેશ તરફ વધારે ધ્યાન ખેચાય. વ્હોટ્સસ-એપ, બે અંગ્રેજ બ્દો, વ્હોટ (મતલબ નું?) સાથે એપ્લિકેશન નના દુંકા



સ્વરૂપ 'એપ'ને જોડીને સ્માર્ટફોનના જમાનામાં આ પ્રોપરાઈટરી પ્રોડક્ટને એક સર્વિસ તરીકે બજારમાં મૂકૃતાની સાથે જ તે હોટેકની જેમ પોષ્યુલર બની ગઈ. ૨૦૦૮માં બ્રિયાન એક્ટન અને જાન કોઉમ નામના અમેરિકન, જે બંને પહેલાં યાહુના એમ્પ્લોઈ હતા તેમે માઉન્ટેન બ્યુ કેલિફોર્નિયામાં આ વ્હોટાએપ ઇન્કોર્પોરેન ન નામની કંપની ચાલુ કરેલ. આ સર્વિસ મારફતે વપરા કર્તાઓ ફોટોઓ, વિડીયો, ઓડિયો તેમજ પોતાનું લોકે ન દ વિત્ત મેસેજ મોકલાવી કે છે. અત્યારે આ સર્વિસનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ૬૦ કરોડ કરતાં ૫ વધી ગયેલ છે. અને હવે આ કંપનીને ફેસબુક ટેકઓવર કરી રહેલ છે.

- ઇન્ટરનેટ :** એક એવી સામાન્ય ગેરસમજ પ્રવર્તે છે કે વાઈ-ફાઈ એટલે વાયરલેસ ફાઈડાલીટી. મતલબ વાયરના જોડા વગરની વફાદારી, ઇમાનદારી, સત્યનિષ્ઠા, પ્રામાણી કરતા. પરંતુ આ બધાને આવા કોઈપણ લાગ ઐઓ સાથે સંકળાયેલ બદ્દોથી મતલબ નથી!

વાઈ-ફાઈ એકમાત્ર ડ્રેમાર્ક છે જેનો મતલબ થાય છે ચોક્કસ ટેકનીકલ બાબતો.

વાઈ-ફાઈને વધ્યે લીટી કે વગર માફ વાઈફાઈ તરીકે પ અંગ્રેજમાં લખવામાં આવે છે, જે વાયરલેસ લોકલ એરીયા નેટવર્ક (WLAN) ટેકનોલોજી કહેવાય છે. આ ટેકનોલોજીમાં માહિતીની આપણે કરવા માટે ઇલેક્ટ્રોનિક ડિવાઈસ દ્વારા તેને ઇન્ટરનેટ અને રેટિયોના મોજાઓ સાથે ચોક્કસ ટેકનીકથી સાંકળવામાં આવે છે. પરંતુ અહીં પ્રસ્તુત નામ હાઈ-ફાઈ (જે ઓડિયો ફાઈલ માટે વપરાય છે) બધાના ઉચ્ચારમાં થોડા ફેરફાર સાથે વાઈ-ફાઈ કરીને એક ડ્રેમેન તરીકે રાખવામાં આવેલ છે. આ ડ્રેમાર્ક ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ (IEEE) ના એક સ્ટાન્ડર્ડ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. જે પ્રોડક્ટ ટેકનીકલ રીતે આ વાઈ-ફાઈના ધારાધોર મુજબ સહી ઉત્તરે તેને વાઈ-ફાઈ સર્ટીફાઈડ કહેવાય છે અને તે અહીં આપેલ આઈકન, લોગો કે ડ્રેમાર્ક સાથે તેનો ઉપયોગ કરી કાય છે.

## કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ

**શશીકાંત ઠક્કર - ઉપરમુખ, કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ**

**કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ** - અમદાવાદની સામાન્ય સભા તા. ૨૧-૮-૨૦૧૪ના રોજ અમદાવાદ મુકામે શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - હિંદુબાગ ખાતે મળી હતી. આ બેઠકમાં સંસ્થાના ઓડિટોર હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને કચ્છમાં આર્કિટેક્ચરલ કોલેજ સ્થાપવાના પ્રોજેક્ટ તેમજ નર્મદાના પા એ અંગેની થયેલ કાર્યવાહી અંગેની વિગતોથી સંસ્થોને અવગત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન શ્રી અ કેબાઈ મહેતાએ કોલેજ માટેની જમીન સંપાદન કરવાની કાર્યવાહીની પ્રગતિનો અહેવાલ આપી આ અંગે ત્યારબાદના આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી. નર્મદાના પા એ કચ્છને આપવાના પ્રશ્ને તેમ નર્મદા નિગમના ડાયરેક્ટર શ્રી મૂકે ભાઈ જવેરીના સહયોગથી કચ્છ કેનાલના ચાલતા કામોની મુલાકાત અંગે વિગતપૂર્વી માહિતી આપી હતી. માઈનોર અને પેટા કેનાલોનું આયોજન મુખ્ય કેનાલની સાથોસાથ હાથ પર ન લેવાયાના પરિ એ નર્મદા તેમમાં આવતા પા ઐથી સમગ્ર રાજ્યમાં ખેતીની જમીનને કાયદેસર સિંચાઈનું પા એ મળતું નથી અને તેથી આ પા એ સાબરમતી - સરસ્વતી વગેરે નદીઓમાં વહેવડાવાય છે તે હક્કિકત તરફ ખાસ ચિંતા જતાવી હતી. આના પરિ એ મુખ્ય કેનાલો પરથી ડિઝલ પંપો મૂકીને પા ઐની ચોરી કરવાનું પ્રમા વધતું જાય છે.

બેઠકમાં એક મહત્વનો પ્રશ્ન એ ચર્ચાયો હતો કે કચ્છના કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં લોકોના સતત પ્રયત્નો પછી એ કોઈ ઉકેલ વહીવટી રીતે આવતો નથી. આવા સામાન્ય લોકહિતના પ્રશ્નો જરૂર પડે ત્યાં કાનૂની રીતે ઉકેલવા ગુજરાત હાઈકોર્ટમાં જનહિતની અરજીઓ કરવાનું આ સંસ્થા ગોડવી કે કે કેમ? સંસ્થાના ઉપરમુખ શ્રી કેંત્રાંત ઠક્કરે જ ટયું કે સોથી મોટો પ્રશ્ન જે તમામ સખાવતી ટ્રસ્ટોને કન્દે છે તે ચેરીટી તંત્રની નિષ્ઠિયતા, વિલંબ અને યોગ્ય વહીવટી આંતરમાણખાનો અભાવ છે. અને તેમ છતાં તેના ખર્ચ માટે નક્કી કરાયેલ ફાળો વસુલવામાં આવે છે. જેના કરોડો રૂપિયા સરકારમાં બિન ઉપયોગી પર્યા રહે છે. મહારાષ્ટ્રમાં હાઈકોર્ટના આદેશી આ ફાળો ઉઘરાવવાનું બંધ કરાયું છે. ગુજરાતમાં એ પ્રક્રિયા કરવી જરૂરી છે. આવો જ બીજો પ્રશ્ન કચ્છમાં ઇનામ નાબૂદી ધારાના અમલ પછી ખાનગી માલિકીની અસંખ્ય જમીનો એક જ ઝાટકે કોઈ કાનૂની પ્રક્રિયા વિના

સરકાર ખાતામાં દાખલ કરી દેવાઈ છે જે અંગે સન ૧૯૭૦માં સરકારે સરળ ઉકેલ કર્યા છતાં તેનો અમલ કરાતો નથી, તેનો છે. આવા અન્ય પ્રશ્નો એ છે જે કમાનુસાર સંસ્થાએ ઉપાડવા જોઈએ.

વિસ્તૃત ચર્ચાના અંતે પ્રથમ તબક્કે સંસ્થા દ્વારા વહીવટી રીતે રજૂઆતો કરવાની સાથે કાનૂની રાહે જનહિત અરજીઓ કરવા સૈદ્ધાંતિક બહાલી આપવામાં આવી હતી અને એક વર્ષ માટે ના અંકીય ફાળવ એ સાથે ત્રણાર સભ્યોની સમિતિને આ અંગે સત્તા આપવામાં આવી હતી.

‘કચ્છના સંણગ ઇતિહાસ’ની બીજી આવૃત્તિ બહાર પાડવા અને તેનો અંગ્રેજી અનુવાદ કરાવી બહાર પાડવાના સંસ્થાના અતિ મહત્વના પ્રોજેક્ટમાં થયેલ પ્રગતિની વિગતવાર સમી એ કરવામાં આવી હતી અને સાથોસાથ કચ્છમાં વિવિધ તોતે નોંધપાત્ર યોગદાન આપનારા મહાનુભાવોની પરિચય પુસ્તિકાઓ છપાવવા બાબતની એ વિસ્તૃત ચર્ચા વિચાર એ કરવામાં આવી હતી.

નર્મદાનું પા એ કચ્છમાં વહેલામાં વહેલી તકે પહોંચે તે માટે નર્મદાની કચ્છ કેનાલના કામમાં ઝડપ લાવવા અને વધારાના પા જેના આયોજનો તાત્કાલિક હાથ પર લેવાય તે માટે સંસ્થાની સ્થાપનાથી અત્યાર લગી જે જાગૃતિ બતાવી વિવિધ સરકારી તંત્રો સાથે સહયોગ અને સંકલન કરી આ કામોમાં થતો વિલંબ નિવારના સંસ્થાના ચેરમેનશ્રી અ કે મહેતા અને સંસ્થાના અમદાવાદ સ્થિત પદાધિકારીઓએ જે પ્રયત્નો કર્યા છે તે માટે તેમને ધન્યવાદ પાડવવામાં આવ્યા હતા.

હિંદુમાં શ્રી કચ્છી વિશ્રામ ગૃહમાં સ્થાપવામાં આવેલ ડાયાલિસિસ સેન્ટરની, સભ્યોએ મુલાકાત લીધી હતી અને આ કેન માં દરરોજ લગભગ ૧૫થી ૨૦ ડાયાલિસિસ રાહત દરે કરી આપવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે સંસ્થાની ય કલગી ગ એ કાય તેમ છે. આ જ ભવનમાં કચ્છની કણા સંસ્કૃતિને ઉજાગર કરતું ખુલ્લિયમ રચવામાં આવેલ છે તેનો લાભ એ બહોળા પ્રમા માં પ્રવાસીઓ લઈ રહ્યા છે. અમદાવાદમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમની સાથેના બરદાસીઓ માટે મફત ભોજન વ્યવસ્થા માટે જલારામ અને કેન એ જ ભવનમાં રૂકરવામાં આવેલ છે. કચ્છથી અમદાવાદ આવતા લોકોએ આ સુવિધાઓનો લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ■

## શ્રી કચ્છી સમાજ - અમદાવાદનો એનિક અહેવાલ

ઓક્ટોબર / નવેમ્બર - ૨૦૧૪

### ● સોમવાર, તા. ૬-૧૦-૨૦૧૪

- ★ શ્રી અ ઒ક મહેતા, શ્રી ભરત ઓઝા, શ્રી મનુભાઈ કોટડિયા સમાજની ઓફિસ પર મળેલ હતા. પાસ વિતર અંગેની તથા કચ્છી કંપા વિભાગની બોટમ પછી જાહેરાત અંગેની કાર્યવાહી કરવામાં આવી.
- ★ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરે ચં મહેતા આજરોજ પ્રથમ વખત શ્રી કચ્છી સમાજની ઓફિસ પર પદ્ધાર્ય હતા. તેઓ સાથે અનેકવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવેલ હતી. તા. ૧૮-૧૦-૧૪ના કાર્યક્રમ 'હિન્દોટીઝમ'ના નોના ૪ પાસનું પેમેન્ટ તેઓ દ્વારા કરવામાં આવેલ હતું.

### ● મંગળવાર, તા. ૭-૧૦-૨૦૧૪

- ★ કચ્છશ્રુતિના કચ્છી કંપા વિભાગની બોટમ પછી જાહેરાત મેળવવા શ્રી મનુભાઈ કોટડિયાની કાર્યવાહી ચાલુ રહેવા પામેલ હતી.

### ● ગુરુવાર, તા. ૮-૧૦-૨૦૧૪

- ★ શ્રી ભરતભાઈ ઓઝા તથા શ્રી કનુભાઈ ઓક્ટોબર-૨૦૧૪નો કચ્છશ્રુતિનો દીપોત્સવી અંક એટલે કે "કચ્છી કંપા વિભાગ"નું ફાઈનલ ડી.ટી.પી. વર્ક તૈયાર કરવાના હોવાથી તેઓ આખો દિવસ બિઝી રહેલ હતા. પોસ્ટ ખાતા પાસે તા. ૧૫-૧૦ના બદલે તા. ૧૮-૧૦ની એ ટેન્ડેડ તારીખ પોસ્ટિંગ માટે માંગવામાં આવેલ. પરંતુ ચાલુ વર્ષ દરમ્યાન આ અગાઉ ત્ર વખત એ ટેન ન મંગાઈ ગયેલ હોવાથી ચાલુ માસનો અંક તા. ૧૫-૧૦ના ૪ પોસ્ટ કરવો કમ્પલસરી બની જતાં, વિભાગના બાકીના કામ માટે ઝડપ વધારવામાં આવેલ હતી.

### ● શનિવાર, તા. ૧૧-૧૦-૨૦૧૪

- ★ શ્રી અ ઒ક મહેતા, શ્રી ભરત ઓઝા, શ્રી મનુભાઈ કોટડિયા, શ્રી જગદી ભાઈ ઠક્કર તથા શ્રી ધનશ્યામભાઈ ઠક્કર સમાજની ઓફિસ પર એકત્રિત

થયેલ હતા. આગામી તા. ૧૮-૧૦-૧૪ના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવેલ હતી. વિવિધ ઘટક સમાજના નામ - સરનામાની ડિરેક્ટરી એકત્રિત કરી, દરેક સભ્યને ૧૮-૧૦ના કાર્યક્રમની યાદી અપાવવાનું રૂ કર્યું.

### ● બુધવાર, તા. ૧૫-૧૦-૨૦૧૪

- ★ એક તરફ જે જે વિવિધ અગ્ર શ્રીઓને પાસ વિતર ના કાર્યમાં સહકાર આપવા જ વેલ, તેઓને વિતર કરવા આપેલ તા. ૧૮-૧૦ના કાર્યક્રમના પાસો પરત આવવા લાગ્યા. જ્યારે અન્ય તરફ વન-ટુ-વન કોટેક્ટ કરી ક્ય વધુ પાસો વિતર કરવાની વ્યવસ્થા સચોટ પુરવાર થતી લાગી. દરરોજ ૫૦ જેટલા પાસોનું વિતર ક્ય બનતું ગયું.

### ● શુક્રવાર, તા. ૧૭-૧૦-૨૦૧૪

- ★ શ્રી અ ઒ક મહેતા, શ્રી ભરત ઓઝા, શ્રી મનુભાઈ કોટડિયા, શ્રી અતુલ સોની વગેરે સમાજની ઓફિસ પર નિયમિતપ મળતા રહ્યા. ૧૮-૧૦ના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો.

### ● શનિવાર, તા. ૧૮-૧૦-૨૦૧૪

- ★ શ્રી ભરત ઓઝા, શ્રી મનુભાઈ કોટડિયા, શ્રી અતુલ સોની, શ્રી દીપક ચૌહા, શ્રી મૂકે રાઠોડ, શ્રી સંજ્ય ચૌહા, શ્રી પારસ વીરા વગેરે સમાજની ઓફિસ પર એકત્રિત થયેલ હતા. આવતીકાલના કાર્યક્રમની પોતાના ભાગે આવતી જવાબદારી, સહૃદે સમજીને સ્વિકારી લીધેલ હતી.

- ★ વિતર થયા વગરના કેટલાક પાસોનો વપરા ક્રોમ્બિલમેન્ટરી પાસ તરીકે કરવામાં આવ્યો.

### ● રવિવાર, તા. ૧૯-૧૦-૨૦૧૪

- ★ આજે સાંજના ઉ થી દરમ્યાન ટાઉન હોલ ખાતે કચ્છશ્રુતિના કચ્છી કંપા વિભાગનું વિમોચન અને શ્રી

કચ્છી સમાજના ફંડ રેઈલિંગ કાર્યક્રમ અંતર્ગત ડૉ. પ્ર અંત ભીમા જોનો હિન્દોટીઝમનો એ યોજવામાં આવેલ હતો. ટાઉન હોલ લગભગ ભરચક રહેવા પામેલ. બેડબ્રિફાથી અનેક કચ્છી કડવા પટેલ અને એ પધારેલ હતા કે જેમના હસ્તે “કચ્છી કંપા વિખાંક” નું વિમોચન કરાવવામાં આવેલ હતું. ત્યારબાદ ડૉ. પ્ર અંત ભીમા જોનો હિન્દોટીઝ એ યોજવામાં આવેલ કે જે એકધારો ત્ર કલાક ચાલેલ હતો. ઉપસ્થિત પ્રેક્ટિશન ને ત્ર કલાક સુધી એકધારી રીતે જકડી રાખનાર આ એ અનહદ રીતે સાર્થક પુરવાર થયો. આ પ્રકારનો કાર્યક્રમ આપવા બદલ કચ્છી સમાજના અન્ન શ્રીઓને ઉપસ્થિત દરેકે ધન્યવાદ આપ્યા. આ પ્રસંગે બેડબ્રિફાથી તથા

મોડાસાથી પધારેલ કચ્છી કડવા પાટીદાર અન્ન શ્રીઓને દામુભાઈ હોસ્ટેલ ખાતે જમાડી વિદાય આપવામાં આવેલ હતી.

#### ● બુધવાર, તા. ૨૨-૧૦-૨૦૧૪

★ શ્રી ભરતભાઈ ઓઝા દિવાળીની રજામાં બહારગામ ફરવા જતા હોઈ આગામી કચ્છશ્રુતિના અંકની વિગતો શ્રી મનુભાઈ કોટડિયાએ તેમની પાસેથી સમજી લીધેલ હતી.

#### ● મંગળવાર, તા. ૨૮-૧૦-૨૦૧૪

★ આજે લાભપાંચમ. શ્રી મનુભાઈ કોટડિયાએ શ્રી કચ્છી સમાજની ઓફિસમાં નવા વર્ષ મહુરત કરી, દરરોજ ઉપસ્થિત રહેવાનું રૂ કર્યું.

## અમેરિકાના રાજ્યમાં કચ્છી વિધાનસભ્ય



મૂળ ભુજ, કચ્છના વતની એવા રૂ વર્ષથી યુવાન નીરજ જ્યમીનભાઈ અંતાએઠી અમેરિકામાં ઓહિયો રાજ્યના ૪૨મા હાઉસ ડિસ્ટ્રીક્ટમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. એટલું જ નહીં, તેઓ આ સિદ્ધિ સાથે ઓહિયો રાજ્ય વિધાનસભામાં ચૂંટાનાર સૌથી યુવાન સત્ય બન્યા છે. અમેરિકી રાજ્ય વિધાનસભાની મધ્યસત્ર ચૂંટ નેના તાજેતરમાં જાહેર થયેલા પરિ મોમાં અનેક ભારતીય અમેરિકનોએ જીત મેળવી દે ને ગૌરવ અપાવ્યું હતું. તેમાં રીપલિકન ૫૧ તરફથી લડતા નીરજે ટેમોકેટીક ૫ જીના પેટ્રિક મોરીસને પછડાટ આપી હતી. ૧૯૭૮માં અમેરિકા જઈને ઉપ વર્ષ સુધી હેવલેટ પેકાઈમાં નોકરી કરનારા પિતા સ્વ. જ્યમીનભાઈના પુત્ર નીરજ ઓહિયોમાં જ જન્મ પામીને ઉછ્યર્યા છે. ઓહિયો રાજ્ય યુનિવર્સિટીમાથી રાજકીય વિજ્ઞાન સાથે સ્નાતક થયા બાદ તે હાલમાં યુનિવર્સિટી ઓફ ટેપ્ટોનમાં કાયદાનો અભ્યાસ કરે છે. આ જીત સાથે નીરજે છેલ્લા ઉત્ત વર્ષમાં આ વિધાનસભામાં જીતનાર ભારતીયનું બહુમાન હંસલ કર્યું છે. નાનપ થી જ રાજકાર માં રસ ધરાવતા શ્રી અંતા એ તેમના ચૂંટ ૧ મ્યાર્ચ મેન્ટરમાં અર્થતંત્ર અને ૮૧ ના મુદ્દે ભાર મૂક્યો હતો. જીત બાદ એક મુલાકાતમાં નીરજે જ એવું હતું કે, ‘હું મારા વિધાનસભા તોત્ર માટે સખત પરિશ્રમ કરી. મારા સમુદાય માટે લડી. રીપલિકના સિદ્ધાંતો ભારતીય સમુદાય જેવા જ હોવાથી હું રીપલિકન જ છું. જીત બાદ તે ટ્રીવિટ કરી હતી કે, આ પ્રતિનિધિત્વ મેળવવાથી હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. માતા કોડીલાબેને કહ્યું હતું કે તે નાનપ થી જાહેર સેવા પ્રવૃત્તિઓમાં રસ ધરાવતો હતો. બાદમાં તેની રાજકાર માટેની જંખના વધતી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઓહિયો રાજ્ય વિધાનસભામાં ચૂંટાયેલા નીરજ જ્યમીનભાઈ અંતા એ મૂળ ભુજના વતની છે. તેમના દાદા લ મીલાલ મગનલાલ અંતા એ કચ્છ રાજ્યના બાંધકામ વિભાગમાં હતા. કચ્છ રાજ્યના સિંચાઈ વિભાગના વડા સુપ્રિન્ટેન્ડન્ટ એજિનિયર હરિપ્રસાદ મગનલાલ અંતા એ તેમના પરિવારના હતા. ભુજના પૂર્વ નગરપણી અરુ ભાઈ વચ્છરાજાનીના નીરજ ભાઈ થાય. તેમના નાના ચંપકલાલ વચ્છરાજાની ૧૯૬૬માં ભુજની સેન્ટ્રલ બેંકના મેનેજર તરીકે હતા. નીરજના પિતા જ્યમીનભાઈ ભુજના મહિલા ધારા એવી સ્વ. મુદ્દુલાબેન ક્રિએટિવ બુચના કાકાઈ ભાઈ થાય. ■

ઓહિયો રાજ્ય યુનિવર્સિટીમાથી રાજકીય વિજ્ઞાન સાથે સ્નાતક થયા બાદ તે હાલમાં યુનિવર્સિટી ઓફ ટેપ્ટોનમાં કાયદાનો અભ્યાસ કરે છે. આ જીત સાથે નીરજે છેલ્લા ઉત્ત વર્ષમાં આ વિધાનસભામાં જીતનાર ભારતીયનું બહુમાન હંસલ કર્યું છે. નાનપ થી જ રાજકાર માં રસ ધરાવતા શ્રી અંતા એ તેમના ચૂંટ ૧ મ્યાર્ચ મેન્ટરમાં અર્થતંત્ર અને ૮૧ ના મુદ્દે ભાર મૂક્યો હતો. જીત બાદ એક મુલાકાતમાં નીરજે જ એવું હતું કે, ‘હું મારા વિધાનસભા તોત્ર માટે સખત પરિશ્રમ કરી. મારા સમુદાય માટે લડી. રીપલિકના સિદ્ધાંતો ભારતીય સમુદાય જેવા જ હોવાથી હું રીપલિકન જ છું. જીત બાદ તે ટ્રીવિટ કરી હતી કે, આ પ્રતિનિધિત્વ મેળવવાથી હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. માતા કોડીલાબેને કહ્યું હતું કે તે નાનપ થી જાહેર સેવા પ્રવૃત્તિઓમાં રસ ધરાવતો હતો. બાદમાં તેની રાજકાર માટેની જંખના વધતી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઓહિયો રાજ્ય વિધાનસભામાં ચૂંટાયેલા નીરજ જ્યમીનભાઈ અંતા એ મૂળ ભુજના વતની છે. તેમના દાદા લ મીલાલ મગનલાલ અંતા એ કચ્છ રાજ્યના બાંધકામ વિભાગમાં હતા. કચ્છ રાજ્યના સિંચાઈ વિભાગના વડા સુપ્રિન્ટેન્ડન્ટ એજિનિયર હરિપ્રસાદ મગનલાલ અંતા એ તેમના પરિવારના હતા. ભુજના પૂર્વ નગરપણી અરુ ભાઈ વચ્છરાજાનીના નીરજ ભાઈ થાય. તેમના નાના ચંપકલાલ વચ્છરાજાની ૧૯૬૬માં ભુજની સેન્ટ્રલ બેંકના મેનેજર તરીકે હતા. નીરજના પિતા જ્યમીનભાઈ ભુજના મહિલા ધારા એવી સ્વ. મુદ્દુલાબેન ક્રિએટિવ બુચના કાકાઈ ભાઈ થાય. ■

## ગાંધીનગર ગાયા

• શ્રીમતી વર્ષા જે. મહેતા •

### દિવાળીના તહેવારોની પારંપારિક ઉજવણી

પાટનગર ગાંધીનગરમાં દિવાળીના તહેવારોની ઉમંગભેર ઉજવ ૧ કરવામાં આવી હતી. દિવાળીના પવિત્ર દિવસોની ઉજવ ૧ ગાંધીનગરના રહેવાસીઓએ પારંપારિક રીતે કરી હતી. દિવાળીની રાતે ગાંધીનગરવાસીઓએ ફટાકડા ફોડી આત બાજુથી ગાંધીનગરને ચમકાવી દીધું હતું. સૌએ એકબીજાને ઉત્તાસપૂર્વક સાલ મુખારક પાઠવી ઉભકામનાઓ વ્યક્ત કરી હતી. વિવિધ મંદિરોમાં અન્ધકુટના દનાર્થી નગરજનો ઉમટી પડ્યા હતા.

### અક્ષરધામમાં અનોખી દીપમાળા

ગાંધીનગરમાં આવેલ અ રધામમાં દર વર્ષ દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ સુધી ભવ્ય દીપમાળા દ્વારા સજાવટ કરી ઉજવ ૧ કરવામાં આવે છે. આ વર્ષ ૫ ૧૦ હજાર દીવડાની દીપમાળા કરવામાં આવી હતી. આ દીપમાળાના દનનો લાભ લેવા ગાંધીનગરમાં અનેક લોકો ઉમટ્યા હતા. દીપમાળાથી ઝગમગતું અ રધામ જોવું, એ એક અનેરો લહાવો છે.

### પુસ્તક પરબ

ગાંધીનગરની સંસ્થા આત્મન્ ફાઉન્ડે ન અને ગુજરાતી માતૃભાષા અભિયાનના ઉપકરે તા. ૨ નવેમ્બરના રોજ ઘ-૪ સર્કલ પાસે પુસ્તક - પરબ યોજાઈ હતી. જેમાં પુસ્તકદાન સ્વીકારવા ઉપરાંત મુલાકાતીઓને બે પુસ્તકો વિનામૂલ્યે ભેટ આપવામાં આવ્યા હતા.

### સૌરાષ્ટ્ર - કચ્છ સેવા સમાજ

સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજ - ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં ટાઉનલોલ ખાતે તા. ૨ નવે.જા રોજ શ્રી રાજેષ વૈષ વ (સૂરીલી સાંજ) ભાવનગર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “રાગ માલકોંસની મસ્તી અને ભૈરવીની મોજ” ‘આધા હૈ ચં મા રાત આધી’ ર્ખ હેઠળ રાગ ભૈરવી આધારિત હિંદી

ફિલ્મોના યાદગાર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર - કચ્છ સેવા સમાજના સભ્યોએ મોટી સંઘામાં હાજર રહી કાર્યક્રમને દીપાલ્યો હતો. શ્રી રાજે વૈષ વ અને તેમના ચુપે ખૂબ જ સરસ રજૂઆત કરી. સંચાલન ઘ્યાતિ મહેતાએ કર્યું હતું.

### અભિનંદન

લંડન ખાતે યોજાનાર વિશ્વબ્રાહ્મ કોન્ફરન્સમાં ગાંધીનગરના પ્રયાત એડવોકેટ અને આંતરરાષ્ટ્રીય બ્રાહ્મ પાલમિન્ટના રાષ્ટ્રીય મંત્રી શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી ભાગ લેવા ગયા છે. લંડનમાં તેઓ આ કોન્ફરન્સમાં હાજરી આપે તે બદલ અભિનંદન.

### સાલ મુખારક - શુભેચ્છા

ગાંધીનગર કચ્છ મિત્ર મંડળ, અમદાવાદ તેમજ ગાંધીનગર સ્થિત સર્વે કચ્છીઓને નવા વર્ષના સાલ મુખારક અને શુભેચ્છા પાઠવે છે.

### અભિનંદન

ગાંધીનગરની જ પ્રીતી સંસ્થા કલ્યાણ ફોરમ દ્વારા દર વર્ષ રાસ - ગરબાનું ભવ્ય આયોજન થાય છે. તેમાં મેગા ફાઈનલના વિજેતામાં બેસ્ટ પેરના વિજેતા કચ્છના હર્ષ ગોગારી એન્ડ નીરવ ગઢવી (વિનર)ને કચ્છ મિત્ર મંડળ - ગાંધીનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

### શ્રદ્ધાંજલિ

કચ્છ મિત્ર મંડળના સક્રિય કાર્યકર શ્રી યજે ભાઈ ગોર અને જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજના એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર શ્રી અશ્વિનભાઈ ગોરના પિતાશ્રી ભવાની કર પ્રા. ગોરનું દુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓશ્રી બાવાભાઈના હુલામ ૧ નામથી પ્રયાત હતા. તેઓશ્રી ના વિભાગના નિવૃત્ત સેક ન અધિકારી હતા. ગાંધીનગર કચ્છ મિત્ર મંડળ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે. ■

## મહિલા વિશ્વ

● રેખાબેન શુક્રલ - અમદાવાદ ●

### ભોજન - થાળી વિશેષ જાણકારી

#### દાળ

- ★ દાળને ઉકાળતા હો ત્યારે તેમાં હિંગ નાખવાથી દાળ સ્વાદિ બને.
- ★ કોઈપ દાળ ચડતી ન હોય તો તેમાં બે આખી કાચી સોપારીના ટુકડા નાખી દેવાથી દાળ ચડી જે.
- ★ દાળ વધારતી વખતે વધારમાં લાલ મરચાની ભૂડી નાખવાથી દાળનો રંગ સરસ થઈ અને દાળ સ્વાદિ પણ બને.
- ★ દાળ અથવા એક વધુ તીખા થઈ જાય તો તેમાં થોડો ટામેટાનો સોસ બેળવો.



- ★ દાળ - ચોખામાં જવાત પડતી રોકવા માટે તેમાં લસ ની કળી રાખી મૂકો.
- ★ દાળ અથવા એક બળી જવાના કાર્ય બળી ગયાની વાસ આવતી હોય તો બળેલી વાસ હટાવવા માટે ટામેટાના નાના ટુકડા કરી, સાથે જરાનો વધાર કરો - બળી ગયાની વાસ દૂર થઈ જે.
- ★ દાળમાં એક ચમચી તેલ અને હળદર નાખવાથી દાળ જલદીથી બફાઈ જે.
- ★ મગની દાળને રાત્રે પલાળી રાખી સવારે તેમાં બે લવીંગ નાખી રાંધવાથી દાળ હળવી અને પાચક બને.
- ★ દાળ, સંભાર, રસમ, સુપ, ગ્રેવી વિ.માં મીઠું વધારે પરી ગયું હોય તો તેમાં રાંધેલા ભાતનો ગોળો બનાવી ફેરવી દેવાથી વધારાનું મીઠું રોષાઈ જે.
- ★ દાળમાં ક્યારેક ભાજી નાખીને બનાવી જુઓ. દાળ સ્વાદિ લાગે.
- ★ દાળ વારંવાર ઉભરાઈ જતી હોય તો તેમાં એક ચમચી ધી કે તેલ નાખો.
- ★ દાળને ઘણું બનાવવા તેમાં ભાતનું ઓસાવેલું પા ને

નાખો.

- ★ એક, દાળ તથા કઠોળ રાંધતી વખતે તેમાં થોડા કોપરેલનાં ટીપા નાખવાથી તે ઓછા સમયમાં રંધાઈ જે તથા તેમાં રહેલા વિટામિનો પણ જળવાઈ રહે.
- ★ દાળ જલ્દી રંધાઈ જાય તે માટે તેમાં થોડું રાઈનું તેલ નાખો.
- ★ ફૂકરમાં દાળ બાફૃતી વખતે તેમાં અદ્યો ચમચો ધી નાખવાથી દાળ ફૂકરમાંથી ઉભરાઈને બહાર નહીં આવે.

#### કટી

- ★ કઢી બનાવતી વખતે તેમાં દહીના નાખી કઢી ઉકળે પછી મીઠું નાખવાથી દહીના ઝોંદા નહીં થાય.
- ★ અચાનક કઢી બનાવવી પડે તો તેમાં થોડી આંબલી નાખી કાય છે.
- ★ કઢીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેમાં એક લીલુનો રસ બેળવવાથી કઢીનો સ્વાદ તથા રંગ જળવાઈ રહે.
- ★ કઢીમાં નાખવાનાં કોફ્ટા મુલાયમ બનાવવા માટે તેમાં એક ચમચો બેંકિંગ પાવડર બેળવો.

#### ચોખા

- ★ ચોખા રાંધતી વખતે તેમાં લીલુના રસના ટીપા તથા થોડું ધી ઉમેરવાથી ચોખા દૂધ જેવા સફેદ બને.
- ★ ભાત રાંધતા પહેલાં થોડીવાર મીઠાનાં પા મીંન પલાળી રાખ કે તો ભાત સફેદ બને.
- ★ ચોખા રાંધતા પહેલાં તેમાં લીલુના રસના ટીપા અથવા સરકો નાખવાથી - ઉમેરવાથી ચોખા ચોંટે નહીં.
- ★ ભાત બનાવતી વખતે તેમાં ફુદીનાનાં પાન અને ચપટી મીઠું નાખવાથી ભાતની સોડમ સરસ આવે.
- ★ ભાત રાંધતી વખતે પા ને ઉભરાઈને બહાર ન આવે

- તે માટે વાસ ની કિનારી પર ઘી અથવા તેલ લગાડો.
- ★ ચોખામાં તજનો એક ટુકડો નાખવાથી ચોખામાંથી સોડમ છૂટે.
  - ★ ભાત છૂટા બને તે માટે ચોખાને દસ મિનિટ પા મૈમાં પલાળી રાખો.
  - ★ ભાત વધુ રંધાઈ જે એવું લાગે ત્યારે ઉકળતા ચોખામાં થોડા તેલનાં ટીપા ઉમેરી દો.
  - ★ ચોખા રંધતી વખતે પા મૈ વધારે પડી જાય તો તેમાં એક બ્રેડનો ટુકડો મૂકી દો. વધારાનું પા મૈ પોષાઈ જો.

### ચોખા બાબત અન્ય જાણકારી

- ★ ચોખાને આખી રાત ખુલ્ખા રહેવા દઈ સવારે ચાળીને ઉભામાં ભરી લેવાથી તેમાં ધનેડા નહીં પડે તથા ચોખા ખરાબ નહીં થાય.
- ★ ચોખામાં લીમડો કે મેથીના પાન રાખવાથી ચોખા ખરાબ નથી થતા.
- ★ ચોખાને દીવેલથી મોઈને રાખવાથી ચોખા આખા વર્ષ સારા રહે છે.
- ★ ચોખામાં થોડો ખાવાનો ચૂનો નાખી, સારી રીતે ભેળવીને ઉભામાં ભરી રાખવાથી ચોખા સારા રહે છે.
- ★ ચોખા સારા રાખવા માટે ચોખાના ઉભા વચ્ચે હળદરની નાની નાની પોટલીઓ મૂકી દો.
- ★ ચોખામાં કારેલાની સૂક્કવેલી છાલ ભેળવીને રાખવાથી તેમાં જીવાત - ધનેડા નહીં પડે.
- ★ ચોમાસામાં ચોખાના ઉભામાં બ્લોટીંગ પેપર પાથરી દેવાથી ચોખામાં બાચકાં નહીં લાગે.

### ચોખાનું જીવાતથી રક્ષણા

- ★ ચોખામાં જીવાત ન પડે તે માટે ૧૦ કિલો ચોખામાં ૧૦ લાલ સૂકા મરચા મૂકી દો.
- ★ ચોખાના ઉભામાં પાતળા કપડામાં હળદરનો ગાંઠિયો બાંધી મૂકવાથી તેમાં જીવાત નહીં પડે.
- ★ નવા ચોખામાં મીઠાના ગાંગડા રાખવાથી તેમાં જીવાત નહીં પડે.
- ★ ચોખામાં મરીના દા માં રાખી મૂકવાથી પ તેમાં

- જીવાત નથી પડતી.
- ★ ચોખાને થોડું એરંડિયું ચોપડી રાખવાથી તેમાં લાંબા સમય સુધી જીવાત નથી પડતી.
  - ★ ચોખામાં તમાલપત્ર રાખવાથી પ તેમાં જીવાત નથી પડતી.
  - ★ ચોખાને સરળતાથી દળવા માટે દળતા પહેલાં ચોખાને તવા પર કે દો.
  - ★ ભાત રંધ્યા પછી એમાંનું વધારાનું પા મૈ ફેંકી દેવાથી ચોખામાંથી પોષકતત્ત્વો નીકળી જાય છે.

### ખીચડી

- ★ ખીચડી બનાવતી વખતે તેમાં લીલા કે ભાજ મેળવવાથી ખીચડી વધારે સ્વાદિ લાગે છે.
- ★ વધેલી ખીચડીમાં સ્વાદ અનુસાર પૂર બનાવી લોટ ભેળવી કચોરી બનાવી કાય છે.
- ★ સાબુદા ની ખીચડીમાં ચપટી મરીનો ભૂકો નાખવાથી ખીચડી સ્વાદિ બને છે.
- ★ સાબુદા ની ખીચડીમાં કરકરા સાંગદા માં નાખવાથી તે સ્વાદિ તો બને, સાથેસાથે દેખાવે પ ગમે.

### પુલાવ

- ★ પુલાવ પર સુ રોમિત કરતા કાંદા કિસ્પી રાખવા માટે તેમાં કાંદા સાંતળી તેમાં એક ચમચી સાકર નાખવાથી કાંદા કરકરા રહે.
- ★ પુલાવને બ્રાઉન રંગનો બનાવવા માટે એક ચમચી સાકરને ગરમ તેલમાં ઓગળે ત્યાં સુધી સાંતળી લીધા પછી આ ઓગળેલી સાકર પુલાવમાં ભેળવી દો.

### પોંચા

- ★ તળેલા પોંચાના ચેવડામાં એક ટી-સ્પૂન ચાટ મસાલો ઉમેરવાથી ચેવડો સ્વાદિ બને.
- ★ પોંચામાં લાલ મરચાની જગ્યાએ બે-ત્ર લીલા મરચા જી મારીને નાખવાથી પોંચા વધુ સ્વાદિ બને.
- ★ રાતના વધેલા ભાતમાં થોડા પલાળેલા પોંચા, વધારેલા બટાટા તથા સ્વાદ અનુસાર મસાલો નાખવાથી સ્વાદિ વાનગી બને.

## કલરવ

● દિનેશ માંકડ - અમદાવાદ ●

### ટોક વિચા ટાબરીયા

કેમ છો બધા? દિવાળીમાં મજા કરી ને? નવા કપડાં, ને ચટાકેદાર વાનગી ને અવનવી આત બાજુ. દોસ્તો, દુનિયા આખીમાં તહેવાર તો બધે ઉજવાય છે પ તહેવારોનું વૈવિધ્ય તો આપ જ ભારતમાં જ. નવરાત્રીમાં ગરબા, તો ઉત્તરાય માં પતંગ, હોળીમાં ગુલાલ - મજા જ મજા. પ મિત્રો, આપ એક પર્વ કુંક નવું જ ઐખ્યી જાય છે. એમાંથે દિવાળી પછી આપું નવું વર્ષ રૂ થાય. તમારામાંના કોઈને કદાચ ગુજરાતી મહિનાના પૂરા નામ પ ખબર નહિ હોય. પ વાંધો નહિ. નવું વર્ષ રૂ થયું એ તો ખબર છે ને? બધાને Happy New Year તો કહ્યું છે ને? જગતના બધા જીવોમાં મા સને ભગવાને વિષ રીતે બુધ્યિ આપી છે - વિચારવાની, નિય લેવાની અદ્ભુત કિંત આપી છે. અને એટલે જ મા સ ધારે તે બની કે, બનવાનો પ્રયત્ન કરી કે. નવું વર્ષ રૂ થાય, તેની યાદગીરીમાં તમે એક કલરવ મિત્ર કોઈ એકાદ નિય - સંકલ્પ લઈ ન કો, જે તમારા આગળ વધવામાં ઉપયોગી થાય? દા.ત. ગૃહકાર્ય, જ્ઞાનેથી આવીને તરત કરી લેવું, કે દરરોજ મમ્મી પણ્ણાને સવારે ઉઠીને પગે લાગવું કે વિરીયો - મોબાઇલ ગેઈમ દિવસમાં ફક્ત અડ્ધો કલાક જ રમવા. ટી.વી. ચેનલ પ નક્કી સમય પૂરતી જ જોવી વગેરે, વગેરે... યાદી તો મોટી થાય, પ તમને ગમતો અને અમલમાં મૂકી કાય તેવો જ સંકલ્પ લેવાનો. બોલો, નક્કીને? તમને પોતાને રૂમાં તકલીફ પડે, પછી તો ખરેખર મજા પડે! કરો આંખો બંધ, ને સંકલ્પ કરો નક્કી! થેંક્યુ.

### ગૌરવ ગાથા

એમનું નામ ખુ લુ તલક હે. એટલે કે ભારત દે ના મોટા ગજાના અર્થ જીવી પ્રો. કે.ટી. હે. મૂળ વતન કચ્છ માંડવી. દે ભરમાં અર્થ જીવમાં નામ કાઢ્યું. આપ હે દે આજાદ થયો પછી દે ના અર્થતંત્રને સારી રીતે ચલાવવા આયોજન પંચની રચના થઈ. ઈ.સ.

૧૯૫૦ના માર્ચ માસમાં રચાયેલા દે ના આ પ્રથમ આયોજન પંચના અથ્ય. હતા પંતિ જવાહરલાલ નહેરુ અને પ્રથમ જનરલ સેકેટરી હતા આપ. પ્રો. કે.ટી. હે. દે ની પ્રથમ લોકસભામાં પ દે ની ના ઝીય બાબતોની ચર્ચામાં તેઓ એક પ માં હોવા છતાં દે ને થોડીક નુકસાનકારક આર્થિક વાત હોય તો તેઓ સૌની વચ્ચે વિરોધ કરતા. સ્પ વક્તા હતા. દે ના અર્થતંત્રને રૂઆતમાં ગતિમાં લાવનાર આ કચ્છી સપૂત્રને નમસ્કાર.

### નાની વાત - મોટો બોધ

એક મોટું ગાઢ જંગલ. બધા પ્રકારના પ્રાણીઓ મોજથી રહે. ખાય, પીએ અને મજા કરે. એમાં કરી નામે એક બકરી. સ્વભાવે સાવ ભોળી. સૌ સાથે હળીમળીને રહે. સૌને સારા માને. તેનો કોઈ દુષ્મન જન્હી.

ચોમાસાની જતુ. એક દિવસ સાંજના સમયે સૌ પોતાના ઘર ભે જતા હતા. કરીબેન પ ઘર તરફ આવતા હતા. અચાનક વરસાદ તૂટી પડ્યો. કરીએ દોડવાનું રૂ કર્યું. અચાનક હંતિ રીછ આવી. તે ખૂબ ધુજતી હતી. તેના રૂછ માં ખૂબ પા હે ભરાઈ ગયા હતા. તે ધુજતા અવાજે કરીને કહ્યું, 'મારું ઘર તો જંગલના સામે છેઠે છે. હું કેમ જઈ?' ભોળી કરીએ તરત જ કહ્યું, 'અરે, આજે રાત્રે મારે ઘેર રાતવાસો કરો.' હંતિ રીછ તો તૈયાર થઈ ગઈ અને કરી સાથે તેને ઘેર આવી. કરીનું ઘર તો તેને એવું ગમી ગયું કે ન પૂછો વાત. વરસાદ તો સતત વધતો રહ્યો. બીજો દિવસ - ત્રીજો દિવસ. બધા પ્રાણી ઘરમાં ભરાઈ રહ્યા. કરીના પડો હે પ્રાણીઓને કરી સાથેની આ રીછ ને જોઈને નવાઈ લાગી. સૌએ પૂછ્યું તો કરીએ માંડીને વાત કરી. મીઠા બોલી હંતિ રીછ તો સૌ સાથે હળી ભળી ગઈ. પ વરીલ એવા મહિષ પાડાએ કરીને બોલાવીને ખાસ કહ્યું, 'જો કરી, અજી હે વ્યક્તિ સાથે વધારે વ્યવહાર ન વધારાય. વધુ પડતો આંધળો વિશ્વાસ ક્યારેક ઠગારો નીવડે છે, સંભાળજે.' આ બાજુ વરસાદ તો હવે રહી ગયો પ હંતિ રીછ ને કરીનું મોટું વિણ

ઘર ગમી ગયેલું. તેનું મન ઉણક્યું હતું. બહારથી મીહું મીહું બોલી, તે કરીને એવી તો ભોળવી લીધેલી કે કરી હતી રીછ નું બોલતું બધું જ સાચું માની લેવા માંડી. હતીએ ખોટા ખોટા બહારના કાઢીને પોતાના પથારા પાથરી દીધા હતા.

એક દિવસ હતી રીછ, કરી બકરીને નદી કિનારે ફરવા જવાની વાત કરી. બંને નદી કિનારે આવ્યા. રીછ લાગ જોઈને કરીને નદીમાં ધક્કો માર્યો. અ ધાર્યા ધક્કાથી કરી તો નદીમાં ડૂબવા લાગી. હતી રીછ તો દોડતી કરીને ઘેર આવી. તે કરીના ઘરને પચાવી પાડવાના આનંદને અંદર છૂપાવી, કરીના પડો ઐઓ પાસે જુદ્ધા ચલાવ્યા કે, ‘કરીને જગલનો ભૂખ્યો વાધ ખાઈ ગયો વગેરે.’ સૌ નિરા થયા. હતી રીછ તો કરીના ઘરમાં આવી નાચવા લાગી.

નદીના છેડે આવેલા મંહિરમાં મહિષ પાડો દ ન કરવા આવેલો. તે ઓચિંતા જ નદીમાં કોઈ ડૂબેલાના પગને બહાર ડોકાતા જેયા. તે તો વગર વિચારે છલાંગ મારી, ડૂબતા પ્રા ઐને બચાવવા નદીમાં પડ્યો ને ખબે નાખી બહાર લાવ્યો. ‘અરે આ તો આપ એ કરી બકરી! તે કરીના પેટમાંથી બધું પા ની કાઢ્યું. કરીએ સ્વસ્થ થઈને બધી વાત કરી. મહિષ પાડાએ તરત જ યાદ અપાયું, ‘મેં તો તને પહેલેથી ચેતવેલી. અજાણ્યા સાથે ખાતરી કર્યા વગર વ્યવહાર ન કરવો. જોયું ને?’ બંને ઘેર ગયા. સૌ કરીને જોઈને ખૂબ ખૂબ રાજી થયા ને ઉપક્યા હતી રીછ પર હુમલો કરવા. સૌને એક સાથે જોઈ હતી રીછ ને નવાઈ લાગી. થોડી ગભરાઈ પ ખરી. ત્યાં તો તેની નજરે કરી બકરી ચડી. તેને સમજાઈ ગયું કે તેનો ભંડો ફૂટી ગયો છે. સૌ પ્રા ઐઓએ અવનવો મેથીપાક હતી રીછ ને ચખાડ્યો અને તેને ઊભી પૂછ્યાએ એવી તો ભગાડી કે કદી આ બાજુ જોવાનું નામ જ ન લે!

## શું તમે જણો છો?

નવા વર્ષની રૂઆત થઈ છે. એટલે આપ જ વું જ જોઈએ. નવું વર્ષ એટલે રાજી વિકમાદિત્યના નામ પરથી ઓળખાય છે તે વિકમ સંવત ૨૦૧૧નો ગ્રાંબ. દરેક માસ ત્રીસ દિવસનો હોય એટલે વર્ષ ૨૬૦ દિવસનું હોય. મહિનાના નામ આપ. ન ત્રાત્ર પરથી જ પડ્યા છે. કારતક, માગ ૨, પોષ અને મહા માસ એટલે ચિયાળો. ફાગ, ચૈત્ર, વૈ લખ અને જેઠ એટલે ઉનાળો.

અને અખાઢ, શ્રાવ, ભાદરવો અને આસો એટલે ચોમાસું. તમને આ બધી ખબર તો હતી ને?

## Health is Wealth

ચિયાળાની રૂઆત થાય છે, બરોબર? રીરમાં રુહુરી લાવવી છે ને? આજે વાત માલી ની કરવી છે. તમારામાંના કેટલાક મમ્મીના કહેવાથી કરતા હો? ન કરતા હો તો રૂ કરો. સરસવ કે તલના તેલને આંગળી પર લઈને હાથ, પગ, મોઢા પર બને તેટલો વધારે સમય માલી કરો. અને પછી સાન કરો. એવી તો મજા પડે કે ન પૂછો વાત. ખૂબ જરૂરી અને કાયમી ટેવ પાડવા જેવી વાત છે. ચાલો, કાલથી રૂ... બરોબર...?

## મગજ કસો, નાહીં તો ખસો....

બાળ દોસ્તોએ મગજ કસવાનું બંધ કર્યું છે કે તુ? કોઈપ બાળકો પ્રત્યુત્તર આપતા જ નથી. તુ વાત છે? લાગે છે કે ઘરમાં વડીલો, કચ્છશ્રુતિનો કલરવ વિભાગ ઘરના બાળકોને વાંચવા માટે પ્રેરતા નથી. તો તુ કરવું? બોલો. કો વાંધો નહિ. આ રહ્યા આ વખતના કોયડા.

૧. ઠી ઈનો ઉપયોગ કરીને જવાબ ૧ (એક) મેળવી આપો. રત એટલી જ કે બધી જ સંખ્યા એક - એક વાર જ વાપરવાની.
૨. એવી ચાર આંકડાની કઈ સંખ્યા છે, જેને ૮ (નવ) વડે ગુ તા આંકડા ઉલટા (દા.ત. ૧, ૨, ૩, ૪ ને બદલે ૪, ૩, ૨, ૧) થઈ જાય?

## હસ્યા તો ફસ્યા

મમ્મીએ ચીન્ટુને ઉબલ રોટીનો પાંવ દૂધમાં નાંખીને ખાવા આપ્યો. થોડીવાર પછી નાનો ચીન્ટુ રડવા લાગ્યો. મમ્મીએ કાર પૂછ્યું તો કહે, ‘દૂધ તો રોટીનો પાંવ પી ગયો. હવે હું તુ પીવું?’



**શેઠાણી (નવા નોકરને)** : અમારું ઘરકામ કરવામાં તને ખાસ વાંધો નહિ આવે. પરંતુ એ ગમે ત્યારે ગમે તેટલા મહેમાનને જમવા લઈ આવે છે. તે માટે તારે તૈયાર રહેવું પડે.

**નોકર** : કાંઈ વાંધો નહીં. સાથે સાથે તમે પ મારો ડિસાબ તૈયાર રાખજો ને હું મારો સામાન પ તૈયાર રાખ્યો.

## શાંદ શોધ : ૩૧

● પ્રદીપ જોશી - આદિપુર ●

	૧	૨	૩	૪	૫
૬		૭			
				૮	૯
૧૦				૧૧	
			૧૨		૧૩ ૧૪
૧૫				૧૬	
૧૭		૧૮		૧૯	૨૦
		૨૧		૨૨	
	૨૩				૨૪

### “મ” સ્પેશિયલ

(નોંધ : તમામ ચાવીના ઉકેલ મ, મા, મિ, મી વગેરેથી શરૂ થાય છે.)

### આડી ચાવી

- ૨. પણાના સાળા (૨)
- ૪. લેપ, મર્દન (૩)
- ૬. ભારતના એક વડાપ્રધાન (૭)
- ૮. “ \_\_\_\_\_ કુલક ઠી ” – એક અભિનેત્રી (૩)
- ૧૦. એક ફળ (૩)
- ૧૧. ચંબલની ખી ના નામીયા ડાફુઓ :  
માધોસિંહ, \_\_\_\_\_ સિંહ, સિક્કો (૩)
- ૧૨. ખારા તેમજ મીડા પા નું ગરોળીના દેખાવનું  
એક મોટું હિસ્ક ગ્રા ઠી (૩)
- ૧૩. સંઘરી રાખેલું પ્રાચીનકાળનું મહંદું (૨)
- ૧૪. અવતારી પુરુષ ઠી પ્રિસ્ટ (૩)
- ૧૬. માતા, બા, જનની (૧)
- ૧૭. મહિનો (૨)
- ૧૮. રહેઠા નું ગામ કે નગર, ઉતારો, પડાવ, ટાંકિર (૩)
- ૨૦. પણાના સાહુભાઈ (૨)
- ૨૧. નકુણ અને સહદેવની માતા (૨)
- ૨૨. વાતાવર, જે તે સમયની પરિસ્થિતિ (૩)
- ૨૩. રોટી, કપડા ઔર \_\_\_\_\_ (૩)

૨૪. ચૂંટ ને વખતે મતદાતા નું આપે? (૨)

### ભાની ચાવી

- ૧. કેસભાને અંતે બે મિનિટનું \_\_\_\_\_ પાળવામાં આવ્યું (૨)
- ૨. એક મહિનો (૨)
- ૩. “હું માનવી, \_\_\_\_\_ થાઉં તો ધું”, મા સ (૩)
- ૪. મધમધતું, સુંધીદાર (૪)
- ૫. સેહ, માયા, પ્રેમ (૩)
- ૬. મનસ્તી, મનની ઈચ્છા પ્રમા કરનારું, આનંદી (૪)
- ૭. સાડા ગ દાયક પૂર્વે મશ્શુ તેમ ફાટા કર્યું હેર તેનો ભોગ બન્યું હતું? (૩)
- ૮. મર્મ, રહસ્ય, ગુમ અર્થ (૩)
- ૯. આકર્ષક કળા માટે જ હેતું પણ (૨)
- ૧૧. બાદ હીના સમયનો ચાંદીનો રૂપિયો (૫)
- ૧૨. વિચાર I, વિમ ‘ (૩)
- ૧૪. ધું, પુષ્પ (૨)
- ૧૭. કંધના કુલદેવી આઈ આ પુરા માના મંદિરે જતાં પદ્યાત્મોમાં ગુજરો નારો – “જ્ય \_\_\_\_\_” (૩)
- ૧૮. આજે ધ I પરિવારોમાં માતા પોતાના બાળકોને મમ્મીની જ્યાએ ફે નમાં “ \_\_\_\_\_ ” કહેતા ખેલે છે (૨)
- ૨૦. વહા ને દોરનાર નાવિક (૩)
- ૨૧. અહંભાવ, અસ્મિતા, ગૌરવ, ટેક, સ્વમાન (૨)

### શરીર સારું રાખવા માટે અગત્યનાં સૂચનો

- ★ ફોનનું રિસિવર ડાબા કાન પર રાખીને ફોન પર જવાબ આપો.
- ★ એક ટિવિસમાં કોઝી બે વખત પીવાનું કર નહીં.
- ★ કોઈપ પ્રકારની ગોળી (દવા) ઠંડા પા ને સાથે લે નહીં.
- ★ સાંજના પ વાગ્યા બાદ વધુ પ્રમા માં ખોરાક લેવો જોઈએ નહીં.
- ★ તમે જેટલા પ્રમા માં પાચન કરી કો, તેટલો અને તેવો જ ખોરાક લે નહીં.
- ★ રાત્રિ કરતાં સવારના વધુ પા ને પીવાનું કર નહીં.
- ★ હેન્ડ ફોનના ચાર્જરસ્થી દૂર રહેવાનું પસંદ કર નહીં.
- ★ હેડ ફોન / કાન ફોનને વધુ સમય વાપર નહીં.
- ★ રાત્રિના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી નિદરનો સારો સમય હોય છે.
- ★ સૂતા પહેલાં દવા લઈને તરત જ લાંબા પડવું નહીં.
- ★ જ્યારે ફોનની બેટરી છેલ્લા શ્રીડ સુધી આવી હોય ત્યારે કોલનો જવાબ આપવાનું ટાળવું જોઈએ.



પુનિત પ્રબોધચંદ્ર ઠક્કર

૯૯૯૯૯૮૮૮૮૮૭

૯૨૯૦૯૦૨૭૭

“જ્ય જલારામ”

મણિનગરના પ્રખ્યાત

# કણાવતી™ દાબેલી સેન્ટર

અમારી બીજી કોઈ શાખા નથી. નકલથી સાવધાન



“મહેમાનનું માન  
સેન્ટ્રીઓનું સન્માન  
કણાવતીની દાબેલીથી જ શોભે”

૧, રાધા મંદિર કોમ્પ્લેક્સ, હીરાભાઈ ટાવર સામે, ઉત્તમનગર,  
મણિનગર, કણાવતી-૩૮૦ ૦૦૮. ફોન. (ઓ) ૨૫૪૭૦૦૮૬

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે  
પ્રસ્તુત કરીએ ભરોસાપાત્ર અને ઉત્તમપ્રવાસ  
કન્સલ્ટન્સી

- Domestic and international flight tickets
- Domestic and international individual and or group packages
- Rental car services anywhere in the world
- Foreign exchange
- Visa consultancy
- Education abroad



**Relyxcel Travel Consultant**

**Rest At Best Rate**

Contact:

**Pooja Thakkar**

21 Shiv Complex, Isanpur Bus Stop



Uttam Nagar Maninagar

Ph. 079-32214002 M. 7818884440

REGD. NO. GAMC/1028/2012-14 VALID UPTO 31-12-2014, R.N.I. 46515/87, DATE : 16-3-88  
POSTED AT P.S.O. AHMEDABAD ON 15TH OF EVERY MONTH

*Let's Do the Best Furniture With.....*

**:- AUTHORISED DISTRIBUTOR & DEALER :-**



**:- Also Available :-**

- Teak Wood
- MDF
- Liner Laminate

- Flush Door
- Veneer
- Door Skin

Amit Surani (Patel)  
98244 79923



Brijesh Patel  
96240 30203

## **RAVI ENTERPRISE**

Sahakari Lati Bazar, Zone-2, B/h. Gita Mandir, Nr. S.T.Stand, Ahmedabad-22. Gujarat, INDIA.  
Telefax : (0) + 91-79-25399423  
E-mail : [ravienterprise\\_004@yahoo.co.in](mailto:ravienterprise_004@yahoo.co.in)

Printed & Published by Shri Kailasdan K. Gadhvi, President, Shri Kutchhi Samaj – Ahmedabad on behalf of Shri Kutchhi Samaj - Ahmedabad. Printed at Madhavi Offset, Khokhara, Ahmedabad. Published at Shri Kutchhi Samaj Karyalaya, 905, Span Trader Centre, Opp. Kocharab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad-380 006 Editor : Shri Bharat Oza. Price : Rs. 3.00 Lifetime Subscription : Rs. 1500/-